https://archive.org/details/bk151/page/n0/mode/1up

1995-07-12 -Bhajnavali (151)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

ભજનાવલિ

શ્રી અથર્વવેદી સતપંથ સેવાશ્રમ

જાડિયા (મોટા) તા. નખત્રાણા, જિ. કચ્છ.

realpatidar.com

https://archive.org/details/bk151/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.06 17:25:34 +05'30'

realpatidar.com

ભજનાવલિ

ૐ

શ્રી અથર્વવેદી સતપંથ સેવાશ્રમ

જાડિયા (મોટા) તા. નખત્રાણા, જિ. કચ્છ.

realpatidar.com



શ્રી ઉમિયા માતાજી

realpatidar.com

https://archive.org/details/bk151/page/n4/mode/1up

1995-07-12 -Bhajnavali (151)

realpatidar.com

ॐ

ભજનાવલિ

:પ્રકાશક:

આચાર્યશ્રી સવગણદાસજી મહારાજ

અધ્યક્ષશ્રી

શ્રી અથર્વવેદી સતપંથ સેવાશ્રમ

કાદિયા (મોટા) તા. નખત્રાણા, જિ. કચ્છ.

ટ્રે. ર. નં. ૧૪૨૭ તા. ૨૨/૩/'૯૦

ગુરૂપૂર્ણિમા
સવંત : ૨૦૫૧

તા. ૧૨/૭/'૯૫
ઈ. સ. ૧૯૯૫

Printed at **SURYA OFFSET**, Ambli-380058

realpatidar.com

realpatidar.com



અ. નિ. પ. પૂજ્ય આચાર્યશ્રી માવજીદાસજી મહારાજ

જન્મ વિ. શા. ૧૯૬૨, અષાઢ સુદ ૭ સોમવાર

અ. નિ. વિ. શા. ૨૦૩૧, માગસર વદ ૯ સોમવાર

realpatidar.com

https://archive.org/details/bk151/page/n6/mode/1up

realpatidar.com



આચાર્યશ્રી સવગણદાસજી મહારાજ

realpatidar.com

https://archive.org/details/bk151/page/n7/mode/1up

realpatidar.com

પ્રકાશકનું નિવેદન

પરમ પુજ્ય શ્રી માન આચાર્ય ગુરૂવર્ય પૂ. *શ્રી માવજીબાપા* ના ઘણા શિષ્યો અને ભાવિક ભક્તોની ઘણી માંગ હોવાથી ભક્તોએ આ નાની સરખી પુસ્તિકા લખવાનું સાહસ કર્યું છે.

આ પુસ્તિકા વાંચી વાંચકો પોતાના જીવનને સદ્‌ભાગી બનાવે એજ અભ્યર્થના. વાંચક સજ્જનો કોઈ શબ્દાર્થ અગર લીપીમાં ક્યાંય ક્ષતી રહી ગઈ હોય તો આપ સૌ સજ્જન વાંચકો મને ક્ષમા આપશો.

આપણા સંતોએ રચેલા અને નિત્ય ગવાતાં ભજનોને સંકલિત કરી અને ભજનાવલી રૂપે પ્રગટ કરવાનું સાહસ કર્યું છે.

આ પુસ્તક વાંચી વાંચકોસાર તેમના જીવનમાં ઉતારે અને જીવન સદ્‌ભાગી બનાવે તેવી અભ્યર્થના અસ્થાને નથી.

આ ભજનાવલી પ્રસિદ્ધ કરવામાં જે નામી અને અનામી ધર્મપ્રેમી સજ્જનોએ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદ કરી છે, હૂફ આપી છે તે સર્વનો ખરા અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

અંતમાં સદ્‌ગુરૂશ્રી સર્વેને સદ્‌બુદ્ધિ આપે અને વેદ ધર્મનો નવ ખંડમાં જય જયકાર હો, એજ અભ્યર્થના.

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની જય.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n8/mode/1up

realpatidar.com

પ્રસ્તાવના

શ્રી પરમાત્માએ આ જગતના જીવોને ભિન્ન-ભિન્ન પ્રકારે સ્વકર્માનુસાર બુદ્ધિધન આપેલું છે. સર્વને ત્યારે સ્વકર્મ પ્રેરિત જીવને ક્યારે કોઈ પરમહંસની દ્રષ્ટિનું કીરણ કોઈ પાત્ર જીજ્ઞાસુના હૃદયમાં પહોંચે છે ત્યારે તે સહ પાત્ર બને છે. આ સુપાત્ર પરમહંસો પોતાના આત્માનું કલ્યાણ કરી અને આ જગતના પામર જીવોને મોહ-માયાના ચક્રમાંથી બહાર કાઢવા પરમાર્થ કરે છે.

આ જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે.

આવા પરમહંસ પરમકૃપાળુ પૂજ્ય ***શ્રી માવજીબાપા*** એક મહાન પવિત્ર ધર્માત્મા હતા. પોતાના જીવનને સુખ યા દુ:ખનો ભાર વહન કરી જગતના કલ્યાણ માટે પોતાની સારી જિન્દગી વીતાવી ઘણાને ભક્તિના માર્ગે વાળ્યા. આવા સંતોનો આગળના ઇતિહાસમાં જોઇએ તો કબીર સાહેબ, તુકારામ, નરસિંહ મહેતા, મીરાંબાઈ વગેરે જેવા આવા ઘણા સંતો, મહંતો આ વિશ્વમાં પ્રકાશિત દીવા પોતે સ્વયમ સિદ્ધ બીજાને પ્રકાશ આપી જીવનને સિદ્ધ કરી ગયા છે.

વૃક્ષ કદી ના ફળ ભખે સરીતા સંચે ના નીર
પરમાર્થના કારણે મારા સંતો ધસે શરીર

જેમ અગરબતી પોતે જલતી જાય અને બીજાને સુગંધ આપે છે, દીવેટ પોતે બળીને બીજાને પ્રકાશ આપી અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે સંત પુરુષો પણ દીવાદાંડી રૂપી બનીને આ જગતના જીવોને ઇશારો આપે છે.

સંતોના આવા ઇશારાની સાન કોઈ મુમુક્ષ હોય તેજ સમજી શકે છે. અને પોતે પોતાના જીવનને સદ્ભાગી બનાવે છે. જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે. મનુષ્યમાંથી દેવ બને છે અને મનુષ્યમાંથી દાનવ પણ બને છે. સાર અને અસાર મિશ્ર છે. અજ્ઞાની જીવો કુમતી-કુબુદ્ધિનો સંગ થવાથી સત્યના માર્ગથી વંચિત રહે છે અને ઘણો દોશ વહોરી લેછે. અંતે યમ યાતના ભોગવવી પડે છે. ચાર ખાણોમાં ભટકી-ભટકીને પાપીના ઘેર જનમ લેછે. આમ આ સૃષ્ટિકાળના નીયંતાએ રહેટ માળની જેમ આ ક્રમ સરજ્યો છે. તેમાં જાગસે કોઈ હરિજન બધી ભુલવણીની વાત છે. આવા કલી કાળમાં સત્યના માર્ગો આડા રસ્તે જાય છે. આડંબર અને પાખંડ સ્વઇચ્છા પ્રમાણે મનુષ્યો ધર્મનાં આ ચરણો કરે છે. તેનું પરિણામ શૂન્ય આવે છે. ત્યારે આવા સંતો પોતે અડગ રહીને બીજાને અડગ બનાવે છે. *આવા મહાત્મા ગુરૂદેવ પૂ. માવજીબાપાનાં ચરણમાં કોટી કોટી પ્રમાણ.*

realpatidar.com

https://archive.org/details/bk151/page/n9/mode/1up

realpatidar.com

આચાર્યશ્રી સવગણદાસ મહારાજનો જીવન-ઈતિહાસ તથા તેમની પ્રવૃત્તિની આછી રૂપરેખા

"આપણો ભારત દેશ એટલે અધ્યાત્મિક સ્થાન, સંસ્કૃતિ ધરાવતો દેશ આ દેશની પવિત્ર ભૂમિ પર ભગવાન વિષ્ણુએ પણ મનુષ્ય અવતાર ધારણ કરીને ભારત દેશને ધન્ય બનાવ્યો છે. ભારતની ભૂમિ એટલે ભગવાન, સંતો, મહંતો, અને ભકતોનો દેશ. આવા પવિત્ર દેશના પશ્ચિમ ભારતનું ગુજરાત રાજ્ય એટલે હરિભકતો તથા સંતજનોની પાવન ભૂમિ. તેમાં કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર એટલે સાક્ષાત વ્રજભૂમિ. આવી પવિત્ર ધરતીમાં અનેક નામી અનામી સંતોએ અવતાર ધારણ કરીને ભૂમિને પાવન કરી છે.

આચાર્યશ્રી સવગણદાસ મહારાજનો જન્મ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના *સાંયરા*-યક્ષ મુકામે પાટીદાર કુળમાં પવિત્ર આત્મા શ્રીમાન *દેવજીભાઈ*ના ઘેર સવંત ૧૯૮૬ના મહાસુદ અગિયારસના શુભદિને થયો હતો. તેમનાં માતાજીનું નામ માનબાઈ હતું. બાળપણમાં સામાજિક કુરિવાજોનો તેઓ ભોગ બન્યા હતા. તત્કાલિન સામાજિક રિવાજો પ્રમાણે તેમનાં લગ્ન બાળપણમાં ૩ વર્ષની નાની વયે થયા હતાં. તેઓએ ફક્ત ગુજરાતી ૩ ધોરણનો અભ્યાસ કરેલ છે. ગૃહસ્થાશ્રમ શરૂ થાય તે પહેલાં ભગવાને તેમને તેમની સેવા માટેનું નિર્માણ કરી લીધું હોય તેમ તેમના ધર્મપત્ની સાથે સંસાર શરૂ કરે તે પહેલાં તેમને પોતાની પાસે લઈ લીધાં. તેર વર્ષની કુમળી વયે તેમના ધર્મપત્નીનું અવસાન થયું. ત્યાર બાદ આચાર્યશ્રીએ સંસારથી વેગળાં રહેવા માટે મનોમન નક્કી કરી લીધું અને તેઓએ બાદમાં લગ્ન ન કરવાનો દૃઢ સંકલ્પ કર્યો અને આજ પર્યંત બ્રહ્મચારી તરીકે તેમનું જીવન વિતાવે છે. સંસારમાં મા-બાપ વગેરેનું ઋણ ચૂકવવા માટે તેઓએ સાત વર્ષ સુધી ખેતીવાડીના ક્ષેત્રમાં નોકરી કરીને કુટુંબને સહાયરૂપ થયા ત્યાર બાદ અઢાર વર્ષ સુધી પશ્ચિમ બંગાળમાં હરિચંદ્ર સોમીલ મુકામે લાકડાની સોમીલ માં નોકરી કરીને કુટુંબને આર્થિક સહાય કરતા હતા. બંગાળથી આવ્યા બાદ તેઓ બત્રીસ વર્ષની ઉંમરે આચાર્યશ્રી માવજીદાસ મહારાજની સેવામાં જોડાયા અને તેમની સાથે જીવન પૂર્ણ કરવાનું મનોમન નક્કી કર્યું. સમર્થ સદ્‌ગુરૂના શરણમાં

realpatidar.com

https://archive.org/details/bk151/page/n10/mode/1up

1995-07-12 -Bhajnavali (151)

realpatidar.com
જઈ તેમણે આચાર્યશ્રી માવજીદાસ મહારાજ પાસે ગુરૂ-દિક્ષા લીધી. ગુરૂએ અમરમંત્રનો કુંપો પાયો એને પચાવીને સાર્થક કર્યો. ગુરૂ પાસે ગુરૂ - દિક્ષા લીધા બાદ ગુરૂ દક્ષિણામાં તેમણે પોતાનું જીવન આજીવન આચાર્યશ્રીની સેવામાં તથા આશ્રમના વિકાસ માટે સોંપી દીધું. તેઓ આચાર્યશ્રી માવજીદાસ મહારાજના સાનિધ્યમાં રહીને તેમની સાથે ગામો-ગામ - ધર્મોપચાર કરવા લાગ્યા. આચાર્યશ્રી માવજીદાસ મહારાજની સેવામાં અગિયાર વર્ષ સુધી રહ્યા બાદ તેમણે ગુરૂના આદેશથી સતપંથ પ્રેરણાપીઠ પીરાણા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદના સમર્થ શ્રી સદ્‌ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજની જગ્યાના તત્કાલિન ગાદીપતિ મહંતશ્રી સવજીદાસ મહારાજના હાથે ભગવાં વસ્ત્ર પરિધાન કર્યાં અને સંન્યાસી તરીકેનું જીવન શરૂ થયું. આચાર્યશ્રી સાથે તેમનું જીવન શાંતિથી પસાર થવા લાગ્યું. બંને ગુરૂ-શિષ્યની જોડી એટલે જાણે અષ્ટાવક્ર અને જનકરાજાની ગુરૂ-શિષ્યની જોડી જોઈ લ્યો. સાક્ષાત્ વ્યાસમુનિ તથા શુકદેવજીની માફક તેઓ દેદિપ્યમાન રીતે શોભવા લાગ્યા. ગુરૂ-શિષ્યના કર્મના બંધન તથા ઋણાનુંબંધ પણ એક સરખાં છે તેમ એક-બે ઘટનાથી ફલિત થાય છે. જીવનમાં ચડતી પડતી પણ સરખી છે. જે એક નિર્વિવાદ છે. તેમના ગુરૂ આચાર્યશ્રી માવજીદાસ મહારાજનું વૈરાગી જીવન પણ તેર વર્ષની ઉંમરથી શરૂ થયું. તેવીજ રીતે આચાર્યશ્રી સવગણદાસ મહારાજનું જીવન પણ ખરાઅર્થમાં તેર વર્ષની વયેથી શરૂ થયું. તેઓએ પણ સમાન નામવાળાં પવિત્ર માતાની કુખે જન્મ ધારણ કર્યો. બંનેનાં માતાનાં નામ પણ એક સરખાં માનબાઈ છે જે પણ એક જોગ સંજોગ છે. એવી પવિત્ર માતાની પવિત્ર કુખેથી સરખા કર્મવીર વિદ્વાન સંતો ઉત્પન્ન થયા તે પણ એક નિર્વિવાદ છે. આચાર્યશ્રી માવજીદાસ મહારાજના દેહાંત બાદ અથર્વવેદી આશ્રમના ગાદી પતિ તરીકે આચાર્યશ્રી સવગણદાસ મહારાજની નિમણૂક કરવામાં આવી . જે આજદીન સુધી નિર્વિઘ્ને આશ્રમનો વિકાસ અવિરત વધારતા જાય છે. આશ્રમના ટ્રસ્ટીઓની સુઝ-બુઝ અને સાથ-સહકારથી આશ્રમ અત્યારે ઉત્તરોતર પ્રગતિ કરતો જાય છે. આશ્રમમાં યાત્રિકોને કાંઈપણ અગવડ ન પડે તે માટે તેઓ સતત ચિંતિત છે. યાત્રિકોને રહેવા-જમવા-નહાવા-ધોવા માટે આશ્રમમાં ઉત્તમ સગવડ છે. આશ્રમ બે માળનું

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n11/mode/1up

realpatidar.com

મોટું વિશાળ રૂમો ધરાવતું મકાન ધરાવે છે. આશ્રમ પટાંગણમાં યાત્રિકો માટે વનફળોનાં સુંદર વૃક્ષોનો બગીચો છે.

અત્યારના સમયનુસાર આચાર્યશ્રી સવગણદાસજી મહારાજ દેશ-પરદેશનો પ્રવાસ કરીને ધર્મનો પ્રચાર કરે છે. તેમની પાસે ગુરૂની માફક પૂણજ્ઞાન તથા ભક્તિ હોવાથી સમાજના જિજ્ઞાસુ વ્યક્તિઓની ભુખ ભાંગવા માટે ચાલુ વર્ષ ભારતના પ્રખ્યાત સંતો-ભક્તો દ્વારા રચિત ભજનો-પ્રભાતિયાં વગેરેનો સંગ્રહ કરીને એકજ પુસ્તક રૂપે પ્રગટ કરાવવા માટે દૃઢ સંકલ્પ કર્યો છે.

આચાર્યશ્રી સવગણદાસજી મહારાજની આંતરિક સુઝ અને વિચક્ષણ બુદ્ધિના પ્રતાપે આશ્રમની પ્રવૃત્તિમાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે.

અચાર્યશ્રી સવગણદાસજી મહારાજની ગુરૂકૃપાથી તેમના શુભાવિશથી અનેક શ્રદ્ધાવાન ભક્તજનોનાં દુઃખ દૂર થાય છે. આજ રોજ ૭૦ વર્ષની વૃદ્ધ ઉંમરે પણ એક નવયુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ તથા હિંમત તેઓ ધરાવે છે. આશ્રમમાં અત્યાર સુધી તેમની સેવામાં કચ્છ આણંદસર મંજલના વતની ભક્તશ્રી કાનજીભાઈ ખીમજીભાઈ ચૌહાણ ઘણાં વર્ષો સુધી રહ્યા હતા. ત્યાર બાદ અત્યારે તેમના નાનાભાઈના ઘરેથી માતૃશ્રી પુરબાઈ હરજીભાઈ ચૌહાણ સેવાનો લાભ લઈ રહ્યાં છે.

માવજીદાસ મહારાજનું જીવન વૃતાંત

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિમ વતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્યતદાત્માનં સૃજામ્યહમ્ ॥

"આપણો ભારત દેશ એટલે અધ્યાત્મિક સ્થાન, સંસ્કૃતિ ધરાવતો દેશ આ દેશની પવિત્ર ભૂમિ પર ભગવાન વિષ્ણુ એ પણ મનુષ્ય અવતાર ધારણ કરીને ભારત દેશને ધન્ય બનાવ્યો છે. ભારતની ભૂમિ એટલે ભગવાન, સંતો, મહંતો, અને ભકતોનો દેશ. આવા પવિત્ર દેશના પશ્ચિમ ભારતનું ગુજરાત રાજય એટલે હરિભકતો તથા સંતજનોની પાવન ભૂમિ. તેમાં કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર એટલે સાક્ષાત વ્રજભૂમિ આવી પવિત્ર ધરતીમાં અનેક નામી અનામી સંતોએ અવતાર ધારણ કરીને ભૂમિને પાવનકરી છે. ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાના

realpatidar.com

https://archive.org/details/bk151/page/n12/mode/1up

realpatidar.com

રસલીયા મધ્યે એક અવતારી સંત મહાપુરુષે પોતાનો દેહ ધારણ કર્યો. રસલીયા ગામના પાટીદાર શ્રીમાન માનણભાઇ પટેલના ઘરે સ્વ. સદગુરૂશ્રી માવજીદાસ મહારાજનો જન્મ સવંત ૧૯૬૨ની સાલમાં અષાઠ સુદ - ૭ ને સોમવારે થયો હતો. ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણના નામનો પ્રચાર કાર્ય કરવા માટે પરમ ભક્ત માવજીદાસ મહારાજે જન્મ ધારણ કર્યો. માતાજીનું નામ રામબાઇ હતું. માતાજીના અવસાન બાદ પાલકમાતા બાલબાઈએ ઉછેરીને મોટા કર્યા. પહેલાંના સમયનુસાર સદગુરૂ માવજીદાસ મહારાજે ગુજરાતી ધોરણ-૨ (બે) સુધીનો અભ્યાસ કર્યો હતો. સામાજિક રીતરીવાજો મુજબ બાળપણમાં બાળલગ્ન થયાં હતાં, જે ગૃહસ્થાશ્રમથી એક કન્યાનો જન્મ થયો હતો.''

ભગવાન તેમના ભક્તોને જીવનમાં ઘણી જ તકલીફ તથા દુઃખ આપીને નીજ ભક્તોની કસોટી કરીને સાચા હિરા તરીકે સમાજમાં સ્થાપિત કરી, સમાજને અણમોલ રત્ન ભેટ આપે છે. આવી જ કસોટી સદ્ગુરૂશ્રી માવજીદાસ મહારાજના જીવનમાં આવી, જેમણે તેઓનું જીવન સંસારીમાંથી વૈરાગી બનાવી દીધું. ફકત તેર વર્ષની કુમળી વયે નળીયાગામ બાજુ ખેતીવાડીના કામકાજ અર્થે તેઓ ગયા ત્યારે તેમના શરીરમાં કોઇ અસાધ્ય રોગ લાગુ પડ્યો, જેને તેમના આખા જીવનની કરવટ બદલી નાંખી, અસાધ્ય રોગ થવાથી તેમનું શરીર સાવ પાંગળુ, અપંગ બની ગયું. ભાગવત ગ્રંથમાં જનકરાજાના દરબારમાં જે અષ્ટાવક્ર ઋષિનો પ્રસંગ આવે છે તેમાં અષ્ટાવક્રના શરીરના આઠે આઠ અંગ વાકાં થયેલ છે તેવું વર્ણન આવે છે. તેવી જ રીતે સદ્ગુરૂશ્રી માવજીદાસ મહારાજનું શરીર પણ અસલ અષ્ટાવક્રઋષિના જેમ આઠે આઠ અંગ વાકાં થઇ ગયાં અને બંને હાથમાં લાકડીની ઘોડીનો સહારો લઇને ચાલવા લાગ્યા. શરીરનાં કામિયાબ બનવાથી તેઓએ તેમનાં ધર્મપત્નીને રાજીખુશીથી સંસારમાંથી મુકત કર્યાં અને બાકીનું સમગ્ર જીવન એકાકી રીતે પસાર કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. ઘર નિર્વાહ ચલાવવા અશકિતમાન થવાથી સંસારમાં મોહ ન રાખતા બ્રહ્મચારી તરીકે જીવન વિતાવવા લાગ્યા. અને આઠેય પહોર ઇષ્ટદેવની ભકિતમાં જીવન વિતાવવા લાગ્યા.

realpatidar.com

https://archive.org/details/bk151/page/n13/mode/1up

realpatidar.com
કુટુંબીજનોને પોતાનો ભાર બોજારૂપ ન બને તે ઉમદા વિચારથી તેઓ ખરા ખંત અને ઉત્સાહથી દરજીકામ શીખીને કુટુંબને સહાયરૂપ થવા લાગ્યા. લગભગ પચ્ચીસ વર્ષ સુધી મુખમાં રામ નામ અને હાથથી દરજીકામ ચાલુ રાખ્યું. આમ સાદાઈથી ભકિતમય જીવન વિતાવવા લાગ્યા જેમ શબરીના ઘેર રામ પધાર્યા અને તેમના ભાગ્ય ઉઘડી ગયાં તેવી જ રીતે સદ્‌ગુરૂશ્રી માવજીદાસ મહારાજના જીવનમાં પણ આવી ધન્ય ઘડી આવીને ઉભી રહી, ભગવાન નહિતો ભગવાનના દાસ ભક્તશ્રી સદ્‌ગુરૂશ્રી ઈમામશાહ મહારાજ સંસ્થાન(પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ, જિ.અમદાવાદ) તત્કાલીન ગાદીપતિ સંતમહંતશ્રી રામજીદાસ મહારાજ કચ્છ મધ્યે પધાર્યા, તેઓ સદ્‌ગુરૂ શ્રી માવજીદાસ મહારાજને મળ્યા. તેઓએ સાચા હિરાને પારખી લઈને ગુરૂમંત્ર આપીને કંઠી બાંધી અને વિધિવત દિક્ષા આપી અને તેમણે માવજીદાસ મહારાજનું જીવન ધન્ય બનાવ્યું. સાચા સદ્‌ગુરૂનો હાથ તેમના મસ્તક ઉપર ફરી ગયો અને તેમનો ભાગ્યોદય થયો. ગુરૂદિક્ષામંત્ર લીધા બાદ તેઓનું જીવન દિવસો દિવસ પ્રભુભક્તિ તરફ ઢળવા લાગ્યું. કર્માનુસાર મનુષ્યને તેમના કર્મ ભોગવવાં પડતાં હોય છે. તે પ્રમાણે સદ્‌ગુરૂશ્રી માવજીદાસ મહારાજના પૂર્વના સંચિતકર્મના કારણે આજીવન અષ્ટાવક્ર ઋષિની જેમ જીવન વિતાવવું પડયું અને કર્મફળ ભોગવવા પડ્યાં. કાળક્રમે સત્કર્મોનો ઉદય થયો અને તેમનાં જીવનના ઉતરાર્ધમાં ભાગ્યનો પૂર્ણોદય થયો.

મનુષ્યનું નાશવંત શરીર ચારેકોર દુ:ખથી ઘેરાઈ જાય અને તમામ અંગો કામ કરતાં બંધ થાય તેમજ તમામ ઈન્દ્રિયો કાર્ય કરતી બંધ થાય છે, ત્યારે ભગવાન તેમના શરીરને એક ઈન્દ્રિય કાર્યાન્વિત કરે છે. જે મનુષ્યના કિસ્મતને બદલી નાંખે છે.

સદ્‌ગુરૂશ્રી માવજીદાસ મહારાજનું શરીર અષ્ટાવ્રક ઋષિની માફક હતું પણ તેમની એક ઈન્દ્રિય બહુજ સતેજ હતી. તેમની મુખેન્દ્રી એકદમ સરસ હતી. તેમના મુખમાંથી વાણી અમૃતની જેમ સદાય વહેતી હતી. તેમની વાણી સરળ, સમજાય તેવી, અવાજ એકદમ મીઠો જાણે કોયલનો ટહુકાર ન હોય ! મનુષ્યનું ભાગ્ય બદલાય છે, ત્યારે તેમના જીવનનું કલ્પનામાં ન ધાર્યું હોય તેવી વિરલ ઘટના બને છે. આવીજ એક વિરલ

realpatidar.com

https://archive.org/details/bk151/page/n14/mode/1up

realpatidar.com
ઘટના સંતશ્રી માવજીદાસ મહારાજના જીવનમાં બની જેણે તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરાવ્યો. એકવાર સમર્થ સદ્ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજની જગ્યાના તત્કાલીન ગાદીપતિ શ્રી રામજીદાસ મહારાજ ભગવાનશ્રી નિષ્કંલકી નારાયણના ધર્મોપચાર માટે નિશાન લઈને કચ્છ મધ્યે પધાર્યા ત્યારે તે સમર્થ સંત સાથે સદ્ગુરૂશ્રી માવજીદાસ મહારાજ પણ ધર્મપ્રચારના કાર્ય માટે જોડાયા. માવજીદાસ મહારાજ ઉપર મા સરસ્વતીની પૂર્ણકૃપા હોવાથી તેઓની વાણી નિર્મળ હતી.તેઓએ પ્રચારકાર્યમાં મુખ્યત્વે ધર્મ પુસ્તકનાં વાચક તરીકે સેવા બજાવી. ધાર્મિક પુસ્તકોનાં વાંચન દ્વારા ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. મા સરસ્વતીની પૂર્ણ કૃપા થવાથી તેમની વાણીમાં સાક્ષાત મા સરસ્વતી બીરાજતાં અને તેમની વાણી સાંભળીને લોક સમુદાય તન્મય બની જતો. સદ્ગુરૂશ્રી માવજીદાસ મહારાજ શરીરે જેમ અષ્ટાવક્ર પ્રકૃતિની જેમ હતા તેમ જ્ઞાનમાં પણ તેટલા જ નિપૂણ હતા. તેઓએ ફક્ત બે ચોપડીનો અભ્યાસ કર્યો હોવા છતાં પણ તેઓને ચૌદ વેદ (ચાર વેદ + ૧૦ ઉપનિષદો) તથા અઢાર પુરાણ વાંચેલ હતાં અને તે તમામ ગ્રંથોનું જ્ઞાન તેમને કંઠસ્થ હતું. સતસંગમાં તેઓ વેદ-પુરાણની વાણીનો લાભ પ્રજાજનોને આપતા હતા. (કુદરતી કરિશ્મા કહો કે જે કહો તે પણ સદ્ગુરૂ શ્રી માવજીદાસ મહારાજના શરીર પર ફક્ત માથાના વાળ તથા દાઢી-મૂંછ સિવાય એક પણ રૂવાટીવાળ ન હતાં તેમનું શરીર એકદમ રબ્બર માફક હતું.)

સંતશ્રી રામજીદાસ મહારાજ સાથે તેમની અમૃતમય વાણીથી કચ્છમાં ધર્મોપચાર કરીને ત્યાંના સ્થાનિક સમાજના લોકોનાં દિલ જીતી લીધાં અને તે સ્થાનિક સમાજના આગેવાનોએ ભેગા થઈને પીરાણાના તત્કાલીન ગાદીપતિ તથા કમિટિ સભ્યોને આપણા સમાજના આ સાચા હિરાને રાખીને સંતમંડળમાં સમાવવા માટેનો અનુરોધ કર્યો. સમાજના આગેવાનોની અરજ અને માવજીદાસ મહારાજના પવિત્ર જીવનથી પ્રસન્ન થઈને ગાદીપતિશ્રી રામજીદાસ મહારાજે તેમના શિષ્ય રવજીદાસ મહારાજને આદેશ આપ્યો કે માવજીભાઈને કચ્છ મુકામે ભગવા વસ્ત્ર ધારણ કરાવો અને આપણા સંતમંડળમાં તેમનો સમાવેશ કરાવો. ગુરૂના આદેશથી શ્રીમાન રવજીદાસ મહારાજે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કાદિયા મોટા ગામે ગ્રામજનોની હાજરી તથા કચ્છ સ્થાનિક

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n15/mode/1up

realpatidar.com

પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં ભગવાનશ્રી નિલકંઠી નારાયણના મંદિરના પ્રાંગણમાં વિધિવત્ ભગવાવસ્ત્ર ધારણ કરાવીને ખરા અર્થમાં સન્યાસી, વૈરાગી બનાવ્યા.

ભગવા વસ્ત્ર ધારણ કર્યા બાદ કચ્છ જિલ્લામાં ગામે-ગામ ફરીને સંતમંડળ સાથે ધર્મોપદેશ આપવા લાગ્યા. આમ કરતાં કરતાં ચર્તુમાસના ઉપવાસ તથા જપ કરવા માટે તેમણે કાદિયા મોટા ગામની ઉત્તર દિશાએ ગામની ભાગોળે એકાંત શાંત વાતાવરણ અર્થવવેદી આશ્રમની વિધિવત્ સ્થાપના કરી. આશ્રમનો વિકાસ જાત મહેનતથી કરવા લાગ્યા. ક્યાંય પણ કોઈની સહાય અને સાથ વગર આ આશ્રમના વિકાસનું તેઓ સતત ચિંતન કરીને કાર્ય કરીને આશ્રમનો વિકાસ કર્યો.

સદ્‌ગુરૂ માવજીદાસ મહારાજનું જીવન જીર્ણ અને વૃદ્ધ થવાથી સાયરા યક્ષ તા. નખત્રાણા ગામના રહીશ પાટીદાર કુળના શ્રી સવગણદાસભાઈ તેમની સેવામાં જોડાયા. તેમને ગુરૂ-દિક્ષા દઈને સાચી સેવા કરવાનો માર્ગ મોકળો કરી દીધો. સદ્‌ગુરૂ માવજીદાસ મહારાજ અને સવગણદાસજી મહારાજની ગુરૂ-શિષ્યની જોડ જાણે અષ્ટાવૃક ઋષિ અને જનક રાજાની માફક દિપવા લાગી સાક્ષાત્ વ્યાસમુની તથા શુકદેવજીની માફક શોભવા લાગી બંને ગુરૂ-શિષ્યની અમૃતવાણીનો લાભ સમાજના ધર્માભિમુખ લોકોને મળવા લાગ્યો. અગિયાર વર્ષ સુધી સવગણદાસ મહારાજે ગુરૂની તન-મનથી સેવા કરી બાદમાં ગુરૂજીની વૃદ્ધાવસ્થા થવાથી માવજીદાસ મહારાજને પોતાનું આયુષ્ય પૂર્ણ થવાના સંકેતો સાંપડતાં તેમના પ્રિય શિષ્ય શ્રી સવગણદાસ મહારાજને પીરાણા મુકામે ગાદીપતિના વરદ હસ્તે ભગવાં વસ્ત્ર ધારણ કરવાનો આદેશ આપ્યો. ગુરૂની આજ્ઞા મળવાથી સવગણદાસ મહારાજે વિધિવત્ પીરાણા મુકામે સન્યાસ ધારણ કરીને ભગવાં વસ્ત્ર પરિધાન કર્યાં. માવજીદાસ મહારાજને પોતાના આશ્રમના સંચાલન માટે યોગ્ય વ્યક્તિ મળી જવાથી તેમના આત્માને શાંતિ થઈ. સમયના પ્રવાહની સાથે ફરી એક વખત તેમના વૃદ્ધ શરીરમાં રોગ દાખલ થયો. તેમની બિમારી દિવસો દિવસ વધવા લાગી તેથી તેમને ભૂજ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. લગભગ ચાલિસ દિવસ સારવાર લીધી પણ કાંઈ જ ફેરફાર ન થવાથી મુંબઈ જશલોક realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n16/mode/1up

realpatidar.com

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં પણ ચાલિસ દિવસની સારવાર લીધી પણ કાંઈ જ ફેરફાર ન થવાથી કચ્છ મધ્યે પરત આવ્યા. દવાખાનામાં સારવાર લીધી. પરંતુ કોઈ જ ફેરફાર ન થયો એટલે બાપુએ રાત્રે ધ્યાનવસ્થામાં જોયું કે હવે મારો વખત પૂર્ણ થવા આવ્યો છે તેથી તેમને કચ્છ પરત જવાની રજા લીધી. સવંત ૨૦૩૧ના માગસર વદ પાંચમને ગુરૂવારના રોજ કચ્છના અંગિયા ગામે પરત આવ્યા. સદ્‌ગુરૂ માવજીદાસ મહારાજ સાથે સેવામાં અંગિયા ગામના રહીશ ભાણજીવાળા, દહેગામના રહીશ સંતશ્રી જેઠાબાપા જેવા મહાપુરૂષોએ ભોગ આપ્યો હતો અને સેવાનો અણમોલ લહાવો લીધો. અંગિયા આવ્યા બાદ તેમણે અંગિયાના વતની અને હાલમાં કચ્છ સમાજમાં કચ્છ કેસરી તરીકે ઓળખાતા ભક્તશ્રી ભાણજીભાઈને બોલાવ્યા અને ઉતરાયણ ક્યારે બેસે છે તેની માહિતી લીધી. સદ્‌ગુરૂ માવજીબાપાનું આજીવન બ્રહ્મચર્ય અવસ્થામાં વિત્યું હતું. પૂં. પૂર્ણ બ્રહ્મચર્યના પ્રતાપે ભીષ્મ પિતામહની માફક તેમણે પોતાનું મોત પણ ઉતરાયણ ઉપર પસંદ કર્યું હતું. ઉતરાયણ શરૂ થયું છે તેવી માહિતી મળતાં તેમને પોતાનો નશ્વર દેહ પોતાની કર્મભૂમિ કાદિયા મોટા મુકામે પડે તેવી ઈચ્છા દર્શાવી. તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમને કાદિયા અથર્વવેદી આશ્રમમાં સાંજના ૪ - ૦૦ કલાકે લઈ જવામાં આવ્યા, ત્યાં ગ્રામજનો સર્વ હાજર રહ્યા હતા. મહારાજશ્રીનો ગ્રામજનો સાથે મેળાપ થયો અને રાત્રે સમાજના પ્રતિષ્ઠિત છ વ્યક્તિની હાજરીમાં તેઓએ જાતે કહ્યું કે મારી મુદત હવે પૂરી થવા આવી છે. હવે મને કોઈ બોલાવશો નહિ મને મૌન ધારણ કરવા દેશો. આટલો આદેશ આપીને પોતે ધ્યાન-મુદ્રામાં બેસી ગયા અને બીજા દિવસે ઉગતા સોમવારે સવાપહોર દિવસ ચડ્યો ત્યારે અમૃતનો પ્યાલો પોતે પોતાના હાથે પીધો અને તેમનો પવિત્ર આત્મા પરમાત્મા સાથે વિલિન થઈ ગયો. (સવંત ૨૦૩૧ને માગસર વદ ૯ ને સોમવાર)

આચાર્યશ્રી માવજીદાસ મહારાજે પોતાના જીવનકાળ દરમ્યાન યોગવિદ્યા તથા ભક્તિના પ્રભાવે અનેક લોકોનાં દુઃખ દૂર કર્યાં હતાં. વાઝિયાં લોકોનાં વાંઝિયામેણાં ભાગ્યાં હતાં અને ઘેર પારણાં ઝુલાવ્યાં હતાં તેઓ પરિપૂર્ણ બ્રહ્મજ્ઞાની હતા. તેમના સમયમાં લોકોના મૂખે અમોને

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n17/mode/1up

realpatidar.com

સ્વાનુભવની અનેક વાતો, પરચા સાંભળવા મળ્યા છે. જેમાં તેઓ પ્રભુનો મહાપ્રસાદ પોતાના યોગબળથી સ્વયં હાજર કરીને લોકોને આપતા હતા. આવા પ્રસંગે યોગ્ય વ્યક્તિને સાનિધ્યનો લાભ આપતા. તેઓ તેમના ચમત્કારથી સદાય વેગળા રહેતા અને લોકોને ફક્ત પ્રભુમાં તથા ગુરૂમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને કામ કરવું તેવો ઉપદેશ આપતા હતા.

સદ્‌ગુરૂ માવજીદાસ મહારાજના અવસાન બાદ તેમના પટ્ટ શિષ્ય આચાર્યશ્રી સવગણદાસ મહારાજ કાદિયા મુકામે અથર્વવેદી આશ્રમનો સફળ વહીવટ કરે છે. આચાર્યશ્રીના આશ્રમમાં અત્યારે મુખ્ય ગાદિપતિનું સ્થાન આચાર્યશ્રી સવગણદાસજી મહારાજ શોભાવે છે. તેઓની આંતરિક સુઝ અને ગુરૂભક્તિના પ્રભાવે આશ્રમ દિનપ્રતિદિન પ્રગતિ કરે છે અને તેના વિકાસ માટે આચાર્યશ્રી સવગણદાસજી મહારાજ પૂરેપૂરો ભોગ આપે છે. આશ્રમમાં યાત્રિકોને રહેવા-જમવા માટેની ઉત્તમ સગવડ છે. બાગ-બગીચા સાથે આશ્રમ એક નંદનવન સરીનો દીપી ઊઠે છે. આ આશ્રમની મુલાકાત લેવી તે પણ જીવનનો એક અહોભાગ્ય લ્હાવો છે. આશ્રમમાં પ્રવેશ્યા બાદ જાણે નંદનવનમાં પધાર્યા અને મનમાં એકદમ શાંતિ અનુભવાય છે. આ આશ્રમની મુલાકાત લઈ સાચા સદ્‌ગુરૂના શરણમાં જઈ જીવન ધન્ય બનાવીએ. આવા પવિત્ર સંતોનાં જીવનચરિત્રો- વાંચી, સાંભળી અને તેમાનું કાંઈક આપણા જીવનમાં ઉતારવાથી આપણો આ અમૂલ્ય મનુષ્ય દેહ સાર્થક થયો ગણાય.

અસ્તુ !

આચાર્યશ્રી માવજીદાસ મહારાજની જય.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

અનુક્રમણિકા

realpatidar.com

https://archive.org/details/bk151/page/n19/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n20/mode/1up

realpatidar.com

સ્તુતિ

માત સરસ્વતી, મુજ રંક વિનતી
જ્ઞાન વાણી ઓચરૂં-મા આપસો મતિ. વેલ...

કર જોડીને કરગરૂંમા - કરજો મારી સહાય,
સદ્દબુદ્ધિ આપો મને - ગુરૂના ગુણ ગવાય માત...

નાવ મળ્યું ભવ સાગર તરવા - ઉત્તમ આ અવતાર,
પ્રાણ કુટી આ પરમેશ્વરની - પરમાર્થને કાજ. માત...

કામ ક્રોધ મહા જુઠ જોરાવર - વિષય છે વિકરાળ,
સદ્દગુરૂ સાચા સારથિને ઉતારો ભવપાર. માત...

જ્ઞાન ગોળી હૃદયમાં રાખો - પરપીડાને જાણ,
સાગર તરવો સેલ થશે ભાઈ - નામ તણે આધાર. માત...

નામ હરિનું નૌકા રૂપી - જ્ઞાન ગોળી કર હાથ,
હીરો ગુરૂએ હાથ આપ્યો - કર કાયાનું કલ્યાણ. માત...

હરિ ગુરૂનું શરણું સાચું - પારસનું પરમાણ,
અધમ ઓધારણ તે એક મને - થઈ પોતા નીરવાણ. માત...

લક્ષ ચોરાસીનો ફેરો મોટો - ફરતાં વસમી વાટ,
અનેક ભવ આગે વહી ગયા - હવે સોધ્યો સુંદરબાર. માત..

અનંત કોટી ગુરૂ ચરણમાં - તીરથ સૌ સમાય,
ભવસાગરનું નૌકા સાચું- રામહરિ ગુણ ગવાય માત...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n21/mode/1up

realpatidar.com

પ્રાર્થના સ્તુતિ

પીતા માત તું મુક્તિદાતા માહેરા - કૃપા દૃષ્ટી તારી દીસે છે વિષેશ
ખરો એક આધાર તારો અમારે... દયાનાથ તારા વિના કોણ તારે ......વેલ.
કરી તે કૃપા માનવી જન્મ દીધો - અમે લાભ તેનો ન કાંઈ જ લીધો,
ગયો કાળ સરવે અમારો વૃથારે... .... દયાનાથ
અમો જીવનાં છે અતિ નીંદય કર્મ - વીસારી દીધો છે અમે સત્ય ધર્મ,
તથાપી દયા તું દિલે નાથ ધારે... .... દયાનાથ
નથી સુઝતું સી વીલેનાથ થાશે - પ્રભુ હાથ તારા વિના કોણ ઝાલે,
પિતા પુત્રના દોષ તે ન વિચારે.... .... દયાનાથ
હવે જે રહ્યો શેશ આયુષ્યકાળ - સદા કાઢીએ સત્ય ક્રિયામાં કૃપાળ,
તમારા પ્રત્યે નાથ સંબંધ મારે... .... દયાનાથ
અજાણી નથી તું થકી કાંઈ વાત - સદા સંમતિ આપજો માત તાત,
વધુ શું કહીએ અમે વારે વારે... .... દયાનાથ

સ્તુતિ

ઓ ઈશ્વર ભજીએ તને - મોટું છે તુજ નામ,
ગુણ તારા નીત ગાઈએ - તો થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું - સદા રાખ દીલ સાફ,
ભુલ જો કદી કરીએ અમો - તો પ્રભુ કરજે માફ.

સ્તુતિ

વંદન કરીએ શ્રી પ્રભુ તમને - વંદન કરીએ શ્રી પ્રભુ તમને... વેલ...
પહેલું વંદન માત પિતાને - બીજું વંદન ગુરૂજી તમને...... વંદન...
ત્રીજું વંદન સરસ્વતી માતને - ચોથું વંદન આદ્યશક્તિને..... વંદન...
પાંચમું વંદન પરમેશ્વરને - સદ્‌બુદ્ધિ આપો અમને....... વંદન...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

ભજન

ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ - પ્રભુજી એવું માગું છું,

રહે જનમો જનમ નો સાથ - પ્રભુજી એવું માગું છું. .... વેલ.

તારી મુરતી મનોહર જોયા કરૂં - તારૂં ભજન રાત દિવસ ગાયા કરૂં,

અંત સમય ન ચૂકું તારૂં ધ્યાન... પ્રભુજી એવું........

મારી આશા નિરાશા કરશો નહિ - મારા અવગુણ હૈયામાં ધરશો નહિ,

શ્વાસે શ્વાસે જપું તારૂં ધ્યાન... પ્રભુજી એવું.........

મારા પાપને તાપ સમાવી દેશો - તારા દાસને ભક્ત બનાવી દેશો,

અંત સમય દર્શનનું કરજે દાન... પ્રભુજી એવું.......

ભજન

ગગનમાં ટકોરા વાગે - પ્રેમ ગુરૂ જોગીરામ શોધે,

અલખગુરૂ અવિનાશી જાગે... ગગનમાં ટકોરા વાગે વેલ.

ચરણ પાટ પૈયાળે પ્રગટ્યા હાં.... અને ગણપતિ દેવ મનાવો,

ઓહમ સોહમ કી ચોકી બેઠી- ઉઆંસે મીલ કર આવો ગગનમાં..

બંકનાળ સે દોરા ચડીયા હાં.... સુન મુખ ક્યારી વાવો,

ઈરે ક્યારીમાં રતન નીપજે - એનીયું તે ખબરૂં કઢાવો. ગગનમાં..

ત્રિવેણીએ ટકશાળ મંડાણી હાં... હીરલા ખરેખર લેનાં,

અગમ પાટ પર જ્યોત જલ હૈ - અનંત દર્શન કરાવો. ગગનમાં...

અટણ પટણ બજાર મંડાણી હાં... અને સ્વામી રાજા વણજે આવે,

ગુરૂ પ્રતાપે ખુશીયાલગર બોલ્યા - મારા સત્તગુરૂ પાર ઉતારો ગગનમાં.

realpatidar.com

https://archive.org/details/bk151/page/n23/mode/1up

realpatidar.com

ભજન

બીજ થાવર રેન રૂડી - જોયાની જુગતી ઘણી,
આજની વરતાણી - વીરામારા આનંદ ઘડી..
આજ મારે આંગણે હરી, સાચા મને સંતરે મળ્યા આનંદની ઘડી ટેક....
મોતીડાંનાં ચોક પૂર્યા - માંય ધણીના ધોરી,
કરીલ્યો કમાઈયું - વેળા જાય રે વહી...આજ મારે આંગણે હરિ....
પાટ થાપીને કળશ પૂર્યા - માંય જોતું જળ હળી
કોળીને પાવળ ગોળીયાં ... મારી ગતમાં ફરે.... આજ મારે....
સંત દેખી લડથડી - ઊભી રહી ખરી,
એમ બોલ્યાં સતી લીલમબાઈ - વીરાને વસ્તુ જડી... આજ મારે.....

ભજન

જગ બંધનની જેલ તેને તોડવી મુશ્કેલ
જુઓ ભાઈ જગ બંધનની જેલજી... વેલ...
પૈસોને પ્રેમદા બે પગમાં બેડીયું બિડેલજી,
સંતાન રૂપિ હાથ કડિયું ભીસીને બિડેલ... જુઓ ભાઈ....
વિભ્રમ રૂપિ કીલો વિકટ-દ્વાર માંહે દીધેલજી,
આશા તૃષ્ણા રૂપિ બે તાળાં... જબ્બરથી જડેલ. જુઓ ભાઈ....
કામ ક્રોધ ને લોભ મમતાના - પેરા સામા ઉભેલજી,
અજ્ઞાન રૂપિ વોડર આડો - આઠે પહોર ઉભેલ... જુઓ ભાઈ....
આ રે જેલને તોડવા ભાઈ - મોટા મોટા મથેલજી,
પારાસર સરખા ભાગ્યવંતા - તે પણ પાછા સપડાયેલ. જુઓ ભાઈ....
આરે જેલમાંથી નીકળવું એતો - ખરા ખરીનો ખેલજી,
શંકર કવિ કહે સદ્દગુરૂ મળે તો - જેલ થઈ જાય સેલ. જુઓ ભાઈ....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n24/mode/1up

realpatidar.com

ભજન

સંતને સંતપણાં રે - કાંઈ નથી મફતમાં મળતાં,
નથી મફતમાં મળતાં - એનાં મુલ ચૂકવવાં પડતાં... સંતને.. વેલ...
ભરી બજારે કોઈ વેચાણાં - કોઈ તેલ કડામાં તળતાં,
કાપા કાપીને કાંટે તોળી-કોઈ હેમાળે હાડ ગળતાં.... સંતને...
પ્યારા પુત્રનાં માથાં ખાંડી - ભોગ સાધુને ધરતાં
ઝેર પીધાં ને જેલો ભોગવી - સાધુડાં શૂળીએ ચડતાં.. સંતને......
કરવત મેલી મસ્તક વેર્યાં - કાળજાં કાપી ધરતાં,
ઘરની નારી દાનમાં દેતાં - દીલ જરા ન ડરતાં... સંતને....
પર દુઃખે જેનો આત્મા દુઃખીયો - રૂદીયાં જેનાં રડતાં,
માન મોટપ ને મમતા મૂકી - બ્રહ્મમાં જઈ ભળતાં... સંતને....
ગુરૂ પ્રતાપે કહે પરષોત્તમ - ચોપડે નામ એનાં ચડતાં,
એવા સંતોનાં ચરણ પૂજતાં - ભવનાં બંધન ટળતાં... સંતને...

ભજન

બંગલા અજબ બન્યા ગુરૂદેવ - ગટોગટ નારાયણ બોલે,
નારાયણ બોલેરે - ગટોગટ પરમેશ્વર બોલે... બંગલા..... વેલ....
પાંચ તત્ત્વ કી ઈંટ બનીને - તીન ગુણ કા ગારા,
પચીસ પ્રકૃતિ હીલમીલ રહેવે - ચણનારો ચેતન હારો રે.. બંગલા...
ઈસ બંગલામાં દશ દરવાજા - વચમાં પવન કા થંભા,
અવિનાશી તો આવે ને જાવે - દેખ કરો અચંબા રે... બંગલા...
ડાબી ઇંગલા જમણી પીંગળા - સુખમણા તાર મીલાવે,
નુરત સુરત દોનું ગાવાને લાગી - રાગ છત્રીસા બજાવે રે...બંગલા...
ગુરૂ પ્રતાપે બોલ્યા પુરુષોત્તમ - હાર્યા તે નર જીત્યા,
કહત કબીરા સુનો ભાઈ સાધુ - ગાવ ગુરૂના ગીત રે.. બંગલા...

realpatidar.com

realpatidar.com

ભજન

કોઈ આજ જસે કોઈ કાલ - આતો પંખીડાંનો મેળો,

માટે ભજીલ્યો દીન દયાળ - આતો પંખીડાંનો મેળો... વેલ...

સૌએ ઋણને બંધે મળીયા - કોઈ જનમનાં સુકીંત ફળિયાં,

જેવા આવ્યા તેવા જાય... આતો પંખીડાંનો મેળો...

માયાનો આ ખેલ છે ખોટો - કાયા પાણીનો પરપોટો,

ક્યારે ફૂટે એ કહી ન શકાય..... આતો...

સાથે કોઈ ન આવ્યું કે આવે - સૌને સૌના રસ્તે જાવું,

જેવાં વાદળીયાં વીખરાય... આતો...

મળ્યો માનવ જનમ અમુલ - મનખા દહીનો કરીલે તોલ,

શંકર અમૃત વાણી ગાય.... આતો...

ભજન

સુખરે સાગરમાં હંસો મોતીડાં ચરે - મોતીડાં ચરે રે હંસો મોતીડાં ચરે રે,

ભાઈઓ સુખ રે સાગરમાં હંસો મોતીડાં ચરે... વેલ...

અમુલખ મોતીમાં - હુવા અજવાળાં રે,

સુરારે મળે તો એની મોજું કરે રે... ભાઈઓ સુખરે....

ખરીદી કરે એને - ખોટ નવ આવે રે...

ઝવેરી મળેતો એનાં મુલરે કરે... ભાઈઓ સુખરે....

આરે મોતીડાંમાં - ચૌદ લોક સમાણાં રે,

બ્રહ્માવિશ્ણુ એનાં જતન કરે... ભાઈઓ સુખરે...

કહે ત્રીકમ સાહેબ - ભાણ પ્રતાપે રે,

મરજીવા મળે તો તેની મોજુ રે કરે... ભાઈઓ સુખરે...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n26/mode/1up

realpatidar.com

ભજન

કે તારા માથે નગારાં વાગે મોતનાં રે - નથી એક ઘડીની નીરાંત,
તોય જાંણ્યા નહિ જગદીશ ને રે.... વેલ...
કે મોટા મોટા તે રાય ચાલ્યા ગયા રે - તેને જરાય ન લાગી વાર... તોય...
કે તારૂં જોબનીયું જાય જખ મારતું રે - તારા કાળા મટી ગયા કેશ... તોય...
કે અંત કાળે યમરાજ લેવા આવશે રે - તેનો ભાળ્યો ભયંકર વેશ... તોય...
કે તને કોટી વીંછીની થશે વેદનારે - તું તો બન્યો છે દેવનો ચોર... તોય...
કે તારાં સગાં સ્વાર્થી લાગ્યાં લૂંટવારે - તારૂં જરાય ન ચાલે જોર... તોય...
કે જીભ ટૂંકી પડીને તુટી નાડીયું રે - થયું દેહ તજ્યાનું તતકાળ... તોય...
કે દેવાનંદ કહે ન જાણ્યા નાથરે - મળ્યો મનુષ્ય દેહ વિશાળ... તોય...

ભજન

મન રૂપિ મૃગલાને મારો -
મહંમંદ કહે મન રૂપિ મૃગલાને મારો એજી... એજી.. વેલ...
૧ ક્ષત્રિ કહે અમે શિકાર કરીએ - અનાદી ધર્મ અમારો એજી એજી..
જીવ મારીને તમે જીવ જીવાડો -
એમાં કીયો છે ન્યાય તમારો. મહંમદ કહે.......
૨ પાંચ મરગલા પચીસ મરગલી - છુટાં ફરે વનમાંય એજી. એજી.
કોરંગનાં દળ પડ્યાં ખેતરમાં -
સારો અવસરીયો ભેલાંણો... મહંમદ કહે.......
૩ શિકાર કરો તો કાયા વાડીમાં કરજો -
છુટા ફરે છે શિકારો... એજી..એજી..
બાહેર માર્યાથી બુડીરે મર
સો - પછી નથી ઉગરવાનો આરો... મહંમદ કહે.......
૪ સતરૂપિ કરતું તમાચો ને - દયા રૂપિ ગાળો ફેંકો. એજી એજી.
બ્રહ્મજ્ઞાનનો કરીલે ભડાકો -
ઘાયલ થાશે ચરનારો.... મહંમદ કહે.........
૫ મહંમદને ગુરૂ હજરત મળીયા - સંગમાં સરજન હારા. એજી એજી.
જ્ઞાન કરીને મને સમજાવો -
આતો ગોતી લીધો છે કીનારો... મહંમદ કહે.........

realpatidar.com

https://archive.org/details/bk151/page/n27/mode/1up

realpatidar.com

ભજન

આ જગતનું કલ્યાણ કરવા - સંતનો અવતાર છે.
શુભ દાન દેવા જ્ઞાનનું - મુળ માત્ર અજ્ઞાનનું.
પાપે પીડાતા પ્રણીઓનાં - પાપને પરીવારવા
સૌને સ્વધર્મનું જાણ કરવા -
સંતનો અવતાર છે. આ જગતનું કલ્યાણ.......
છે બ્રહ્મ મય આ જગતને - જોતાં બધા જીવજંત ને,
ધન્ય એવા સંતને - ભગવંતનો અવતાર છે.
માગું શિવ શંકર સદા - સત સંગ એવા સંતનો,
ભક્તિ તણો ભંડાર ભરવા -
સંતનો અવતાર છે. આ જગતનું કલ્યાણ.......

ગુરૂ મહાતમનું પદ

કે ધન આજની ઘડી તે રળિયામણી રે-
કે ધન આજનો દાડો તે રળિયામણો રે...
કે મારા ગુરૂજી આવ્યાની વધામણીરે -
ધન્ય આજની ઘડી તે રળિયામણી રે...
કે મેં તો કેળુના સ્થંભ રોપાવીયા રે -
કે મેં તો આંબાનાં તોરણ બંધાવીયાં રે.
કે મારા ગુરૂજીને સામૈયે સંચરતી રે.... ધન્ય...
કે મેં તો કંકુ લીધાંને ઝીણી કણચીરે -
કે મારા ગુરૂજીને મોતીડે વધાવતી હો જીરે ધન્ય...
કે હુંતો જળ હળ જો તું જગાડતી રે -
કે મારા ગુરુજીની આરતી ઉતારતી હો જીરે ધન્ય...
કે હું તો ગંગાજીનાં નીર ભરી લાવતી રે -
કે મારા ગુરૂજીના પાવલીયાં પંખાળતી હોજીરે.. ધન્ય..
કે મારા મનમાં તે આનંદ ઘણો થાય છે રે -
કે આવી આનંદ રચના દેખાય છે હો જીરે... ધન્ય...
કે મહેતા નરસિંહના સ્વામી ભલે મળ્યા રે -
કે મારા તનમાં તાપ સરવે ટળ્યાં હોજીરે.. ધન્ય...

realpatidar.com

realpatidar.com

ભજન

(સતસંગ કરતાં રે વિલંબ ન કીજીએ રે) રાગ.

માડી હું નહિ જાઉં રે... હવે હુ તો સાસરે રે જી....
અમને મળીયા જાદવ જીવન પ્રાણ. હ
વે હું નહિ જાઉં રે... માડી હું તો... વેલ..
સુખરે સ્વપનાનું રે - મારે કોણ ભોગવે રે જી,
એળે એળે આયુષ્ય ઓછું રે થાય ..
પાણીના પરપોટા રે - થાય ને ફૂટી જાય રે જી.
વળી પાછું ગરભ રહેવું નવ માસ.... માડી ....
પ્રપંચ રે દેખી રે... હું તો રે ભાગી કુરૂં રેજી.
પરથમ ખુટયો છે રે વેવાર...
સ્વાર્થ માંયે સૌ કોઈ લોભાઈ રહ્યા રે જી...
તે તો કોને કેમ કરી ઉતરે ભવપાર.... માડી ....
લ્યેતો મને લાગ્યો રે - ભયનો ભારી થયો રે જી,
તેથી મેંતો કીધો છે સરવે નો ત્યાગ.
આવેલો નહિ મેલુ રે હીરલો હાથ થી રે જી...
એવા અમને મળ્યા સુંદર વર શ્યામ... માડી ...
હવે નીત ગાસુંરે ગુણ રે ગોવિંદનાં રે જી..
હરીને તો રાખસું રે હૈડાની માંય.
નરભેરામ સ્વામી રે પ્રેમ આનંદમાં રે જી.
લાગી મારા સત્‌ગુરૂજીની શાન... માડી ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n29/mode/1up

realpatidar.com

ભજન

(રાગ ઉપરના ભજનનો)

મર રયા જખ મારે રે - દુરીજન લોકડાં...રેજી.
સુખે અમે ભજસું શ્રી ભગવાન
અમને કોઈ દેખી રે - મરને બળે ચો ગણા રેજી...
અમૃત લઈને ભેળે ઝેર... મર રયા જખ... વેલ...
નીંદક હોય તે પરનીંદા સાંભળે રેજી..
બહેરાં અમે થઈ રહેસું રે કાન .... મર રયા જખ..
તીલકને છાપાં રે - બખતર પેરીયાં રે જી,
કંઠ માંયે લીધી તે તુલસીની માળા.
હેડતાં ને ચાલેરે લક્ષણ પારખે રેજી.
બહુ રૂપિ તાં ઉભા જોને કાળ... મર રયા જખ...
નુગરાથી નેડો રે કદી નવ કીજીએ રે જી...
નરભેરામના સ્વામી રે પ્રેમ આનંદમાં રેજી.
જગત ભગતનું આદે અંતે વેર... મર રયા જખ....

ભજન

આવરણ ત્રણ પ્રકારનાં મનને રે -
લક્ષ્મી, નારી, ને ત્રીજું માન. આવરણ... વેલ...
૧ લક્ષ્મી લોભ વધારે દીલમાં રે -
નાં રહે સાર અસારનું ભાન. આવરણ...
૨ નારી નર્કને દ્વારે લઈ જતી રે -
કોઈ દી જોખમમાં મૂકે જાન.. આવરણ...
૩ માનને અપમાને જ્ઞાની ભુલ્યા રે -
ગમતાં પોતાના ગુણનાં ગાન.. આવરણ...
૪ પુનિત મન ગેરાયું આ રીતે રે -
ચૂકવે હરિ ચરણનું ધ્યાન... આવરણ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n30/mode/1up

realpatidar.com

ભજન

કામનો કામનો કામનો રે.... તું અહીં આવ્યો શા કામનો.....વેલ....

૧. સત સ્વરૂપિ ગંગામાં ન નાહ્યો -
ભજન કીયો ન સીયારામનો રે... તું અહીં...

૨. પાપ કરતાં પાછું ન જોયું - ઠરી બેઠો નહિ ઠામનો રે... તું અહીં...

૩. આરે કાયામાં સુરે મોહયો છે -
કોથળો છે હાડ ચામનો રે... તું અહીં...

૪. ભાણ કહે તું ચેતીલે પ્રાણી -
પછી નહિ રહે ઘાટ ગામનો રે... તું અહીં...

ભજન

તમ નામ લીયો ને નરનારી - સહાય કરસે દેવ મુરારી. વેલ....
એક નામ તે ધ્રુવે લીધું તેને રાજ અવિચળ દીધું.
વાલો ભક્તો તણા છે ઉપકાર ... સહાય...
એક નામ મીરાંએ લીધું - વિષનું પ્યાલું અમૃત કીધું.
ત્યાં વાલો બન્યા છે ગીરધારી... સહાય...
એક નામ નરસિંહ મહેતાએ લીધું - કુંવર બાઈનું મામેરૂં દીધું,
ત્યાં તો વાલો બન્યા છે વેપારી... સહાય...
એક નામ શગાળશા એ લીધું - માથું કાપીને ભોજન કીધું,
વાલે ચેલૈયો લીધો ઉગારી... સહાય...
એક નામ પ્રહ્લાદે લીધું - એને સ્થંભમાં દરશન દીધું,
વાલે પ્રહલાદ લીધો ઉગારી... સહાય...
એક નામ હરિશચંદ્રે લીધું - એને કાશીમાં દાન જ દીધું
વાલે રોહિત લીધો ઉગારી...... સહાય.....
કરજોડીને ખાકી ગાય - નામ લીધેથી પાતક જાય,
વાલો ભક્તો તણા છે ઉપકારી... સહાય...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n31/mode/1up

realpatidar.com

ભજન

કે ગોર નરની ચાવી મુજ ને જડી રે - કેશું જાણે સંસારના લોક,
મારા સત્‌ગુરૂએ મારગ બતાવીયો રે... વેલ...
કે મારી સુરતી ગુમતીને ગુરૂએ વસ કરી રે -
કે મને પાયો વેહ અગન કેરો રસ મારા..
કે ગુરૂ કાંકણ બાંધવાને વાલો આવીયા રે -
કે મારા શીષ ઉપર ધર્યો હાથ.. મારા..
કે અહીં દેવ પૂજા વરતાય છે કે અગર ચંદનને ધૂપ તીલક થાય છે રે...
કે મારા ખોલ્યા છે મોક્ષનાં દ્વાર... મારા...
કે બે હાથ જોડીને કરૂં વિનતી રે - કે તમે દર્શન દો ને ગુરૂદેવ.. મારા...
કે ગુરૂનું પહેલું દર્શન ચરણામૃતનું રે -
કે ગુરૂનું બીજું દર્શન નખશખ.. મારા...
કે ગુરૂનું ત્રીજું દર્શન કેડ લંકનું રે -
કે ગુરૂનું ચોથું દર્શન હેવી અંગ.. મારા...
કે આકાશી તે વાણી એવી થાય છે રે -
કે ગુરૂ ચરણે અનુબાઈ ગુણ ગાય. મારા...

ભજન

જીવન સફળ જઈ જાય - સંતોના સંગમાં,
કાયા નીરમળ થઈ જાય - સંતોના સંગમાં... વેલ...
૧ એકજ છે આત્મા - સૌમાં પરમાત્મા -
તારૂં દુઃખ દરિદ્ર મટી જાય.. સંતોના...
૨ સંત સમો નથી કોઈ દયાળુ - તારાં પાપ સર્વે બળી જાય.. સંતોના...
૩ સંત સમાગમ દેવ ને દુર્લભ છે - મુક્તિનો મારગ દેખાય... સંતોના...
૪ સંતનું શરીર પારસની તોલ છે - લોઢું કંચન બની જાય.... સંતોના...
૫ ગુરૂના ગમથી ગોવિંદ પરખાય છે - ગોવિંદના ગુણ સૌ ગાય.. સંતોના...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n32/mode/1up

realpatidar.com

ભજન

આ જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો -

મનને મહેતાજી કરી કામે લગાડજો આ જીંદગી... વેલ...

૧ આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું - કેટલી કમાણી કરી કેટલું છે દેવું,

કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો-

આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના..

૨ કેટલી સુધારી વૃતી કેટલી બગાડી -

કીયા પાટે ચાલી રહી આ જિંદગીની ગાડી,

પ્રભુ પંથ પામવાના પાટા બદલાવજો. આ જિંદગીના....

૩ જમા ને ઉધારનો કાઢજો તફાવત - કેટલી પ્રભુના નામે કરી બનાવટ,

એક એક પાનું તમે ચિંતનથી તપાસજો. આ જિંદગીના...

૪ કંઠી પહેરી કંઠ કેટલાંના કાપ્યા -

માળાના મણકામાં માધવને માપ્યા,

તીલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. આ જિંદગીના.....

૫ ગીતાની વાત કહો કેટલી પચાવી -

કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી,

સતસંગથી જીવનને સુંદર બનાવજો. આ જિંદગીના ....

૬ ભાવ અને ભક્તિની મસ્તીમાં રાચજો -

એક એક ગામડે ગીતાને પહોંચાડજો,

કામ કરી પ્રભુજીના દીલને ડોલાવજો. આ જિંદગીના....

ભજન

પાંચ પચીસના ઝગડામાં - મારો હિરો ખોવાયો કચરામાં....... વેલ....

૧ પૂર્વમાં ગોતું હુંતો પશ્ચિમમાં ગોતું - ગોતું હું મારા મનખામાં..મારો હિરો...

૨ ગંગામાં ગોતું હું તો જમનામાં ગોતું - ગોતું હું પાણી પથ્થરમાં. મારો...

૩ સાધુ ભુલ્યા ભાઇ સંન્યાસી ભુલ્યા - ભુલ્યા છે એના નખરામાં. મારો...

૪ કહત કબીરા સુનોભાઇ સાધુ - હીરલો છે મારા રૂદિયામાં. મારો...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n33/mode/1up

realpatidar.com

ભજન

આ જિંદગીમાં કેટલું કમાંણા રે - જરા સરવાળો માંડજો,
સમજુ સજન અને શાણા રે - જરા સરવાળો માંડજો વેલ....
૧ મોટરો વસાવી તમે બંગલા વસાવ્યા - ખૂબ કર્યાં નાણાં ભેળાં રે.. જરા...
૨ ઊગતાં આથમતાં તને ધંધાની જંખના - આમ તેમ ફેરવ્યાં પાનાંરે.. જરા...
૩ કંઇકને હસાવ્યા તમે કંઇકને રડાવ્યા - જ્ઞાનથી ન વિચાર્યું શાણારે... જરા...
૪ ગોવિંદના નાથનો ગુણ શું કહીએ - સરવાળે મીંડાં મંડાણાં રે.. જરા..

ભજન

કે હરિશચંદ્ર પૂછે રે તમે સાંભળો સતી રાણી રે -
અને કહો ધરમના વિચાર હો જી.....
૧ કે પાટ માંટાણા રાણી - ઠાઠ રચાંણા રે -
મળતી વરણ અઢાર હો જી....
૨ કે પાટ ન જાણું રાજા - ઠાઠ ન જાંણુ રે -
ન જાણું વરણ અઢાર હો જી.....
૩ કે હોળી પાવળીયો રાણી - ફરતાં મેં દીઠો રે -
રૂષિ મેગાનંદને ઘેર હો જી.....
૪ કે અનેક પ્રકારનાં રાજા તમને - સપનાં રે આવે રે -
સપનાં છે આળ પંપાળ હોજી......
૫ કે અમને ચડવા રે રાણી રેવંતી હંસલોરે -
તમે વરોધ્યો માતંગજીને ઘેર હો જી.....
૬ કે તમને ચડવા રે રાજા રેવંતી હંસલો રે -
વગડે ચરંતો અમે દીઠો હો જી.....
૭ કે અનેક પ્રકારનાં રાણી પુષ્પ મેં જોયાં રે -
અને કળશની કોટે હાર જોયા હો જી ......
૮ કે ગુરૂના પ્રતાપે રાણી તારાદે બોલ્યાં રે -
અમને ગુરૂજી મળ્યા છે વીર લોચન હોજી........

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n34/mode/1up

realpatidar.com

ભજન

હરિને ભજેથી શું થાય - જ્યાં લગી ક્રોધ કપટનાં જાય -
હરીને ભજેથી શું થાય જી...

૧ નીત્ય સવારમાં વહેલા ઊઠી - ઓલ્યા ટાઢે પાણીએ નહાય જી.
સગાભાઈનું સારૂં દેખી - દીલમાં લાગે લાગ.
હરિને ભજેથી શું થાય જી...

૨ ચોખા ચંદન પુષ્પ લઈને - ઠાકોર પૂજવા જાય જી.
ઠાકોર ના એ ચાકર થઈને - ચોરી ચોરીને ખાય. હરિ ને ...

૩ આખી રાતના કરે ઊજાગરા - ઓલ્યા ગાંજા ફૂકીને ગાયજી,
ખોટા વિચારો ઉરમાં લાવી - આનંદમાં લપટાય. હરિને...

૪ વહાલો મારો અંતર જામી - કોઈ નો છેતર્યો નવ છેતરાયજી.
કવિ પીંગલ એમ બોલ્યા - એવા નર તો નરકે જાય. હરિને...

ભજન

તન ત્રિવેણી તીરથ મોટું - નીરમળ મનથી જે નહાયજી.
પ્રાણને પાંદડે પોઢ્યા પરીબ્રહ્મ - દેવનાં દર્શન થાય જી... વેલ...

૧ ઈંગલા ને પીંગલા મધ્યે સુક્ષમણા - ચંદ્ર સૂર્યને અગ્નિ દેવજી,
ભૂત ભવિષ્યને વર્તમાન ભાખે - સેવક થઈને કરે સેવજી. તન...

૨ તેના ઉપર એક શૂન્યની શોભા - ઊઠે અનહદ નાદજી,
પાંચ રંજી ત્યાં જ્યોત લ્યો પારખી - જોતાં થાય આનંદથી.. તન...

૩ ત્રિકુટી કમળથી ત્રણ તસુપર - ચરણામૃત ઝરે જાયજી,
તેના નીચે એક નાગણી સંતો - પડે તેના મુખ માંયજી... તન...

૪ ધ્રુવ મંડળથી ધારીને જો જો - દ્વારદશ આંગળ દેશજી,
શસ્ત્ર પાંખડીને સૂર્ય આકારે - મધ્યમાં તે માહેશજી.. તન...

૫ બે ને બારથી સાતને ચારથી - ન્યારો એ તો નાથજી,
કાળનું ત્યાં જોર ન ચાલે - ગણપત ગુણ એમ ગાયજી. તન...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n35/mode/1up

realpatidar.com

ભજન

મુરખ ને બોધ ન લાગે રે - એને સંત ભલે સમજાવે,
સંત ભલે સમજાવે રે - એને ચારે વેદ વંચાવે. મુરખને...વેલ....
૧ ઉના વાસણને તળીયે અગની - ટાઢા જળને તપાવે,
શીતળતા ગઈ આગ ઓલાવવા - ત્યાં પોતે તપી જાવે. મુરખને.....
૨ સાપના મુખમાં સ્વાતીનાં ટીંપા - મોતીડાં ક્યાંથી પાવે,
વિશને ખેતર અમૃત વાવો - મીઠપ ક્યાંથી આવે. મુરખને.....
૩ ત્રણ ભવનના જીકે તડાકા - ગુરૂને જ્ઞાન બતાવે,
એક વારતા કોઈ કહેતો - બે ત્રણ સાચી અડાવે. મુરખને.....
૪ પ્રભુ ભજનમાં આડો પડેને - ગાણું પોતાનું ગાવે,
કાગ બધાની નીંદા કરીને - નિશ્ચે નરકમાં જાવે. મુરખને.....

ભજન

રામજી શેઠે સદ્ધર છે રે - એ તો ચોપડા ચોખા રાખે,
ચોપડા ચોખા રાખે રે - એ તો હિસાબ તલનો રાખે રામજી... વેલ...
૧ કૈકેયી માતાએ કલંક વોર્યું ને - નામું લખીને રાખે,
દેવકી માતાનાં દૂધ તજીને - માતા જશોદાને ધાવે. રામજી...
૨ લક્ષ્મણજીની સેવા નોંધી - સૂર્ય ચંદ્રની સાખે,
બળદેવજીને મોટા બનાવી - આજ્ઞા શિર પર રાખે. રામજી...
૩ સરયું કાંઠે છોકરાં કેરો - દાવ રહેલો માથે,
જમુના કાંઠે ૠણ ચૂકાવ્યું - ભારત ભાગવત ભાંખે.... રામજી...
૪ મંથરા કેરી થાપણ આખી - હાથ ગળામાં નાંખે,
કાળી કુબજા ગમે કાનને - ભલે રાધા રૂષણા રાખે.. રામજી...
૫ કાગ વાલીનો વધ કર્યો એ - રોજ મેળમાં રાખે,
પ્રાચીને પીપળે રૂણ ચૂકવ્યું - બાણ નીસાસા નાખે. રામજી...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n36/mode/1up

realpatidar.com

ભજન

આ કાયા કેરા સંચાની કલું ખોટકાંણી-
પાવળું ઉતર્યું નવ જો પાંણી.. આ કાયા વેલ..

૧ વૈદડા આવ્યા ઓસડ વાટ્યાં - પાયાં અમૃત પાણી,
સોયું ગોદાવી ચીરીને જોયું -
પણ મતી ત્યાં વૈદની મુંઝાણી. આ કાયા કેરી...

૨ જોશીડો આવ્યો એને કાઢી જન્મોતરી - ઉખેળ્યાં ટીપણાં તાણી,
એ નવ ગ્રહને એણે પૂછી લીધું -
જીવ્યાની જુગતિ ન જાણી... આ કાયા કેરી...

૩ ભુવો આવ્યો એને માર્યો હાકોટો - જટીયાં માથાનાં તાણી,
દાણા જોયા અને ડાકલાં વાગ્યાં -
પોઢી ગયો માંદો પ્રાણી. આ કાયા કેરી...

૪ માનતા કીધી બાધાઓ લીધી - કીધી ગામની ઉજાણી,
જપીયા બેઠા લાડુ જમે ત્યાં - માંદાની કાણું મંડાણી. આ કાયા કેરી...

૫ સંચાનો ઘડનારો બેઠો સંચામાં - એની ન કરી ઓળખાણી,
કાગ કહે ઘડી એક સંચો નહિ ચાલે -
જેદી ખુટસે દાંણો પાણી. આ કાયા કેરી...

ભજન

પાપી પાવન થઇ જાય - સંતોના સંગથી
અંતરના મેલો ધોવાય - સંતોના સંગથી ...... વેલ....

૧ વિષય વિકાર સૌ દૂર દૂર ભાગશે જ્યારે માનવને સત્ય ભાવ જાગશે
જ્ઞાનતણાં ચક્ષુ ખુલી જાય... સંતોના સંગથી....

૨ અનંત જન્મો તણી મનમાં જે ગાંઠ છે. આરે ભવાટવી વીપરીત વાટ છે,
મનની ગ્રંથી છુટી જાય સંતોના સંગથી......

૩ ઝાઝા જન્મોનું પુણ્ય જ્યારે જાગશે - સંત ચરણમાં લાગણી લાગશે
કમલ દેહ ભાવ મટી જાય. સંતોના સંગથી......

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

ભજન

એજી તારાં આગણિયાં પુછીને કોઈ આવે રે-આવકારો મીઠો આપજે રે જી..
તારે કાને કોઈ સંકટ સાંભળી - બને તો થોડું કાપજે રે જી.. વેલ...
માનવીને માથે કોઈ - માનવી ન આવે રે
એજી તારા દિવસો દેખીને દુખિયાં આવે રે... આવકારો....
વાતું એની સાંભળીને - આડું નવ જોશો રે..
એજી એને ધીમે ધીમે બોલવા દેજો રે ... આવકારો...
કેમ તમે આવ્યા છો - એમ નવ કહેજે રે...
એજી એને માથું રે હલાવી હોકારો તું દેજે રે... આવકારો...
કાગ કહે પાણી પાજે - સાથે બેસી ખાજે રે...
એજી એને ઝાંપા રે સુધી વોળાવા જાજે રે... આવકારો...

ભજન

સમજ વિનાનું રે - સુખ નથી જીવને - સાધકને અનુભવથી ઓળખાય,
દેહોમાં દર્શાવી રે. પોતાનો આત્મારે.
ત્યારે જીવને હું પદ સેજે જાય : સમજ...
પારખ વિનાનો રે - કોઈ પથ્થરો મળેજી. ઈ તો લોહ ફીટી કંચન થાય,
સદ્‌ગુરૂ વિના રે - કરે કોઈ સાધના રે -
ઈ તો એનું કરેલું નકામું જાય. સમજ...
રવિ રવિ કરતાં રે - ટળે નહિ રજની રે - અરક ઉગ્યા પછી. અંધારૂં જાય,
રૂદે રવિ ઉગે - ગુરૂગમ જ્ઞાને રે ત્યારે સુખનો સિંધુ દરશાય.. સમજ...
અવિદ્યા ટળે રે - અનહદ ચીતવેરે - ઈતો વાણી વેદ વિચાર,
સેજે નર સમજ્યા રે - તે તો તરી ગયા રે -
અખો કહે ઉતરીયા ભવ પાર.. સમજ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n38/mode/1up

realpatidar.com

ભજન

સાચી સમાધી સાધી રે - સત્ગુરૂના ચરણમાં
આધી વ્યાધી ઉપાધી આગીરે - સત્ગુરૂના ચરણમાં... વેલ...

સત્ગુરૂએ પીયાલો મને પાયો - એમાં સાર બધો સમજાવ્યો,
મેં તો શોધ્યો શીતળ છાંયો રે - સત્ગુરૂના ચરણમાં. સાચી...

ચડી સુનશિખર પર જોયું. મારૂં મનડું ત્યાં અતી મોહ્યું,
મારૂં દુ:ખ વિયોગનું ખોયુ રે - સત્ગુરૂના ચરણમાં... સાચી...

ખોલી બંકનાળની બારી - ત્યાં રચના રચી વીધી સારી,
મારી સુરતા ત્યાં સમાણી રે - સત્ગુરૂના ચરણમાં. સાચી...

ત્યાં બ્રહ્મ જ્યોત પ્રકાશી - મટી જનમ મરણની ફાંસી,
સરસ્વતી કહે સંન્યાસી રે - સત્ગુરૂના ચરણમાં. સાચી...

ભજન

કે સુરતા લાગી રે જેની - બ્રહ્મણારે ભાંગી
જાણે કોઈ સંત સુજાણ - સોહાગી જેની બ્રહ્મણારે ભાંગી... વેલ...
નટડીએ ખેલ જેમ રચ્યો મેદાનમાં-
વરત વિના રે બીજું નજરે ન આવે.. જેની...
શુરાનાં લક્ષણ એવાં રે ભાઈ - યુદ્ધે ચડે ત્યારે પાછું ન જુએ. જેની...
ચાતક સ્વાતીનું બીદું પોકારે -
અવર નભાવે બીજું નજરે ન આવે... જેની...
મોટા યોગેશ્વરોએ મનવશ કીધાં -
સિંધુમાં પેસી મોતી લીધાં છે ગોતી... જેની...
સંતનાં લક્ષણ એવાં રે ભાઈ -
પ્રિતમના સ્વામી મારા રૂદિયામાં રેશો... જેની...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n39/mode/1up

realpatidar.com

ભજન

ગુરૂ દર્શન કાજે જઈએ રે - નીત્ય જ્ઞાન ગંગામાં નાહીએ રે.
પ્રેમ પ્યાલી પીએ ને પાઈએ રે નીત્ય જ્ઞાનગંગામાં નાહીએ રે... વેલ...
શુદ્ધ જ્ઞાન ગુરૂ કેરૂ લઈને - સ્થિર લક્ષ માંહી પોતે થઈને,
રૂડી રહેણીમાં નિશદિન રહીએરે - નીત જ્ઞાન ગંગામાં નાહીએ રે... ગુરૂ...
શ્રદ્ધા કેરી કેડી લઈને - ગુરૂ વચને ધ્યાન રૂડાં ગ્રહીને,
કોઈ જનને કાંઈ નવ કહીએ રે - નીત જ્ઞાન ગંગામાં નાહીએ રે.. ગુરૂ...
મન મસ્ત બની સ્મરણ કરીએ - સદ્‌ગુરૂ ચરણે જીવતાં મરીએ,
સૌ ગુરૂજીને સોંપી દઈએ રે - નીત જ્ઞાન ગંગામાં નાહીએ રે... ગુરૂ...
નીજ રૂપ વસે બાવન બારૂં - પછી મૌન સદાય ત્યાં સારૂં,
કમળાનંદ શા સુખ લઈએ રે - નીત જ્ઞાન ગંગામાં નાહીએ રે... ગુરૂ...

ભજન

તારાં પાપ ત્રિવિધિ કેરાં તળે - સદ્ ભાગ્યે સદ્‌ગુરૂદેવ મળે,
પૂર્વનાં તારાં પાપ બળે - સદ્ ભાગ્યે સદ્‌ગુરૂદેવ મળે.... વેલ...
તૃષ્ણા તારી સેજે ટળશે - જ્યારે સદ્‌ગુરૂદેવ દયા કરશે,
તારૂં હું પદ હૈયા માંથી ટળે - સદ્ ભાગ્યે સદ્‌ગુરૂદેવ મળે... તારાં ...
કીધાં પાપ ઘણાં આ કાયાથી - ટળસે એ સદ્‌ગુરૂ છાયાથી,
શુદ્ધ બ્રહ્મમાં વરતી તારી ભળે - સદ્‌ભાગ્યે સદ્‌ગુરૂદેવ મળે. તારાં...
સત ચીત આનંદની લહેર મળે - જ્યારે સદ્‌ગુરૂ તુજ પર મહેર કરે,
રૂડી તત્ત્વ મહીના ભાન ભરે - સદ્ ભાગ્યે સદ્‌ગુરૂદેવ મળે.. તારાં...
કમળાનંદ કેવળ ધ્યાન મહી - મન મસ્ત બન્યુ જગભાન નહિ,
શુદ્ધ રૂપમાં વૃત્તિ સ્થિર રહે - સદ્ ભાગ્યે સદ્‌ગુરૂદેવ મળે... તારાં...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n40/mode/1up

realpatidar.com

ભજન

દિલ દરિયામાં ડૂબકી રે દીધી - મોતીડાં લીધાં ગોતી,
ઈ મોતીના સંત માલમી - જેની નજર માંય પોતીરે... દિલ... વેલ...
નવ દરવાજા દશમી ખડકી - ખડકી ઉપર ફરકી,
ઈ ખીડકી કોઈ સંત ઉઘાડે - લઈ કૂંચી ઉન ઘરકી... દિલ...
ત્રિવેણી ઘાટપર લીંગા કાર હોય - ઉવાંસે ગંગા ઉલટી,
મન કેરા કપડાં જ્ઞાન કેરા સાબુ - ધોઈલે માંયલા ધોબીને.. દિલ...
રણુકાર પર ઝણુંકાર હય - ઝણુંકાર પર જ્યોતિ,
ઝણુંકાર પર અભે સુન હય - અભે સુન પર મોતી... દિલ...
ખારા સમુદ્રમાં છીપ નીપજે - સાત વાલકા મોતી,
ઈ મોતી કોઈ મરજીવા વોરે - પેરે સુંદર સુરતી રે.. દિલ....
ડાબી ઈગલા જમણી પીગલા - નુરત સુરત પર જોતી,
દાસીજીવણ સંતો ભીમના ચરણે - હરખે હાર પરોવતી રે.. દિલ...

ભજન

કે તમે ભાવે ભજીલો ભગવાન - જીવન થોડું રહ્યું,
કાંઈક કરજો આત્માનું કલ્યાણ - જીવન થોડું રહ્યું... વેલ...
કે એના દીધેલા કોલ તમે ભુલી ગયા - જુઠી માયાના મોહમાં શું ઘેલા થયા.
ચેતો ચેતો શું ભુલ્યા છો ભાન.. જીવન...
કે બાળપણને જુવાનીમાં અડધું ગયું - નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું,
હવે બાકી છે એમાં ધરો ધ્યાન... જીવન...
કે ઘડપણમાં ગોવિંદ ભજાસે નહિ - લોભ વૈભવ ધનને તજાસે નહિ,
બનો આજથી પ્રભુમાં મસ્તાન... જીવન...
કે આમ આળસમાં દિન બધા વહીજા સે - ધર્મ રાજાનું તેડું ઓચિંતુ થાશે.
નહિ ચાલે ત્યાં કોઈનું તોફાન... જીવન...
કે એટલું કહેવું આ દાસનું ઉરમાં ધરજો - ચિંતા રાખી પ્રભુનું સ્મરણ કરજો,
બનો આજથી પ્રભુમાં મસ્તાન... જીવન...

realpatidar.com

realpatidar.com

ભજન

મન કર મકરા તન કર ઠકરા - જ્ઞાનકા મટકા દીજે રે,
કુબુદ્ધિ ખાલકો દૂર કરી જે - કાળજ ફાકી કીજે
મન માંયલા એણી વિધિ ગોઠું કીજે હોજી હોજી.. વેલ....
ગોવિંદ નામ કા ગ્રંથ મંગાવી લો - અમીરસ આંધણી દીજે.
કાળ ક્રોધકા ઇંધણ હોમ્યા - શબ્દ ફૂંક મારી જે.... મન માંયલા.....
દયા ધરમકી દાળ ઓરાવીદે - ખદબદ ખદબદ કીજે...
અભિમાન ઉફાણા આવે - જેણાકા ઢાંકણ દીજે: મન માંયલા...
કબુધી કેરી લાલચ લશણ - મમતાકાં મરચાં દીજે...
નુરત સુરત કા હળદર ધાંણા - ખુબ મશાલા દીજે... મન માંયલા...
સત ગુરુ મેરા જમણ બેઠા - ને મળ પરચા દિજેરે હોજી.
કહે માળી લખમો ગુરૂ પ્રતાપે - સતગુરૂ સોખ પતીજે...મન માંયલા...

ભજન

વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે.... વેલ....
ધ્રુવ રાજાને અમરપદ આપ્યું - પ્રહલાદને ઉગાર્યો પડકારી રે...
સંધ્યા કાળે વાલે દૈત સંહાર્યો -
હરીએ નોર વધારી પીર રામ દે.... વાગે.....
તોરલ રાણીએ ત્રણ નર તાર્યાં - જેશલ ઘરની નારી રે...
માલદે રૂપાનાં હરણાં હર્યાં -
અરસથી મોજડી ઉતારી મે રે સંતો... વાગે.....
તારાદે નું સત રાખવા - માળી બન્યા મોરારી
સુધનવાના નામ પ્રતાપે -
ઉકળતી કડા નાખી ઠારી વાગે.....
પલે પલે પીર રામદેને સમરો - ઇછે અલખ અવતારીરે.
ગુરૂ પ્રતાપે ભાઠી હરજી બોલ્યા -
ધણી ધાર્યો નેજા ધારી પીર રામ દે.. વાગે...

realpatidar.com

realpatidar.com

ભજન

અજ્ઞાની લોકો રે. અણ સમજુ લોકો રે.. તમે કાં નીંદરમાં સુવો

તમે કાં નીંદરમાં સુવો - કે તમે રૂદે વિચારી જુઓ રે..... અજ્ઞાની લોકો.. વેલ...

માતા પિતાની સેવા કરતાં શ્રવણ સરગે ગયો

કળી જુગમાં એને કલંક ન લાગ્યું - નામ અવિચળ રીયો..... અજ્ઞાની...

જાલર વાગે ભોળાનાથે - ભેદ ન જાણે ભુવો

જડી બુટીનું જોર ન ચાલે - ધનતર વૈદ જઇ મુવો...... અજ્ઞાની...

ગુરૂ પ્રતાપે ભણે ભવાનીદાસ - ખાતાં ખોળી ખોળી જુઓ.

જે નર પોતા સતગુરૂ ચરણે - નામ અવિચળ રીયો.... અજ્ઞાની....

ભજન

જાગોને તમે માનવી માથે - કાળ નગારાં વાગે,

કાળ નગારાં વાગે એવા - સાચા હરીજન જાગે...... વેલ...

૧ પરમારથમાં પાછાં પગલાં - સ્વારથમાં ન આગે,

કામ ધંધામાં સૂરાપણું. - હરી કથામાં ન આગે. જાગોને...

૨ ગપા ગપીમાં સર્વે મળીને - દુરથી આવે આગે,

હરી કથામાં હિંમત નહિ - જલદી ઉઠીને ભાગે. જાગોને...

૩ મારી તારી પરનીંદામાં - સાજી રાત રહ્યા જાગે,

સત સંગમાં આવતાં જેમ - કાગને ગોળી લાગે. જાગોને.....

૪ સતગુરૂ મુંજપર મહેર કરીને - સાચું નિશાન તાકે,

દેવીદાસ ગુરૂપ્રતાપે - કાળ પરોરે ભાગે. જાગોને.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n43/mode/1up

realpatidar.com

ભજન

આવી આવી અલખ જગાયો - એવા અમારે મહોલે,
અગમરે દિશાથી એક રમતો જોગી આવ્યો રે.... વેલ......
૧ વાલીડારે મારા રે હાં.... સત્ય કેરી સોય ને શબ્દ કેરા ધાગારેજી,
એવો ખલકો ખૂબ બનાવ્યો.... એવા અમારે...
૨ પીળાં રે પીતંબર કેશરીયા રે વાગાજી,
એજી એવો ભાલે તીલક લગાયો.....એવા અમારે....
૩ ભમર રે ગુફામાં આશન વાળીયાજી,
એજી એવો ભક્તિનો ભેદ બતાવ્યો. એવા અમારે...
૪ ઈરે જોગીડાને મરમના આવે રે જી,
એવો નહિ રે આયોને નહિ જાયો... એવા અમારે...

ભજન

ભક્તિ તણાં જ્યાં પૂર ઉલટ્યાં - મોતની પરવા નથી,
માતા પીતા કે બંધવોની - કોઈની પરવા નથી..... વેલ...
૧ રામ બંધુ કારણે છોડી દીધાં નીજ માતને,
ભરત વનમાં જઈ વસ્યા - ત્યાં રાજની પરવા નથી. ભક્તિ....
૨ નરસિંહના વિશ્વાસપર - છોડી દીધા નીજ તાતને,
પ્રહલાદ ભેટ્યા થંભને - ત્યાં અગ્નિની પરવા નથી... ભક્તિ....
૩ ગીરધારીના તાનમાં - છોડી દીધા નીજ નાથને,
મશગુલ બન્યાં જ્યાં બાઈ મીરાં - ત્યાં ઝેરની પરવા નથી.. ભક્તિ...
૪ છોડી વૈભવને શરણે ગયા. વિભિષણ શ્રી રામને,
રાવણ સરખો ભાઈ તજ્યો ત્યાં - કાળની પરવા નથી. ભક્તિ...
૫ રામના નામમાં મસ્ત બનો એ રામમાં,
રામ રસ જો ચાખશો તો - જગતની પરવા નથી. ભક્તિ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n44/mode/1up

realpatidar.com

ભજન

આવર દા આવી મારી ગઈ આંટો - ગમારને ન આવે જ્ઞાનનો છાંટો. વેલ...

૧ કાળા મટી તને ધોળા આવ્યાં - ન આવ્યો સમજણનો છાંટો,
ઘડીનાં પાંદડાં મંગાવી એને - જીણા કરીને વાટો. ગમારને.....

૨ દાંત પડી ગયા તારી દાઢી ડગમગી - તોય ન ભાગ્યો તારો કાંટો,
દહીનાં દુ:ખડાં આવી મળ્યા પછી - દુ:ખિયા જીવને દાટો. ગમારને.....

૩ આવડું ધન તને કામ નહિ આવે -સાથે ના લઈ જઈશ લાટો,
હાથમાં દિવો લઈને કુવે ઉતર્યો-પછી માથે છે જમનો ઝપાટો.ગમારને...

૪ આ સંસારનો સાર સુધારવા-તાંણી બાંધી લેને ગાંઠો,
લક્ષ્મીદાસ કહે સંત સેવ્યા વિના-નહિ માટે ચોર્યાસીનો આંટો. ગમારને...

ભજન

ધાર મન તું ધાર-આપડા ગુરૂને વચને ચાલ રે
લોભ લાલચ આળસ નીંદ્રા - ટળે તો તું ટાળ રે..... વેલ.....

૧. એરણ ઉપર હીરો જડીયો - ઉપર પડીયા ધાવ રે,
સાચા સંતને સેવતાં - ઝવેરી પરખાય રે. ધાર મન તું........

૨. શુરાને ગુરૂ પૂરા મલીયા - દે સાચાકુ ઘાવ રે,
કાયર પાછા ભાગીયા - અને શુરા લેસે દાવ રે :.... ધાર મન તું........

૩. ચાંદો સુરજ આવી બેઠા - બેઠા દસમે ધ્વાર રે
શાકારમાં નીરાકાર નીરખ્યા - સોહી સરજનહાર રે: ધાર મન તું........

૪. ચાંદો સુરજ આવી બેઠા - લેવા ફૂલની સુગંધ રે,
ધરમ દાસ સાહેબ એમ બોલીયા - મારા ગુરૂનો પ્રતાપ રે : ધાર મન તું....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n45/mode/1up

realpatidar.com

ભજન

મુરખ માનવી - પ્રભુ કાં ભજે નહિ,
મોહમાં ફસાઈને - તારી બુદ્ધિ કયાં ગઇ..... વેલ.......

૧ શાંખી : મોહમાયામાં મચી રહ્યો છે - સત્ય ગણે સંસાર,
ખુબી આ દુનિયાની કેવી - સમજ્યો નહિ લગાર.
ભોળો કાં થયો - જંજાળમાં રહ્યો -
ફંદમાં ફસાઇને - પ્રભુને ભુલી ગયો... મુરખ....

૨ શાંખી : ધન દોલતને માલ ખજાના - પુત્ર અને પરિવાર,
તું જ સંગાથે કાંઇ નહિ ચાલે - વાડી કે ઘરબાર.
યમ લોકમાં જશે - તુજ પાંવ ધ્રુજસે -
પુણ્ય પાપ શું કર્યાં - યમરાજ પુછસે. મુરખ....

૩ શાંખી : પુણ્ય ભક્તિ જો કર્યાં હશે તો - તુજને ભય નહિ લગાર,
શંકટ વખતે કામ લાગ સે - પ્રભુ નામ આધાર.
પ્રભુને ભજ્યા હશે - તો તે ઉગાર સે -
સ્વર્ગ લોકમાં જઇ - સુખેથી મહાલે.. મુરખ....

૪ શાંખી : ભાવધરી પ્રભુને ભજીલે - મુરખ મન નાદાન,
કૃષ્ણદાસની વિનતિ એવી - સહાય કરે ભગવાન.
સુખ સાચું લ્યો - હરી હરી - મુખે કહો -
પ્રભુ ભક્તિ આદરી- આનંદમાં રહો. મુરખ.....

ભજન

સબસે ઊંચી પ્રેમ સગાઈ - દુર્યોધન કામેવા ત્યાગી,
શાખ વિદુર ઘરખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ.
જૂઠે ફળ સબરી કે ખાયે - અનહદ પ્રિત લગાયે.... સબસે ઊંચી....
પ્રેમ કે વસ અર્જૂન રથ હાંક્યો - ભુલ ગયે ઠકરાઈ... સબસે ઊંચી....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n46/mode/1up

realpatidar.com

ભજન

જીંદગીતો એળે જવાની - દોરી તારી તૂટી જવાની....... વેલ....

૧ માયાવી જીવડા માયામાં ફસાય છે -
દિવસો જાય જેમ આયુષ્ય ટૂંકાય છે,
આખરતો ફજેતી થવાની - દોરી તારી તૂટી જવાની. જિંદગી તો...

૨ કાલે મરવું છે એમ માની લે આજથી
- હાથ ધોઈ નાખો સંસારના કાજથી,
બાજી તારી લેને સંભાળી - દોરી તારી તૂટી જવાની જિંદગી તો...

૩ એક એક શ્વાસ અણમોલ ગણાય છે -
સોયને પોરાવે જેમ વીજળી ચમકાય છે,
દેહ તારી ગળી જવાની - દોરી તારી તૂટી જવાની. જિંદગીતો...

૪ કહે પ્રભુદાસ વીરા માની લે વાતને -
રામનું નામ લઈને તારીલે જાતને,
સૌમાં પ્રભુ લેને નીહાળી - દોરી તારી તૂટી જવાની. જિંદગી તો...

ભજન

કે તમે સુણો આ જુગની વારતા - કહ્યું માતા પીતાનું નથી માનતા...વેલ...

૧ એણે શોખ કર્યા બહુ ઘેર પરણી લાવ્યા વહુ,
એતો નાના મોટાને દુભાવતા - કહ્યું માતાપિતાનું નથી માનતા..

૨ રોજ સિનેમામાં જાય - દેવ દર્શને ન જાય,
ઈતો એકોતેર પેઢી લજાવતા - કહ્યું માતા પિતાનું નથી માનતા...

૩ રોજ હોટલમાં જાય - એને શરમ ન થાય,
ધન માતા પિતાનું લુટાવતા - કહ્યું માતા પિતાનું નથી માનતા...

૪ ઈ તો કળીયુગ કહેવાય - વિચાર મનમાં ઘણા થાય,
ભાઈઓ શાને પ્રભુને વિસારતા - કહ્યું માતા પિતાનું નથી માનતા..

realpatidar.com

https://archive.org/details/bk151/page/n47/mode/1up

realpatidar.com

ભજન

હરી તારાં છે હજાર નામ - કીએ નામે લખવી કંકોત્રી
રોજ રોજ બદલે મુકામ - કીએ નામે લખવી કંકોત્રી.. વેલ...

૧ મથુરામાં મોહન - ગોકુળમાં ગોવાળિયા - દ્વારકામાં રાય રણછોડ.કિયે...
૨ કોઈ તને રામ કહે - કોઈ રાધેશ્યામ કહે - કોઈ કહે નંદ કિશોર કિયે...
૩ પંઢરપુરમાં પાંડુરંગ કહેવાણા - અયોધ્યામાં રઘુપતિરામ. કિયે...
૪ હિમાલયમાં બદરીપુરીમાં જગદીશ છે - શ્વેતબંધુ રામેશ્વર નામ. કિયે...
૫ નરસિંહ મહેતાના સ્વામીરે શામળા-મીરાંબાઈના ગીરધર ગોપાલ.કિયે...
૬ દશમો અવતાર નિષ્કલંકી કહેવાય છે - વિશ્વમાં છો નીરાકાર. કિયે...
૭ ભક્તોની રાખી ટેક - નામતો ધર્યાં અનેક- અંતે છો એકનો એક કિયે...
૮ નામ તારાં છે અપાર-ગણતાં ન આવે પાર-પહોંચે ન પૂરો વિચાર.કિયે..
૯ રામ કહે કોઈ કૃષ્ણ કહે કોઈ દેવી કહે કોઈ દેવ
જેના ગુરૂએ જે કહ્યું તે માને તે દેવ. કિયે...

ભજન

મોક્ષ તમને આપસે રે - કૃષ્ણ કનૈયા,
ભવનાં બંધન કાપસે રે કૃષ્ણ કનૈયા... વેલ...

૧ સતસંગમાં તમે હાજરી આપશો -
તો હાજર હજુર છે કૃષ્ણ કનૈયો. મોક્ષ....
૨ ગદ ગદ કંઠે તમે પ્રાર્થના પુકારજો -
તો પ્રાર્થના સાંભળશે રે કૃષ્ણ કનૈયો... મોક્ષ....
૩ કરેલાં કરમની માફી તમે માગજો -
માફી તમને આપશે રે. કૃષ્ણ કનૈયો.. મોક્ષ....
૪ શરણાગતની તમે શરણ જાજો -
શરણમાં રાખશે રે.. કૃષ્ણ કનૈયો.. મોક્ષ....
૫ દાસ ભગતની વિનતિ સ્વીકારજો -
પ્રેમથી સાંભળશે રે.. કૃષ્ણ કનૈયો.. મોક્ષ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n48/mode/1up

realpatidar.com

ભજન

નેડલો લગાડ્યો રે બાઈયુ અમને શામળીએ...જી....
અને આવડી પ્રીતુ - અમને છોડી મત જાઓ (૨) નેડલો.....વેલ....
૧. કાચા પાકા કોટ રે - ચણીયા દેવળ પડી તો ગયાં રે....જી..
એવાં ચણીયાં દેવળ - ધીરે ધીરે ભેગાં રે થાય :..... નેડલો.....વેલ....
૨. પીયું પીયું કરતાં રે - પીઉડો મારો પાસે વસે રે હોજી...
પીયુડો મારો આવે અને વળી જાય :......... નેડલો...... વેલ...
૩. ગત રે ગંગાજી રે - આવ્યાં મારે આંગણે રે હોજી....
પર દેશી પંખી - આવે ને ઉડી જાય :.... નેડલો..... વેલ.....
૪. ગુરૂને પ્રતાપે રે - જેઠીરામ બોલીયારે હોજી.....
એવા જેઠીરામ - ગત રે ગંગાજીના દાસ :...... નેડલો...... વેલ...

ભજન

સત્ય કેરી વાતમાં - શંકા કરીશમાં -
કાને ન ધરસો કોઈ - તેનો ધોખો કરીશ માં.... વેલ...
૧ વૃષ્ટિ વરસેલ છે - બીજ વાવેલ છે... વાવ્યું રે ઉગશે રે કેમ
તેની શંકા કરીશમાં સત્ય ...
૨ કાપુસને કોડીયું ગૃથ પુરેલ છે જોતુરે જાગસે કે કેમ
તેની શંકા કરીશ માં સત્ય...
૩ છાશ કેરા સંગથી - દૂધ બગડેલ છે - માંખણ નીપજ સે કેમ-
તેની શંકા કરીશમાં સત્ય...
૪ ગટમાં ગોવિંદ છે. મીરાંને મન છે. ઝેર પીને જીવાસે કે કેમ
તેની શંકા કરીશ માં સત્ય...
૫ અમોને આસ છે. સંતોને વિશ્વાસ છે. પ્રભુજી તારસે કે કેમ -
તેની શંકા કરીશ માં સત્ય...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n49/mode/1up

realpatidar.com

ભજન

હરિ ૐ ધુન મચાવ - તારા દેહ મંદિરમાં,
હરિ ૐ ધુન મચાવ - તારા દેહ મંદિરમાં..... વેલ...

૧ આ કાયાનો ઘડનારો છે - કડિયો કામણગારો,
તેની કળા તણો નહિપાર - તારા દેહ મંદિરમાં..... હરિ ૐ...

૨ અસ્થિનીતો ઈંટો બનાવી - ચુનો માંસ લગાવ્યો,
પ્લાસ્તર વીંધી વીંધી નાં કીધાં - તારા દેહ મંદિરમાં.... હરિ ૐ...

૩ દ્વારે દ્વારે ટેકા મુક્યા - એક દુવારો ન ચૂક્યા,
મુરતી પોતાની પધરાવ - તારા દેહ મંદિરમાં.... હરિ ૐ...

૪ નાડીનીતો નોબત વાગી - ઢોલના ધમકારા,
આસન અંતરમાં પધરાવ - તારા દેહ મંદિરમાં... હરિ ૐ...

૫ રાતા રાતા રંગની જામો પથરાવી,
તેની શોભા તણો નહીં પાર - તારા દેહ મંદિરમાં.... હરિ ૐ...

૬ ગટ ગટ માંહે મુરતી જોજે - બાહેર વરતી છોડી દેજે,
તારા દેહનું કલ્યાણ તારા દેહ મંદિરમાં.... હરિ ૐ...

૭ મંદિર મૂકી અળગા થાશો - પાછળથી પસ્તાસો,
સાલીગ્રામ ખાલી રહેશે - તારા દેહ મંદિરમાં.... હરિ ૐ...

૮ ગરીબદાસની વિનંતી સુણજો - સાંભળજો નરનારી,
સૌનું કરજો ને કલ્યાણ - તારા દેહ મંદિરમાં.... હરિ ૐ...

ભજન

કંહે એને કહેવા દઈએ - આપણે રામ ભજનમાં રહીએ... વેલ...

૧ જગત ભગત દોનું એક જ વરણા.- ભગતપણું કોને કહીએ,
ભગતપણું તારે કરવું હોય તો - દુનિયાનાં મેણાં સહીએ. આપણે...

૨ કાગડો ને કોયલ એક જ વરણા - કોયલ પણું કોને કહીએ,
કોયલપણું તારે કરવું હોય તો - મીઠા બોલા થઈએ. આપણે...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n50/mode/1up

realpatidar.com

ભજન

વૃતી મારી રામ ચરણમાં લાગી - સુરતી મારી સાધુ ચરણમાં લાગી,
તેણે મારી ભવની ભાવટ ભાંગી રે જી...

૧ સતગુરૂએ મને શબ્દ સુણાવ્યો - રણુંકાર રટ લાગી જી,
તખત ત્રિવેણીના તીર ઉપર - મોહન મોરલી વાગી. તેણે મારી ભવની

૨ ઘણા દિવસ થયા મન મસ્તાનું - હીલોડે નવ જોયું જાગી રે જી...
પુરૂષ મળીયા અક્ષર અજીતા - સુરતા સુનમે લાગી. તેણે મારી ભવની

૩ દયા કરી મને ડોલતું રાખ્યું - તૃષ્ણા મેલાવી ત્યાગી રે જી,
સતગુરૂ આગળ શીષ નમાવું - બાઉડી પકડી આણી. તેણે મારી ભવની

૪ સતગુરૂએ જ્યારે કરૂણા કીધી - અંતર પ્રેમ પ્રકાશી રેજી,
દાસ હોથીને ગુરૂ મોરાર મળીયા - તૂટી જમડાની ફાંસી.તેણે મારી ભવની

ભજન

પ્રથમ સમરૂં ગુણપતિ માતા - સરસ્વતી લાગું પાયજી..
તને પ્રસન્ન શારદા માઈતંબૂરા -
તારા કર્યા કરમ કટજાઈ તંબૂરા... સુણલે સાધુ ભાઈ. વેલ...

૧ પાંચ તત્ત્વકો બન્યો તંબૂરો - તીન ગુણ તાર મીલાઈ,
ઓહ્મ સોહ્મ કી ગરસણ બનાઈ ભાઈ-નીરગુણ કા ગુણ ગાઈ. તંબૂરા સુણલે..

૨ અણઘડ સુથારે ઘડ્યો તંબૂરો - કેડા કેડા ઘાટ ઘડાઈ રે.
રણ જણ રણ ઝણ વાગે તંબૂરો - દોવા દસને જગાઈ. તંબૂરા સુણલે....

૩ આપે સમજી આરંભ રચીયા - ઘાટ ઘડ્યા ગઢમાંઈ રે...
ગુરૂ ગજ નાદે વાગે તંબૂરો ભાઈ... બંકનાળ ગટમાંઈ.. તંબૂરા સુણલે...

૪ મોતી રામે ગાયો તંબૂરો - ચીત વરણની માંય રે
જ્ઞાન ગરીબી સે ગાયો તંબૂરો ભાઈ... મારા હરિજન અમરાપુરમાંય. તંબૂરા સુણલે..

realpatidar.com

https://archive.org/details/bk151/page/n51/mode/1up

realpatidar.com

ભજન

કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે -

નાહકનાં બધાં મરો મથી મથી રે.. કોઈ વેલ.....

૧ મનથી માનેલું આ બધું મારૂં -

સમજી લે જીવડા એમાં નથી કાંઈ તારૂં,

સ્વાર્થવિના પ્રીતિ કોઈ કરતું નથી રે -

કોઈ કોઈનું નથી. કોઈ.......

૨ આ મારો દિકરોને આ મારો બાપ છે -

આ મારી ઘરવાળીને આ મારી માત છે,

મુઆની સંગાતે કોઈ જાતું નથી રે -

કોઈ કોઈનું નથી રે... કોઈ.......

૩ જગમાં માતાએ તને જન્મ જ દીધો -

પાળી પોસીને તને મોટો જ કીધો,

પરણ્યા પછી માંના સામુ જોતો નથી રે -

કોઈ કોઈનું નથી... કોઈ.......

૪ કંઈક ગયાને કંઈક જવાના - ના કોઈ રહ્યાને ન કોઈ રહેવાના,

ગયા એના સમાચાર કોઈ દેતું નથી રે -

કોઈ કોઈનું નથી... કોઈ.......

૫ માનવનો દેહ મળ્યો છે ફેરો સુધારજો -

ભક્તિનું ભાથુ બાંધ છેલો ફેરો છે,

તારો અંતે સંગાથી પ્રભુ વિના નથી રે.

કોઈ કોઈનું નથી... કોઈ.......

realpatidar.com

https://archive.org/details/bk151/page/n52/mode/1up

realpatidar.com

ભજન

ગુરૂરાજ અમે ઘડપણમાં ગોવિંદ ગાસુ -
હાલ હમણાં નથી નવરાસું.. ગુરૂરાજ... વેલ...
ગુરૂજ્ઞાન સાંભળ્યું તમારૂં - મુક્તિ પુરીનું બતાવો છો બારૂં,
પણ અમારે કર્મે સોપ્યું કારભારૂં -
ગુરૂરાજ અમે ઘડપણમાં ગોવિંદ ગાસું. હાલ...
અમે મોટા કહેવાઈએ વેપારી - રાતદિવસ કરીએ મગજ મારી,
કથા ક્યારે સાંભળીએ તમારી - ગુરૂરાજ અમે....
અમારે ઘરે ઝાઝું છે દુઝાણું - નિત્ય સાચવવું સગાંઓનું ભાણું,
હરિરસની તે વાત ક્યાંથી જાણું - ગુરૂરાજ અમે...
હજી બાંધવા છે બારસો માળા - પછી થાવું હજાર મીલવાળા,
પ્રભુ ક્યાંથી ફેરવીએ તમારી માળા - ગુરૂરાજ અમે....
શાઠ લાખની પૂંજીને શું કરીએ - કરોડ અબજ તીજોરીમાં ભરીએ,
પછી નાતમાં મોટેરા થઈ ફરીએ - ગુરૂરાજ અમે......
પાંચ દિકરા વિલાયત ગયા છે - વહુ દિકરીને કજીયા થયા છે,
એવું ઘરમાં ઘમસાણ મચ્યાં છે - ગુરૂરાજ અમે......
રાંડ કર્મે નીકળી છે કજીયાળી - વળી ગામમાં છે સાળા-સાળી,
નીત્ય મનાવવી પડે છે ભમરાળી - ગુરૂરાજ અમે......
સાઠ વર્ષની ઉંમર થઈ અમારી - તે શું આંખમાં આવે છે તમારી,
હજી પરણવી છે નવલી નારી - ગુરૂરાજ અમે....
સર નાઈટના ઈલકાબો લઈશું - વાયસરોને આવકારો દઈશું,
બીજી વાતો પછીથી કરીસું - ગુરૂરાજ અમે....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n53/mode/1up

realpatidar.com

ભજન

માતા પિતાનું લોહી ચુસી ખાય છે-એવા દિકરા જુઓને ઘણા થાય છે. વેલ.

૧ જુઓ ભણાવ્યા અપાર - સંકટ સહી અપાર,
લગ્ન કરતાં પત્ની તણા થઈ જાય છે - એવા દિકરા જુઓને ઘણા થાય છે.

૨ પોતે મોજમાં ફરે - પત્ની કહે તેમ કરે,
માતા પિતાથી જુદા થઈ જાય છે-એવા દિકરા જુઓને ઘણા થાય છે.

૩ રોજ હરવા ફરવા જાય - રોજ નવું નવું ખાય,
માતા પિતા ભૂખ્યાં રહી જાય છે-એવા દિકરા જુઓને ઘણા થાય છે.

૪ વળી શેઠના રે શેઠ - માતા પિતા કરે વેઠ,
માતા પિતાથી માગ્યું ન મંગાય છે- એવા દિકરા જુઓને ઘણા થાય છે.

૫ જુવાની પળમાં ચાલી જાય - જંજાળ ઝાઝો વધી જાય,
માતા પિતાના જેવા હાલ થાય છે -એવા દિકરા જુઓને ઘણા થાય છે

૬ સમજુ સમજી શકે ભાઈ - ગવેડો રોજ માર ખાય,
મગન ભક્ત લાખોમાં એક થાય છે - એવા દિકરા જુઓને ઘણા થાય છે.

ભજન

કે મમતા મરે નહિ તેનું મારે શું રે કરવું - ગુરૂ મારી પકડોને બાંય..મમતા વેલ...

૧ એજી ચોપટ ઢળાવ્યા અમે સુનમાં - રમુ મારા પીયુજીની સાથ,
હુંરે હારૂતો એની દાસી બની જાઉ-નહિતર રાખુ એને મારી પાસ.મમતા

૨ રે કોઈ રે બતાવો મારો જોગીડો - જોગી મારી કાયાનો ઘડનાર,
એ..જી..જોગીરે મળે તો અમે જીવસું - નહિતર કાઢું મારા પ્રાણ..મમતા...
એ... ગુરૂ કુભાર શિષ્ય કુંભ હય - ગડી ગડી કાઢે ખોટ,
અંતર હાથ સંહાર દે - બાહેર મારે ચોટ.....

૩ એજી બ્રાહ્મણ ભુલ્યારે પોથી વાંચતા - કાજી ભુલ્યા છે કુરાન,
હાજી રે મહમદ શાની વિનંતી - સંતો ગરીબ નવાજ.... મમતા...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n54/mode/1up

realpatidar.com

ભજન

રામ રતન ધન પાયો - મૈયા મેં તો રામ રતન ધન પાયો..... વેલ.......

૧. સતસંગત સદગુરૂની કૃપાસે - તો ભાગ્ય બડો બની આયો : મૈયા.....

૨. ખરચ્યોન ખુટે વાકુ ચોર ન લુંટે - તો દીન દીન બઢત સવાયો. મૈયા.....

૩. નીર ન ડુબે વાકુ અગની ન જાલે - તો ધરણી ધર્યો ન સમાયો : મૈયા......

૪. નામ કો નાવ - ભજનકી બતીયાં - તો ભવ સાગર સે તાર્યો : મૈયા......

૫. બાઈ મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ - તો ચરણ કમળ ચીત લાયો : મૈયા.....

ભજન

મારું ચીત લાગ્યુ રે ગુરૂજીના ધ્યાનમાં -
બીજું લાગે સરવે ખારું રે : મારું ચીત... વેલ..

(૧) આ બાવરી કરૂં છું મારા મનમાં -
સુરતા લાગી ગુરૂજીના સંગ રે: મારું..

(૨) આ અનેક જનમની છઉં આંધળી -
ગુરૂજીએ દીધી અમને આંખ રે: મારું..

(૩) આ મહામંત્ર દીધો મારા કાનમાં..
હું તો સમજી સાધુજીના શાન માં રે મારું..

(૪) આ રસ બસ થઈ હું તો સંગમાં -
સતગુરૂ રમે મારા સંગ રે :... મારું..

(૫) આ ગુરૂના પ્રતાપે મીરાંબાઈ બોલીયાં -
દેજો અમને સંતચરણોમાં વાસરે. મારું..

ભજન

આઠ પહોરને રાત દિવસ વચે - રટના રટજો ઘડી ઘડી...
એ મનવા - રામ સમરલે હરિ હરિ..... **વેલ...**

૧ પ્રથમ નામતો ધણીનું સમરૂં - જેણે કીલતારે મારી કાયાઘડીજી,
ગૌરી નંદન ગણેશને સમરૂં - તો રિદ્ધિ સિદ્ધિ દોનું આગળ ખડી...એ મનવા...

૨ ઈંગલા પીંગલા સેવા સાધે - સુખમણા નાર આગળ ખડીજી,
ત્રિપુટી મહેલમાં હુવા અજવાળાંતો - ગગનમંડળમાં જોતી ખડી.એ મનવા...

૩ લાલગર સ્વામીને પુરણ મળીયા - જેણે બતાવી આ અમર ઘડીજી,
ગુરૂ પ્રતાપે શ્રી રામ બોલ્યા - ખોલીગઈ માંયલી કમળ કળી.એ મનવા...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n55/mode/1up

realpatidar.com

ભજન

લેર લગાડી રામને ભજી લ્યો જાવું છે મરી -
જાવું છે મરી રે.. કાયા જાશે રે પડી લેર. વેલ...
૧ ગણેરે કષ્ટે પીડ બંધાણો - ગર્ભમાં ધરી,
માંડ કરીને માનખો પામ્યો - ચોર્યાસી ફરી. લેહ...
૨ ઊંચા મંદિર માળીયા તારા - રહેશે રે પડી,
એવી રૂડી મનખા દેહી તારી - ધૂળમાં ઢળી. લેહ...
૩ તેડાં આવ્યાં શ્રી રામનાં - જાવું કષ્ટની ઘડી,
જમ આવે તારૂં જોર નહિ ચાલે - બાંધશે જડી. લેહ...
૪ કાઢો કાઢો સૌ કોઈ કહે છે - એને રોકો માં ઘડી,
સગાં સર્વે વીંટાઈ બેઠાં - મરણની ઘડી.. લેહ...
૫ સંતની સેવા હરિની ભક્તિ - વાત છે ખરી,
શ્રી હરિ કહે રઘુવર સમરો - જાઓ રે તરી... લેહ...

ભજન

તારે એક દીન જાવું પડશે - કરમ તારાં તને નડશે રે કરમ તારાં
તને નડશે રે જીવલડા (૨) વેલ...
૧ કે તું બાંધી મુઠી આવ્યો - તું સાથે કાંઈ ન લાવ્યો,
માયાએ તને ભરમાવ્યો - માયાએ તને ભરમાવ્યો જીવલડા.કે તારે...
૨ કે તારી આગળ પાછળ અંધારૂ - તું ભુલી ગયો ઘર તારૂં,
નીકળવાનું નથી બારૂં - નીકળવાનું નથી બારૂં. જીવલડા.. કે તારે...
૩ કે તે તો પરાયું ભેગું કીધું - તે તો તારૂં માની લીધું,
વિષયનું વિષ પીધું - વિષયનું વિષ પીધું. જીવલડા... કે તારે...
૪ માટે સમજી સતસંગ કરજે - તારાં હુંપદને પર હરજે,
વાલાને નવ વીસરજે - વાલાને નવ વીસરજે. જીવલડા... કે તારે...
૫ ત્યારે મંગળ તારૂં થાશે - તારા ઘરમાં ગોવિંદ ગણાશે,
મરણ તારૂં મટી જાશે - મરણ તારૂં મટી જાશે. જીવલડા.. કે તારે...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n56/mode/1up

realpatidar.com

ભજન

૧ સંતોના દરબારે રે - નિર ભેદી નેજા ફરકે,
નિજ નામે આવ્યા રે - આતમાની જોતું ઝળકે.
૨ ભગવાન લીધા જાણી - મટી ગઈ તાણા તાણી,
આત્માના અજવાળે રે - વાલાની ઓળખાણ આવી.
૩ ગુરૂએ બતાવ્યા ગોવિંદ - મને મળીયા મારો ખાવિંદ,
ગુરૂની બલીહારી રે - ત્રિવેણીમાં મૂકી દીધા.
૪ ત્રિવેણીમાં ઝીલી લીધું - મારૂં તારૂં મૂકી દીધું,
મેલા મનડાં ધોયાં રે - રાત ઘેર પાછાં આવ્યાં.
૫ નામ રૂપ ગુણ નથી - ગુરૂએ બતાવ્યું મથી,
અનુભવે આવ્યારે - જન્મ મરણ હવે નથી.
૬ પાંચ તત્ત્વ પરખી લીધા - આત્માનાં દર્શન કીધાં,
પુરાં કામો કીધાં રે - ભવો ભવની ભાંગી ભ્રાંતિ.
૭ નવી સૃષ્ટિ નવી દૃષ્ટિ - આનંદની થઈ વૃષ્ટિ,
અખંડ આનંદ આવ્યો રે - મારા ભેગી આખી સૃષ્ટિ.
૮ નેજામાં ત્રણ રંગ દીઠા - એકતાના ભાવો મીઠા,
લાલ પીળો લીલો રે - બધા દેવો એમાં દીઠા.
૯ જય ભગવાન ગુરૂમારા - નિરભેદી હંસો પ્યારા,
ભેગા કીધા વાડા રે - ભગવાન નથી પ્યારા.

ભજન

જળ હળ શું જ્યોતું જાગી - બ્રહ્માનંદની લહેરો લાગી રે અંતર પટમાં.વેલ...
૧ મુળ ખેચી નાંભી રોપી - નાગણી પર ખુટી ઠોકી,
ઝેર બધું લીધું ઓકીરે... અંતર પટમાં...
૨ ધીમે ધીમે પગ મૂકી - મેરૂ દંડ પર ગયો ઝુકી,
માયા મમત મેલી ફુકીરે.. અંતર પટમાં.
૩ અગ્નિએ જોર માંડ્યું ભારી - તો પણ હું ન ગઈ હારી,
પાટી મારી ઉગાડી લારી રે... અંતર પટમાં...
૪ ઓહંમ જઈ સોહંમ ને મળીયો - સોહમતો હેમાળે ગળીયો,
શંકર તો શંકરમાં ભળીયો રે... અંતર પટમાં...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n57/mode/1up

realpatidar.com

ભજન

મારા પ્રેમી પંખીડાં પધારજો હો રામ - જંગલમાં મારી ઝૂંપડી,
કોઈ આવે તેને સાથે તેડી લાવજો હો રામ જંગલમાં મારી ઝૂંપડી. વેલ..
સાખી : નીરમળ નીરમાં નાઈસું - અને કરશું અમીરસપાન,
ભોજનિયાં મન ભાવતાં - અને ભજસું શ્રી ગોપાલ.
કીયા પીંજર પ્રેમથી પંખાળ શું હો રામ... જંગલમાં મારી ઝૂંપડી. મારાં...
સાખી : કોટી જનમના પુણ્યથી - અને મળ્યો મનુષ્ય અવતાર,
ભાવ થકી પ્રભુનાં ભજ્યા - તો લાખોવાર ધિકાર.
રામ તુંહી રામ તુંહી એમ બોલસું હો રામ જંગલમાં મારી ઝૂંપડી.. મારાં...
સાખી : પ્રેમ વિના પ્રભુ ન રીઝે - અને ભક્તિ કદી નવ થાય,
પુરણ પ્રેમ જો હોય તો - જરૂર વૈકુઠ જવાય.
પ્રેમ દરિયામાં નાવડાં - ઝુકાવસું હો રામ. જંગલમાં મારી ઝૂંપડી... મારાં...
સાખી : પલ એક જાપ લખીને - લઈ લ્યો રૂડો લાભ,
ફરી ફરી અવસર ન મળે - આવો વારંવાર.
દાસ શંકરની એવી વિનતી હો રામ - જંગલમાં મારી ઝૂંપડી.. મારાં...

ભજન

બેલીડા ઉઠો ઉતાવળા થઈ - વાવણીયા જોડો ખેતરમાં જઈ... વેલ...
૧ ધરમ નિયમના દોરી - જોડીને ખેડો - અનુભવી હળ જ લઈ,
મોહ માયાનાં ઢેફાંને ભાંગો - સતનું ખાતર દઈ રે... બેલીડા...
૨ અમર નામની ઓળું પાડો તમે - સુરતાના શેઢા પર જઈ,
વાંક અંતરનો કાઢો વિવેકથી - ખોટનું ખાતર નહિ રે... બેલીડા...
૩ જ્ઞાનના કણ તમે મોંગેરાં લેજો - તન મન નાણાં દઈ,
મનુષ્ય ખેતરમાં વાવો વિવેકથી - ગુરૂગમ ઓરણી લઈ.. બેલીડા...
૪ જ્ઞાનના અંકૂર ઉગ્યા ખેતરમાં - ધીરપ ઢૂંકડી થઈ,
કુડ કપટનાં કાઢો પારેવડાં - મનનો રખેવાળ થઈ. બેલીડા...
૫ મોક્ષનાં કણસલાં પાક્યાં ખેતરમાં - ખબર ધણીને થઈ,
દાસ દઈઓ કહે એવી કરજો કમાઈ જેથી ભવની ભાવટ ગઈ. બેલીડા...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n58/mode/1up

realpatidar.com

ભજન

રામની અજબ રચનારે - એનો પાર મનુષ્ય કેમ પાવે,
પાર મનુષ્ય નહિ પાવેરે - ભલે ઊંચા વિમાન ઉડાવે... રામની વેલ.
૧ સુખ ભોગવવા રે કમાણી - લક્ષ્મી ઢસડીને લાવે,
ભોગવવાનું ટાણું આવે ત્યારે - ગેબનાં તેડાં આવે... રામની...
૨ ભુવો ધુણીને માંદો પડ્યો ત્યારે - બીજા ભુવાને બોલાવે,
તાપ તપે જ્યારે વૈદના તનમાં - ઓસડ યાદ ન આવે. રામની...
૩ જોષીડો સૌના જોષ જુએને - ધનના જોગ બતાવે,
બીજાને લખપતી બનાવે - એને દોકડો હાથ ન આવે... રામની...
૪ ગેલી લાલચમાં ગેલો બનીને - ગાંઠનો ગરથ ગુમાવે,
દેવી દેવતા પીર પયગંબર - આવરદા ન અપાવે... રામની...
૫ રામ કહે તે કામ કરીલે - હુકમ હરદમ આવે,
કાગ કહે જીવડો વમળે ચડ્યો તો - લક્ષ ચોર્યાસીમાં જાવે. રામની...

ભજન

જ્યાં લગી આત્મા અંગમાં છે - ત્યાં લગી હરિ હરિ હરિ તું કહે. વેલ...
૧ હાલતાં હરિ ચાલતાં હરિ - અને બેસતાં હરિ તું કહે,
સુતા પહેલાં જે સમરણ કરે ભાઈ - તેની તે બોલો જય..જ્યાં લગી...
૨ લીધા સરીખુ નામ હરિનું - લઈ શકે તો લે,
દીધા સરીખુ દાન છે અન્નનું દઈ શકે તો દે... જ્યાં લગી...
૩ આરે સંસારિયો સર્વે જુઠો - ને સાચી વસ્તુ બે,
એક પુણ્ય બીજું હરિ ભજન ભાઈ - જીવડા સમજી લે.જ્યાં લગી...
૪ દૃષ્ટ પદારથ સર્વે ખોટાં - અને આત્મા અખંડ છે,
કીડી થકી તે કુંજર લગણ ભાઈ - કાળ ચક્રનો ભય. જ્યાં લગી...
૫ એક દીન આંગણે દીવા વિવાહ - અને વળી ઢોલ શરણાઈ વાગે,
કહે જીવણ એવો એક દિન આવશે-શ્મશાને જઈ રહે જ્યાં લગી....

realpatidar.com

realpatidar.com

ભજન

તારી કળા અપરમ પાર - એમાં પહોંચે નહિ વિચાર,
એવી તારી કળા અપરંપારજી...રે વેલ...
૧ હરિવર તું કયા હથોડે - આવા ઘાટનો ઘડનારજી,
બાળકોમાં પ્રભુ માતાપિતાનો - કયાંથી આવે અણસાર. એવી...
૨ અણું અણુંમાં આખો વડ સંકેલ્યો - એનાં મુખ ઉઘ્યા મોરારજી,
કીડીનાં આંતરડાં કેમ ઘડીયાં - એવાં સૃષ્ટિના સરજનહાર. એવી...
૩ જનમ આગળ દૂધ જુગતે - તે કર્યાં તૈયારજી,
મોરનાં ઈંડામાં રંગ મોહન- કેમ ભર્યો કીરતાર. એવી...
૪ કોણ કલ્પે કોણ બોલે - હારે ના કહેવાયજી,
પરસેવાની લીખ પંડની - તાગે ના તારણહાર. એવી...
૫ અણું અણુંમાં ઈશ્વર તારો - ભાસે છે ભણકારજી,
કાગ કહે કઠણાઈથી તોય - આવે નહિ ઈતબાર... એવી...

ભજન

અમને રામ નામ ધન પ્યારૂં -
આંખો મીચીને વાપરીએ તો જરીએ નથી ખૂટનારૂં... અમને...વેલ...
૧ એ ધન એથી ખૂબ ભર્યું છે - અટકે ન કામ અમારૂં,
લેવું હોય તો લેવા આવો - મેલી મારૂં તારૂં. અમને.....
૨ દામ વિનાની દુનિયા સાથે - ખુબ કરીએ વેપારૂ,
પાપીને પાખંડી સાથે - રાખીએ નહિ વેપારૂ.... અમને......
૩ એ ધન જેણે સાચવી જાણ્યું - મેલી મારૂં તારૂં,
એનો બેડો પાર જગતમાં - નહીં એ વાત વિચારૂં.... અમને......
૪ હરિ ભજનમાં મસ્ત રહે - એને એ પચનારૂં,
બીજા કોઈ જીવી શકે નહિ - કારણ ઘોર અંધારૂં. અમને......
૫ સદ્ગુરૂ દેવે દયા કરીને - ખોલ્યું બ્રહ્મનું બારૂં,
જ્યાં જોવું ત્યાં હરિ જણાય - ભવ સાગરનો તારૂં... અમને.....
૬ નીરભે થઈને ખેલું નવ ખંડે - શું કરે ચોર ચકારૂં,
પ્રભુ નામે મહિમા ગાતાં - ઘટમાં થયું અજવાળું. અમને.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n60/mode/1up

realpatidar.com

ભજન

અજરો કાંઇ જરીયો ન જાય - ભાઈ વીરા અજરો કાંઈ જરીયો ન જાય,
વેલ...
થોડે રે થોડે સતપીઓજી...
૧ તનઘોડો મન અસવાર - ભાઈ વિરા તનઘોડો મન અસવાર,
અજરો...
તમે ઝરણાનાં જીન ધરો...જી...
૨ બુદ્ધિ બરછી સીલ હથિયાર - ભાઈ વીરા બુદ્ધિ બરછી સીલ હથિયાર,
અજરો...
તમે માંયલ્યાએ યુદ્ધ કરો... જી...
૩ ચડવું કાંઈ મેરૂ અસમાન - ભાઈ વીરા ચડવું કાંઈ મેરૂ અસમાન,
અજરો...
આડા અવળા વાંક ઘણા...જી..
૪ કળીયુગ છે કાંટા કેરી વાડ - ભાઈ વીરા કળીયુગ છે કાંટા કેરી વાડ,
અજરો...
જોઈ જોઈને તમે પાંવ ધરો.... જી...
૫ બોલીયા કાંઈ ધ્રુવને પ્રહલાદ - ભાઈ વીરા બોલ્યા કાંઈ ધ્રુવને પ્રહલાદ,
અજરો...
તમે અજંપાના જાપ જપો... જી....

ભજન

હરિરસ મોંઘેરા મુલનો - શીરને સાટે પીવાયજી,
શીરનાં સાટાં રે સંતો જે કરે મહારસ તેને દેવાયજી. એ હરિરસ... વેલ...
૧ શીર દેતાં ચૂકે નહિ - સનમુખ ઝૂઝે સુરજી,
પાછાં પગલાં તેતો નહિ ભરે - સદ્દગુરૂ હજુરા હજુર જી... એ હરિરસ...
૨ પ્રેમ પીયાલા સંતો જે પીયે - જીવન મુગતી હોયજી,
શે - શે શરીર સુકાઈ ગયાં - તે પદ પોતા નીરવાણજી.. એ હરિરસ...
૩ તનની તોપો તૈયાર કરો - જ્ઞાન ગલોલા હાથજી,
કાળ ક્રોધ વેરી મારવા - સદ્દગુરૂ નામનો આધારજી. એ હરિરસ...
૪ તનમન સોદાં જઈ કરી - ભક્તિ મળે મહાકાય જી,
મરજીવા હસે તે રસ માણસે - ઈ રસ મુખે ન કહેવાયજી. એ હરીરસ...
૫ બ્રહ્મ સાગરમાં ઝીલી રહ્યો - કિનારે શું કામજી,
અખંડ આનંદ જેના અંગમાં - મગનીદાસ કરે પ્રણામજી, એ હરીરસ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n61/mode/1up

realpatidar.com

ભજન

જુના ધરમ લ્યો જાણી મારા સંતો - જુના ધરમ લ્યો જાણી હેજી... વેલ...

૧ નદી કિનારે કોઈ જન ઊભો - તરસ નહિ સમાણી હેજી ,
કાંતો આળસું અંગ એનું - કાંતો સરિતા ખરે સુકાંણી.... મારા સંતો...

૨ કલ્પતરૂં તળે કોઈ જન બેઠો - ક્ષુધા ખૂબ પીડાણી હેજી,
નહિ કલ્પતરૂ એ નહીં બાવળિયો-કાંતો ભાગ્ય રેખા ભેળાણી. મારા સંતો...

૩ સદ્દગુરૂ સેવે શિષ્ય ન સુધર્યે - વીમળ મળી નહિ વાણી હેજી,
કાં ગુરૂ છે જ્ઞાન વિનાના - કાં પાપી એ પ્રાણી.... મારા સંતો...

૪ ભક્તિ કરતાં ભય દુઃખ આવે - ધીરજ નવ ધરાણી હેજી,
કાં સમજણ તો રહીછે છેટે - નહિ નામ નીરવાંણી... મારા સંતો...

૫ ચિંતામણી મળી પણ તોય - ચિંતા નવ હોલાણી હેજી,
નહિ ચિંતામણી નક્કી એ પત્થરો - વસ્તુ નવ ઓળખાણી..મારા સંતો...

૬ મળ્યું ધન તોય મોજ ન માંણી - કહું કરમની કહાણી હેજી,
કાંતો ભાગ્ય બીજાનું ભળિયું - કાંતો ખોટી કમાણી... મારા સંતો...

૭ અમૃત મળ્યું પણ અમર થયો નહિ - પીવાની જાગૃતિ ન જાણી હેજી,
કાંતો ઘટમાં ગયું નહિ કે - કાંતો પીવામાં આવ્યું પાણી.... મારા સંતો...

૮ ધરમ કરમને ભક્તિ જાણે - ભેદ વિના ધૂળ ધાણી હેજી,
કહે ગણપત સમજી લ્યો સંતો - પૂરી પ્રીત પ્રમાણી.. મારા સંતો...

ભક્તિનાં ભુષણ

રાતકો ભુષણ ઇન્દુ હય - દીનકો ભુષણ ભાનું હય.
દાસકો ભુષણ સેવા ભક્તિ હય - ભક્તિ કો ભુષણ વૈરાગ્ય હય.
વૈરાગ્ય કો ભુષણ જ્ઞાન હય - જ્ઞાન કો ભુષણ ધ્યાન હય.
ધ્યાન કો ભુષણ ત્યાગ હય - ત્યાગ કો ભુષણ શાન્તિ હય.
શાન્તિ કો ભુષણ સીલતા હય - નીગમ પદ નીરવાણ હય.
તુલસી પદ અમલ હય - અમલ અધાણું હય.
પારખ સે એ પદ પરખનાં હય. ગુરૂકૃપાએ એ પદ જાનાં હય..

realpatidar.com

https://archive.org/details/bk151/page/n62/mode/1up

realpatidar.com

ભજન

બની મેં તો સુરતા દોરી નટડી - બની મેં તો સુરતા દોરી નટડી.. વેલ...
૧ જ્ઞાન વૈરાગ્ય કુ ગલે લગાઓ - બાંધી હય દોરી જકડી. બની મેં તો...
૨ સતસંગ કા મેં ઢોલ બનાયા - ચોબ વિવેક કી લકડી. બની મેં તો...
૩ ઈંગલા પીંગલા કા બાંસ બનાયા - ઉપર સુરતા કી રસડી. બની મેં તો..
૪ અજંપા સે મેં ફૂક બજાઇ હૈ - સાસ ઉસ્વા સામે જકરી. બની મેં તો...
૫ ચોટ હમારી ગગન મંડળ કી - બ્રહ્મ નીરખવા દરસી. બની મેં તો...
૬ રૂપ અનુપમ એ નરજી કે - શીર પર કલગી લટકી. બની મેં તો...
૭ હરિૐ શબ્દ છે અનુપમ હીરલો-ખોજો જ્યાં હય ઝવેરી કી હાટડી. બની મેં તો
૮ દાસ ખેલત હય આપ અકેલા - લગી સુન શીખરકી સટકી. બની મેં તો.

ભજન

ભાઇ પેલી રે નીપાવી બાવે ધરતલી - પીછે પવન ને પાણી,
ભાઇ પેલાં રે ગણેશનાં -રિદ્ધિ સિદ્ધિ આગે છે વાણી,
ભાઈ વરતન જોઈ વસ્તુ વોરી એ હા... જેમાં રે આનંદ ઉપજે હરી.. વેલ...
૧ ભાઈ કાચે ઘડે રે નીર ક્યું રેવે - ક્યું રેવે કાગદ મે પારા,
ભાઈ બગલા મોતીડા કુ કયા કરે - મોતી હંસકા ચારા. ભાઈ વરતન...
૨ ભાઈ ગાફલ તસબી કુ ક્યા કરે - ક્યા કરે મુરખ માળા,
ભાઈ આંધળા આરસી કુ ક્યા કરે - જીસ ઘર ઘોર અંધારાભાઈ વરતન.
૩ ભાઈ વિનારે દિપક કૈસા મંદિર હય - જૈસા ત્રાટી કુ તાળા,
ભાઈ કીરીયા હિણા જોગી કૈસા હય-જૈસા નીર ભરીયા ખારા.ભાઈ વરતન...
૪ ભાઈ વિનારે ફરજન કૈસી માવડી - ક્યું કરી આવેલ પાંના,
ભાઈ દાસ ડુંગર પરી બ્રહ્મ બોલીયા-સદ્‌ગુરૂ શબ્દ ફરમાયા. ભાઈ વરતન

realpatidar.com

https://archive.org/details/bk151/page/n63/mode/1up

realpatidar.com

ભજન

વારંવાર ફેરા ફરીયો તું લાખ - શીખામણ ન આવી રે..
તોય નથી અભાગી તારૂં નાક. શીખામણ ન આવી રે...
ફરી ફરી ફેરા તું ફરીઓ શીખામણ -
ચાર ખાણે ચોર્યાસી અવતાર શીખામણ.....
ધરી દેહ મનુષ્ય અવતાર - શીખામણ.....
ભાર ભરી જનેતાએ જાયો શીખામણ.....
જેને હરિના ગુણ ન ગાયા - શીખામણ.....
ધીક જનેતાએ શીદ જાયો. શીખામણ.....
જેણે જાણ્યા નહિ ગુરૂદેવ - શીખામણ.....
નાક કાપ્યા તવ કાપ્યાં નહિ શીશ. શીખામણ.....
કરી કરમ ભરીયા કોઠાર. શીખામણ.....
પાપી ફરે ભોમીને ભાર. શીખામણ.....
સતસંગનો શાર ન સાધ્યો - શીખામણ.....
જેને વિષય રૂપિ વિષ પીધો. શીખામણ.....
જેને ગુરૂ વચન નવ ગૃહ્યો - શીખામણ.....
લાલદાસ કહે ઉત્તમ દેહ ખોયો. શીખામણ.....

ભજન

જીવ તું શાને ફરે રે ગુમાન માં - તારે રહેવું ભાડાનાં મકાનમાં... વેલ...
૧ જાણે મારૂં મકાન - કર્યું રંગને રોગાન,
જાણે લીધું છે વેચાણમાં. તારે રહેવું ભાડાનાં મકાનમાં...
૨ જાણે કરે રે રૂઆબ - જાણે બન્યો રે નવાબ.
કાળ આવીને કહે તારા કાનમાં. તારે રહેવું ભાડાનાં મકાનમાં...
૩ જમ લેશે ઝાલી - કરો પલમાં ખાલી.
હાડ એકે નહિ આવે તારા કામમાં. તારે રહેવું ભાડાનાં મકાનમાં...
૪ નીકળ્યું હુકમનામું - એમાં ન ચાલે બાંનું.
સંતો સમજાવે તમને શાનમાં. તારે રહેવું ભાડાનાં મકાનમાં...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n64/mode/1up

realpatidar.com

ભજન

૧ શામળિયાની સાથેરે - સુરતા તો લેરો લે છે,
ત્રિવેણીની ઘાટે રે - અનુભવની વાતો કે છે.
૨ નવી સૃષ્ટિ નવી દૃષ્ટિ - ગુરૂ વચને અમર વૃષ્ટિ,
ત્રીજું લોચન ખોલ્યું રે - સુરતાતો લેરો લે છે.
૩ પરાપરથી આવે વાણી - થોથાં પોથાં ભરે પાણી,
પ્રકાશ જુવે વાટે રે - સુરતા તો લેરો લે છે.
૪ અજા ફીટી સિંહ થયો - પોતે તે પોતાને લહ્યો,
વાદળ સુર ન છુપાયો રે - સુરતા તો લેરો લે છે.
૫ અપાર સિંધુ મોતી રે છે - હંસ હોય તે ગોતી લે છે,
ભુખ દુઃખ જાય ભાંગી રે - સુરતા તો લેરો લે છે.
૬ વૈરાગીને ગુરૂ મળ્યા - હવે તો ન પડીએ પાછા,
ન્યારો રહીને ખેલે રે - સુરતા તો લેરો લે છે.

ભજન

મારી રે કટારી સંતો પ્રેમની - લાગી મારા કલેજાની માંયજી,
અંગો અંગમાં જેની વેદના - ખટકે નીસ દીન તનમાંયજી... મારી રે..વેલ...
૧ સદ્‌ગુરૂ સાચા શિરધણી - તાકી માર્યાં મુજને બાણજી,
ઘાયલ કીધાં રે તન મન જ્ઞાનથી-એ સુખ જાણે કોઈ સુજાણજી.મારી રે...
૨ વ્રેહની અગ્નિ રે જેના અંગમાં - તેનાં તપીયાં છે તનથી,
સુખ નગમે રે આ સંસારનાં - સદ્‌ગુરૂ સાથે બાંધ્યાં મનજી. મારી રે...
૩ પ્રીત જોજો રે બાપૈયા તણી - તેની નવ ટળે ટેકજી,
પૃથ્વી પડ્યાં રે જળ નવ પીએ - અદ્ધર બુકે એક બુંદજી. મારી રે...
૪ પ્રીત હતી જેને પુરવેની - ગુરૂ વિના ઘડી ન રહેવાયજી,
જળ થી વછુટી જેમ માછલી - તલપી તલપી જાય પ્રાણજી. મારી રે...
૫ પ્રીત હતી ઓલ્યા ભવતણી - ગુરૂ મળ્યા તે જ્ઞાનીજી,
મગનીદાસ હરિ ગુરૂ ચરણે - વારંવાર કરૂ પ્રણામજી. મારી રે...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n65/mode/1up

realpatidar.com

ભજન

પામર હરિરસ સું પીએ - પામર હરિરસ સું પીએજી... વેલ...
૧ ખર સુંખાઈ જાણે ખીરને - મલકે ઉકરડે મનજી. એ પામર હરિરસ...
૨ કાગ મોતી કુ ક્યા કરે - મોતી હંસ કા ચારાજી,
પાન બીડાં સારે પાડાને - પાડા સોધે પરાળજી. એ પામર હરિરસ...
૩ અંધા આગળ ધરે આરસી - સમજે છાંણાં સમાનજી,
બહેરા આગળ સારે બોલવું - કેમ કરી ઊગડે રે કાનજી.એ પામર હરિરસ...
૪ ભમરે ગીગાને ભોળવી - દેખાડ્યો ફૂલડાંનો બાગજી,
જોતાં વાડી કેરાં ઝાડવાં - ભાખ્યો વિષ્ટાનો ભાગજી.એ પામર હરિરસ...
૫ સ્વાન ન સમજે સંપમાં - અગણીત દેતા ઉપદેશજી,
નજરે નાતીલા ન્યારી ને - દિલમાં દાખવે દ્વેશજી. એ પામર હરિરસ...
૬ અન્નનાં ભોજન સા ઊંટને - રીંઝે ઝાંખરાંને જોઈજી,
ઈતેડી વળગી આંચળમાં - પીએ પય છોડી લોહીજી.એ પામર હરિરસ...
૭ પુરૂસાતન ઈચ્છે પાવૈયો - એકે ન મળે ઈલાજજી,
કાળી કાંમળ અને કર્મ જનો - રંગ ન લાગે રૂપિરાજજી.એ પામર હરિરસ...

ભજન

ભુલીસ હું જગતની માયા - ગુરૂજી નહિ ભૂલું તમને,
જીવન આધાર દીન બંધુ - ગુરૂજી નહિ ભૂલું તમને.. વેલ...
૧ બનું હું રંક કે રાજા - કદાપી શેઠ દુનિયાનો,
અમીરી કે ફકીરીમાં - ગુરૂજી નહિ ભૂલું તમને.. ભૂલીસ હું
૨ કદાપી મહેલમાં સૂતી - રખડતી સહેર કે રસ્તે,
સુખી હો કે દુઃખી હો પણ - ગુરૂજી નહિ ભૂલું તમને.. ભૂલીસ હું
૩ દુઃખોના ડૂંગરા તૂટે - કદી આખું જગત રૂઠે,
પરંતુ પ્રાણને ભોગે - ગુરૂજી નહિ ભૂલું તમને. ભૂલીસ હું
૪ જગતના ધમ પછાડામાં - અગર મૃત્યુ બીછાનામાં,
મરણના સ્વાસ પણ લેતાં - ગુરૂજી નહિ ભૂલું તમને.. ભૂલીસ હું
૫ પુરાયા મન મંદિરે સ્વામી - પછીથી ક્યાં જવાના છો,
દિવાની દિકરી કહે છે - ગુરૂજી નહિ ભૂલું તમને. ભૂલીસ હું

realpatidar.com

https://archive.org/details/bk151/page/n66/mode/1up

realpatidar.com

ભજન

૧ પુરણ પાસ લીધો પ્રહલાદે - શિખામણ લીધી રે,
પાંચ કરોડીનાં કીધાં કાજ - શિખામણ લીધી રે.
૨ હરિચંદ્રે તનુ સરવે આસ - શિખામણ લીધી રે,
સાત કરોડીની ની ભરી સાંખ - શિખામણ લીધી રે,
૩ કાંઈક જાણ્યું યુધિષ્ઠિર રાય - શિખામણ લીધી રે.
નવ કરોડીના કર્યા નીવડાય - શિખામણ લીધી રે.
૪ સાચો કમળ કુંવરે ભર્યો સેરો - શિખામણ લીધી રે,
બાર કરોડીનો ટાળ્યો ફેરો - શિખામણ લીધી રે.
૫ ધ્રુવે ગ્રહ્યું માતનું વચન - શિખામણ લીધી રે,
પાંચ વરસના પધાર્યા વન - શિખામણ લીધી રે.
૬ જેશલ કરતો જગતમાં ચોરી - શિખામણ લીધી રે,
તેને ઓધાર્યો રાણી તોરી - શિખામણ લીધી રે.
૭ જે ગ્રહ્યાં ગુરૂનાં વચન - શિખામણ લીધી રે,
તેને ફરી ન આવે જનમ - શિખામણ લીધી રે.
૮ લાલદાસ કહે ગુરૂવિધિ - શિખામણ લીધી રે,
સાચા ગુરૂ મળ્યા અમને ખાકી - શિખામણ લીધી રે.

ભજન

અમે પંખીડા રે -જીવન દીન ચારનાં - હારે કોઈ આજે આવ્યાને કાલે જાવું.
પંખીડા રે જીવન દિન ચારનાં વેલ....
૧ કર્મ પ્રમાણે સૌ આવે આલોકમાં - અંતે છોડીને મારે જાવું પરલોકમાં,
હાંરે... મોહ માયામાં અંતે ફસાયાં પંખીડાં રે જીવન...
૨ વિષ રૂપિ બાગમાં માયાનાં ઝાડ છે - બાગ રૂપિ દોરથી આવી બંધાય છે,
હાંરે તારા માળા બાંધ્યા રહીજાશે પંખીડાં રે જીવન...
૩ કાળ રૂપિ બાજ તારી માથે ઊભો છે - આયુષ્યની દોરને કાપી રહ્યો છે,
હાંરે નંદુ ફેરો સફળ કરી લેજો પંખીડાં રે... જીવન...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n67/mode/1up

realpatidar.com

ભજન

કર મન ભજનનો વેપાર - હરીતારા નામનો આધાર. કર મન.... વેલ...

૧ પ્રથમ સમરૂ સરસ્વતી - ગુણપતીને લાગુ પાયજી,
દેવના ગુરૂદેવ ને સમરૂં - જ્ઞાની જ્ઞાન બતાય. કર મન...

૨ જયાં સરોવર નીર ભરીયાં - પ્રથમ ન બાંધી પાળજી,
નીર સગળાં વહી જાસે - પાછળથી પસ્તાય. કર મન...

૩ માતા તારી જનમ રૂએ - બેની રૂએ બારોમાસજી,
તેર દિવસ તારી પ્રિયા રોસે - જાશે ઘરની બાર... કર મન...

૪ શેરી લગણ તો સુંદરી - અને ઝાંપા લગણ મા બાપજી,
તીરથ સુધી બંધવો ભાઈ - જેમ ખોરીને બાળે દાડ... કર મન...

૫ દાડ જલે જેમ લાકડાં - અને બાલ જલે જેમ ઘાસજી,
કંચન વરણી કાયા જલસે - ઉડી જાસે ખાક... કર મન...

૬ મારૂં મારૂં મીથ્યા જાણો - જુઠો જગ વિલાસજી,
નરસૈયાના નાથને સમરો - ઉતારે ભવપાર.... કર મન....

ભજન

કર મન ભજનનો વેપાર - ધણી તારા નામનો આધાર.
કરમન ભજનનો વેપાર... વેલ...

૧ જેની દીશાએ મારો જીવ નમાને - માન મળતું જાયજી,
અજર પ્યાલા સભર ભરીયા - દેખતાં વીખ થાય. કર મન...

૨ કાગવાણી છોડ માંયલા - હંસની ચાલે ચાલજી,
પીંજરામાં પોપટ બોલે - તેમ રામસું લેહ લાય... કર મન...

૩ સંતના ઘરમાં સંખણી - મુરખના ઘરમાં નારજી,
લોભીના ઘરમાં લક્ષ્મી - નહિ ખુટે નહિ ખવાય.... કર મન...

૪ ભાવ રાખો માંયલ્યાથી - હેત રાખો અપારજી,
નુગરા નરથી દૂર રહેના - દેખી એના તાર. કર મન...

૫ પાંચ સાત નવ બાર - કરોડ તેત્રીસ દેવજી,
રાવ તરણસી બોલીયા - મારી બેડલી ઉતારો ભવપાર. કર મન...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n68/mode/1up

realpatidar.com

ભજન

સંગતો સાધુનો કરીએ રે - માંયલ્યા આવરણ મેલી,
દુઃખ સધળા છોડી દઈએ રે - થાય આનંદ હેલી..... વેલ....
૧ વકરમ કેરો ક્યારો કીધો - ખાતર તો કબુદ્ધી દીધું,
માંય અવિધ્યાનાં બીજ વાવ્યાં રે - નહિ ફાલે ને ફુલે.... સંગતો....
૨ સતસંગ કેરો ક્યારો કીધો - ખાતર તો કસ્તુરી દીધું,
માંય જેણાનાં બીજ વાવ્યાં રે - બહુ ફાલે ને ફુલે.... સંગતો....
૩ સોહંમ શબ્દ રૂદે ધરો - વાસનાઓ વાળી મેલો,
માંય ગંગા જમુનાનાં નીરવાળો રે - બહુ વેલો એ વધે... સંગતો....
૪ સત સંગનો સાર સંતો - બ્રહમાજી.. ના પામ્યા પાર,
બ્રહ્મા વિશ્નું મહાદેવ જ્યારે - સતસંગનું ફળ લેવા સારૂં...સંગતો....
૫ કહે રે પાડદાસ સુણો સંતો - એ વાતું છે અટપટી,
બંક નાળે ચડે શૂરા રે - પ્રેમ રસ પીએ પુરા. સંગતો....

ભજન

કોઈ હંસા નજર મેં આયા - કોઈ પંખી નજરમેં આયા,
જેની ચાંચ પાંખ નહિ કાયા... વેલ...
૧ એ.... અજબ શેરથી હંસા આયા - મોતી આહાર શું લાયા (૨)
છઠે આસમાન ગુરૂ જ્ઞાન બતાયા - તુમ ગુરૂને હમ ચેલા... જેની ચાંચ...
૨ વિના રે મુળ એક તરોવર ખડીયું - જેની ડાળ પંદ નહિ છાયા (૨)
ગુરૂ હમારા બહોત હઠીલા - ઉસકા સોહી ફલ ખાયા... જેની ચાંચ...
૩ વિનારે પાળ એક સરોવર ભરીયો - નીર નજર નહિ આયા (૨)
ગુરૂ હમારા બહોત જ્ઞાની હય - ઉસમે બૈઠ કર નાયા... જેની ચાંચ...
૪ એક ગુરૂને પાંચ ચેલા -પચ્ચીસ જોગણી લાયા. (૨)
એક અચંબા ઐસા દેખ્યા -બેટી બાપકુ જાયા .... જેની ચાંચ...
૫ વિના રે સૂંઢ એક હસ્તી દેખ્યા - પાંઉ નજર નહિ આયા (૨)
મચ્છન્દર પ્રતાપે જતી ગોરખ બોલ્યા-જોત મેં જ્યોત મીલાયા.જેની ચાંચ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n69/mode/1up

realpatidar.com

ભજન

જપો જપો અજંપા જાપ ઋષિરાજ - જાપ જરૂર જેણ જટકે છે,
ટળે ટળે ત્રીવીધીનાં તાપ ઋષિરાજ - તીમીર તેથી ત્રટકે છે.... જપો જપો.. વેલ.

૧ સાખી : શબ્દ અનુપમ વેદનો - શોધીને શુદ્ધ થવાય,
મહા શબ્દ મહા વાયકનો - શુદ્ધ શોધીને ગાય.
મૂમુક્ષુને મળે મહાજાપ ઋષિરાજ -
ખટરાગ અંતર ખટકે છે. જપો જપો..

૨ સાખી : રણુંકારે એ લાગી રહ્યો - શ્વાસ ઉશ્વાસે જેમ,
રોમે રોમે વ્યાપી રહ્યો - નુર નારાયણનું તેમ.
લાગે લાગે તે વેદના તાપ ઋષિરાજ -
રોમે તે રોમે ખટકે છે. જપો જપો..

૩ સાખી : શુન શિખર સુરતા ધરો - કમાન કરડી તાણ,
દમ માંયથી દમ ભરી - જર જરતાં એ બાણ.
આપો આપો તે આપણું આપ ઋષિરાજ -
ખુબીથી ખાટલી ખટકે છે. જપો જપો....

૪ સાખી : મહા શબ્દ મહા વેદનો - કલમો કીતાબી પાક,
જાપ જપીએ ગુરૂમુખનો - તો પ્રત્યક્ષ પીર પાક.
સાથે રાખો સદ્‌ગુરૂજીની મહોર ઋષિરાજ -
સુખમણા સેજે સટકે છે. જપો જપો......

૫ સાખી : ઉલટા સુલટી આમળી - સો હમ સાથે જોડ,
સદ્‌ગુરૂ મુખથી સાંભળો - મનની મમતા છોડ.
દાસ ખોળીજો ને તારૂં આપ ઋષિરાજ-
બાહેર આમ કેમ ભટકે છે. જપો જપો........

realpatidar.com

realpatidar.com

ભજન

મારી બેડલી ઉતારો ભવપારા - એવા સાહેબ સરજનહારા. મારી.....વેલ.

૧. કામક્રોધ માંહી મચ્છજ મોટા....બીજા જીવન અપારા ભાઈ.બીજા જીવ....
મન પવન માંહી દોટું મારે - દરિયા કરે ધધકારા. મારી...

૨. દયા ધરમની દોરી બાંધો - સડ કરો તૈયાર. ભાઈ સડ....
સીલ સંતોષનાં નાંગળ નાખો - એની વીધી રહો હો સીયારા... મારી...

૩. સંત સોદાગર વસ્તુવોરો - માલ ભર્યા માંહી સારા. ભાઈ માલ.....
રખે વાણ કે વીલંબજ કરતો - વેળ ચડી ચોધારા.... મારી....

૪. તીલકદાસ નીત નાવડું - સંત ચલાવન હારા ભાઈ સંત.......
કીધી કમાણી તારી ચોપડે ચડસે - તમે સમજો સમજણ હારા.મારી...

ભજન

તું ચેત ચતુર ચીતમાંહી - તારો અવસર અબ વહી જાય. તું ચેત...વેલ...

૧. તીન લોકની ફાંસી માંડી - જીવ ફસાંણો માંહી ભાઈ જીવ
કાળ બિલાડો સીર પર તાકે - તને પલકમાં લઈ જાસે. તું ચેત....

૨. તીન જણા તારે તસકર ભારી - કાયા નગરની માંહી. ભાઈ કાયા...
ચાર જણાની ચોકી રાખો - ચોર ન પેસે માંહી. તું ચેત....

૩. ઓહમ સોહમની રટના રટલે - શ્વાસ ઉચ્છવાસની માંહી ભાઈ શ્વાસ...
રામનામના રતન ખજાના - કબુ ના ઓછા થાય. તું ચેત...

૪. દયા ધરમની ધજા ફરૂકે - તારા પ્રેમ નગરની માંહી ભાઈ પ્રેમ.....
નામ નીસાંને જે નર ચડિયા - જીત લિયા જમરાય. તું ચેત...

૫. મોહ માયાની ફાંસીમાં ફસીયો - હાથ ન આવ્યું કાંઈ. ભાઈ હાથ....
તીલકદાસ કહે સાહેબ સમરો - ભવ સાગર કે માંહી. તું ચેત...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n71/mode/1up

realpatidar.com

ભજન

મોહે મીલા પ્રેમગુરૂ પુરા - એવા નકલંકી નીજ નુરા. મોહે મીલા.....વેલ...

૧. મોહ માયા મમતા તજીને - ચડિયા શીખર ગઢ સુરા - ભાઈ ચડિયા.......
દોહી દીલમાં અદલ ચલાવે - કીયા તે ચકમા ચૂરા....મોહે મીલા પ્રેમ....

૨. ડંકા દીયા નીજ નામકા - અને કાળ કટકા કીયા દૂરા. ભાઈ કાળ......
ત્રિવેણી તારમાં બાજે - બાજે અનહદ તુરા.... મોહે મીલા પ્રેમ...

૩. ભવર ગુફા માંહી ગેબી ગરજે - સનમુખ રહે હજારા - ભાઈ સનમુખ......
જનમ મરણ કા શંસય છૂટે - રહે પુરુષ કે પુરા.....મોહે મીલા પ્રેમ....

૪. અમૃત બુંદ મળી સમુદરમેં - સમુદ્ર રહ્યા ભરપુરા. ભાઈ સમુદ્ર......
ચાંચ ભરી એક ચીડિયા પીવે - સાગર નહિ અધુરા. મોહે મીલા.....

૫. તીલકદાસ કહે સાહેબ સમરો - રહો ભજન મેં ભરપુરા - ભાઈ રહો...
કરી કમાણી તારી કબુ ન તૂટે - સાહેબ દે મજારા. મોહે મીલા...

ભજન

જેનું મન ભયું અનુરાગી - જેની શુરતા શબ્દમાં લાગી
જેની શુરતા શબ્દમાં લાગી - જેનું મન ભર્યું અનુરાગી..... વેલ....

૧. આસન વાળી ગગન થંભ રચીયો - સુરતા સનંમુખ લાગી. ભાઈ સુરતા.....
અર્ધ ઉર્ધ કે ઉપરે - ભાઈ જ્યોતિ ઝળહળ જાગી.......જેનું મન.........

૨. ઝરમર ઝરમર મેહુલા વરસે - અમૃત જડિયા જાગી. ભાઈ અમૃત.....
સ્વાંતિ બિંદુ કુ ગૃહે બપૈયો - જબ ન તૃષ્ણા ભાંગી. જેનું મન........

૩. તીન લોકમાં ત્રીગુણી માયા - તા કુ દો તુમ ત્યાગી. ભાઈ તાકું.......
નામ નિરંતર જે નર જા ને - તા કા મન વૈરાગી. જેનું મન........

૪. સદગુરૂ મળીયા સંસય ટળિયા - ભય ભ્રમણા ભાંગી -ભાઈ ભય......
માયા મમતા સબ છૂટી મનકી - રામ નામ રઢ લાગી. જેનું મન.......

૫. માનદાસ ગુરૂ મુજે મીલીયા - સેજ સમાધી લાગી. ભાઈ સેજ......
તીલકદાસ કાયા કે ભીતર - જોયું ચીતમાં જાગી. જેનું મન.......

realpatidar.com

realpatidar.com

ભજન

એવા પ્રેમી જનપુરા - જેને સદગુરૂ મળીયા કબીરા,
જેને સદગુરૂ મળીયા કબીરા - એવા પ્રેમી જન પુરા.

૧. નુરત સુરતની શેરી સોધો - ખેલ કરી ચોધારા. ભઈ ખેલ....
શ્વાસ ઉશ્વાસે સાહેબ સમરો - નીરમળ વચ્ચે નુરા....... .એવા પ્રેમી......

૨. ચાર વેદ સે ભેદ જ ન્યારા - બાવન અક્ષર સે બારા. ભાઈ બાવન....
અર્ધ અક્ષર સે આપ અલેખા - ત્યાં પહોંચે સંતપુરા. એવા પ્રેમી......

૩. નામ નિરંતર નીજપદ નીરખો - સમજો સમજણ હારા ભાઈ સમજો....
ગયો વખત તને ફેર નહિ આવે - છોડો ચીતકા ચાળા. એવા પ્રેમી......

૪. જ્ઞાન ગંગામેં નીસ દીન નાહીયે - નિર્મળ હોત શરીરા ભાઈ નીરમળ....
બ્રહ્મ ચક્ષુ જેની અંદર ઉલટી - આવે સુખકી સીરા. એવા પ્રેમી.....

૫. તીલકદાસ ચીત ચોકસ કરી લે - એક નામ આધારા ભાઈ એક...
જો ખોજો સો અંતર માંહિ - મત ભટકો તમે બારા. એવા પ્રેમી....

ભજન

જીવ પડ્યો જંજાળમાં ને - શીર ઉઠાયો ભાર
કંઈક જનમનાં કર્મ કમાયલાં - પાપી કરમ ચંડાળ
કુડાનર કેમ તરે રે (૨) - અંધા ઉજ્જડ જઈ અથડાય. કુડાનર.....વેલ....

૧. ધીક ધીક જનૂની જનમ ધરાયો - લઈ પાપી કર્મ ચંડાળ....
મુખ દીઠે જેનું ઝેર ચડે - ભાઈ ઈ ભોમીને ભાર. કુડાનર...

૨. સ્વાન સરીખો ભમતો ભટકે - પેટ ભર્યાને કાજ....
સગાં કુટુંબ તેને સૌ મળીયાં - ન કઢા નાવિ લાજ. કુડાનર...

૩. ભેખ ભગતની હાંસી ઉડાવે - મનમાં રાજી થાય...
કુબુદ્ધિમાં તું કુટાઈ મુઓ - પછી સેંજે નરકમાં જાય. કુડાનર...

૪. પરધનને દેખી ઉરમાંને - લેવા મનમાં ધારે..
તીલકદાસ કહે જા જા તુજને - જમ જોડા શીર મારે. કુડાનર......

realpatidar.com

https://archive.org/details/bk151/page/n73/mode/1up

realpatidar.com

ભજન

ભજન કર ભાવથી રે - ભજન કર ભાવથી રે,
ભજ તું એક નિરંતર નામ - ભજન કર ભાવથી રે..... વેલ......

૧. સ્વારથ સઘળો છોડી કરીને - રહે નામમે લીન,
જાયા સો રહેવે નહિ - જાના હૈ નિશ્ચિત. ભજન કર......

૨. માયાકો સંગરો કરીને - દાબી બેઠો દામ,
મરવા ટાંણે મુરખાને - કોડી નહિ આવે કામ. ભજન કર......

૩. સાહેબ કો સ્મર્યા નહિને - મુરખ મુઢ ગમાર,
આવ્યો સોદો સાધવાને - પામી બેઠો હાર.... ભજન કર.....

૪. મનની મમતા છોડ દે - ભજ એક નિરંતર નામ,
સું કરવા તને સરજીયો - ભજ્યા નહિ ભગવાન ભજન કર.....

૫. સોદા કરી લે સ્યામસું - નહિ ઔર ન સું કામ,
પેટ ભર્યું તે પાપીયા - તું કેમ પોંચીસ નીરવાણ. ભજન કર.....

૬. મરવા સુતો મુરખા - તારી કોઈ નહિ આવે સાથ,
તીલકદાસ કહે શું કરવા - તે શમર્યા નહિ જગનાથ. ભજન કર....

ભજન

જ્ઞાની નર ગોતજો રે - માતમ મોતીના મરમ. જ્ઞાની નર ગોતજો. વેલ...

૧. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં ને - જોયા સાતે દીપ......
ખારા સાંયર નીપજે - જેમાં મોતી સંગરે છીપ જ્ઞાની નર.....

૨. સ્વાંતી જળ સંચર્યો નહિ - જો પડે ઘણી માય,
સંત ઝવેરી એના પારખું - એ તો મુલે મોઘાં વેચાય. જ્ઞાની નર....

૩. મોતી આ મોંઘા મુલનું - એને જાળવજે શીર સાટ,
સનમુખ રહેજે સંતથી - તો પહોંચીસ સોયલી વાટ. જ્ઞાની નર....

૪. અમૃત પીધાં પ્રેમથી ને - સંત વિરલા જેણે,
સુરતી સ્વાગણ સુંદરી - લઈ અમર વરમાંણે. જ્ઞાની નર....

૫. સોદા કરી લે શ્યામસે - મત જાણે તું જૂઠ,
તીલકદાસ કહે સાચ સમજલે - મત જાણે તું જૂઠ જ્ઞાની નર....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n74/mode/1up

realpatidar.com

ભજન

અમર પદ ઓળખો રે - અમર પદ ઓળખો રે.
કરૂણા માંય કબીર - અમર પદ ઓળખો રે.....વેલ......

૧. પાંચ તત્ત્વસે પાર પરિબ્રહ્મ - ને અક્ષર કુ જાણે,
ક્ષર અક્ષરસે ન્યારા રેવે - સોહી અમરપદ ઓળખો રે અમરપદ....

૨. ઓહમ સોહમ સુવાસસે - અને રણુકા રસે ભીન,
બાવન અક્ષરસે બોલે - અર્ધ અક્ષર નીજ ચીન અમરપદ....

૩. તીન ગુણ વ્યાપે નહિ - અને મન ઈન્દ્રી ગુણ નહિ,
રોમ રોમ રામ રસી રહ્યો - જયું સુગંધ ફુલન કે માંહિ અમરપદ.....

૪. હંસ ગયા સત લોકમે - અને મિથ્યા ત્રિવિધિ તાપ,
કપટી નર તો કેમ તરે - સીર સાહેબ કી છાપ અમરપદ....

૫. બધુ કચ્છમાં બધ ચલાવે - ધર્મ ધુરંધર ધીર,
તીલકદાસ પર મહેર કરો - તમે ગુરૂ બાળાપીર..... અમરપદ....

ભજન

મુરખ મન ચેતજે રે - આવી રતનમણિ તને જડી,
જતન કરીને જાળવજે - જેની ખબર તને ન પડી મુરખ મન વેલ..

૧. મેડી મંદિર તારાં માળીયા - માંય રહેવું એક જ ઘડી
છત્રપતી જેવા ચાલ્યા ગયા - જેની નોબત આગે ખડી. મુરખ.....

૨. ધન દોલત ને માલ ખજાના - રહેસે તારા પડી,
પ્રભુના નામે તે પૈસો ન વાપર્યો - તારી માયા રેસે પડી. મુરખ....

૩. સાચાં સગાં તારાં સંત છે - જેની લાળે રહેજે લળી,
બીજા તને કોઇ કામ ન આવે - તારી કાયા જાસે પડી. મુરખ...

૪. તીલકદાસ કહે ત્રિવેણીમાં - ઝળહળ જ્યોત જ ખડી,
દર્શન કરી લે દેવનાં - તો જીત કાળ સે લડી. મુરખ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n75/mode/1up

realpatidar.com

ભજન

હીરો તું ખોમાં હાથથી - આવો અવસર ફરી પાછો નહિ મળે,
ખોઈ બેઠો બંદા ખાખમાં - માથે ત્રિવિધિ ના તાપ જરે. વેલ...
૧. મોતી પડ્યું મેદાનમાં - તેનું મુરખાને મુલ ન મળે,
સંત ઝવેરી એના પારખુ - જેને સદગુરૂ સાન કરે, હીરો તું......
૨. પાર ઉતરવું પ્રેમથી - જેમ જળ પર જહાજ તરે,
કાચો કુપો જળે ભર્યો - માંય અમૃત નીર ઝરે હીરો તું......
૩. ભ્રંગી ભેદ જ્યું કરે કીટકું - એમ ગુરૂ વિના મૂક્તિ ન મળે,
પારસ મણીનું પારખું - જેમ લોઢું કંચન કરે..... હીરો તું......
૪. તીલકદાસ કહે સુરા સંગ્રામે - જેમ મરજીવા મોજું કરે,
ધારણ બંધાસે ધર્મની - તેનો તોલ ત્રાજવે તળે હીરો તું......

ભજન

આ મનખો તો ફરી નહિ આવે - કઈએ ફેરસો માળા
પશુ પંખીનો અવતાર આવ સે - પડ્યો ચોર્યાસી અવતારા
મન તમ કઈએ ફેરસો માળા. વેલ....
૧. ઘરધંધાની ઘાણીમાં ભાઈ - ફરતાં ન આવે પારા
રાત દિવસ તમે રળતાં ગુમાવો - ન કરે આપ સંભાળા. મન તમે....
૨. માયા કારણ મથી મરેલા - જાુઠો જગ સંસારા,
હાથ ખંખેરી ખાલી જાસો - મુખડે પડસે છારા. મન તમે....
૩. સંચિત તારાં સાચાં હતાં - ભાગ્ય હતાં વીસાળા,
ઓતમ કુળમાં અવતાર આવ્યો - ખાઈ જસો જનમારા મન તમે....
૪. વાર ન થાય પણ વારોટ આવ સે - આવ સે જમ નીવારા,
જરૂર જલદી જમ લઈ આવે - પકડી જાય પરબારા. મન તમે...
૫. આપ સંભાળી આપણું પોતે - કરો જીવની વારા,
ગુરૂ ચરણે ખાકી ભણીએ - નામ વિના નહિ નીસ તારા. મન તમે...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n76/mode/1up

realpatidar.com

ભજન

ધન ધન સત ગુરૂ સુરા સંત - શબ્દ કોઈ ચીને વીરલા કોઈ
ચીને વીરલા કોય - જેને વચન પારખુ હોય વેલ...

૧. મુળ શબ્દ ગગન પર ગરજે - અગમ અગોચર સોઈ,
જ્ઞાન ગંગામાં નીસ દીન નાહીએ - તારી વૃત્તિ નિર્મળ હોય. ધન ધન....

૨. મુજ વિના તું છોડ સફળ - તારી જીવનમૂક્તિ હોય,
પરા- પસ્યંતી મધ્યમ - વેખરી વિવેક વિચારી જોય. ધન ધન....

૩. જાગૃતમાં તમે જુવો વિચારી - સપનામાં સુખ ન હોય,
તુરીયાતીત તીન ગુણથી ન્યારી - ખરી અવસ્થા સોય. ધન ધન....

૪. આશા ત્રષણા છોડ અંતરકી - તારી સંગ ન ચાલે કોઈ,
તીલકદાસ કહે સત સંગ કર લે - સાથ ચલેગા સોય. ધન ધન....

ભજન

એવી આ તનતા નગરી રે, - માંય મનજીભાઈ છે રાજા,
જીવરાજ ભાઈને માથે રે - દુરીજન રહે છે ઝાઝા..... વેલ.....

૧. ઈ રાજાની બે રાણીયું - પરવરતી પાટ રાણી કહેવાય,
ને વરતીનું કાંઈ ન ચાલે - અને પરવરતી કરે પાય માલ,
તેની તૃષણા બાઈ છે દાસી રે - માંય વાંધા કરે છે ઝાઝા. એવી આ તનતા...

૨. ધનજીભાઈ તો દિવાન છે - અને ક્રોધભાઈ છે ફોજદાર,
એકાર ભાઈ તો ન્યાયાધીશ છે - અને લોભજીભાઈ અમલદાર,
એમાં પરનીંદા પોલીસ પટેલ રે - આગી પાછી કરે ઝાજી..એવી આ તનતા...

૩. વિવેક ભાઈ તો વણજારો છે અને શેરમાં કરે સુધાર,
કામદેવ ભાઈ તો કામદાર છે - ને નગરીમાં કરે વણાસ,
એના કામદારો કુડારે- માંય અભરા નોકર ઝાઝા....એવી આ તનતા......

૪. મન મમતા ને મારીએ - અને જલદી આવશે જરૂર,
નવ નોકર ભેળા થઈને - જીવરાજ ભાઈને મરવસે જરૂર,
એમ દાસ ખાકી કહે ગુરૂચરણે - નીવરતીને આપો રાજ. એવી આ તનતા..

realpatidar.com

https://archive.org/details/bk151/page/n77/mode/1up

realpatidar.com

ભજન

આવોને આતમરાય આપણે જ્ઞાન સાંભળીએ રે........ વેલ.......

૧. કરીએ સત્યનો વિચાર- સતીયાં હોય નર ને નાર,
સત્યે ચાલે છે સંસાર - સતે મેઘ વરસે ધાર... આવોને.......

૨. પીતળ પીળું તો દેખાય - જ્યારે સોની પાસે જાય,
એ તો અગ્નિમાં તપાય - ત્યારે કિંમત એની થાય. આવોને......

૩. હિરો ઝવેરીને ઘેર જાય - જ્યારે એરણમાં ઓરાય,
ખમસે ગણ કેરા ગાય - ત્યારે મુલથી વેચાય... આવોને.....

૪. જ્યારે સભાઓ ભરાય - ત્યારે સાધુ સંત ભેળા થાય,
સંતની છાપ ત્યાં છપાય - ત્યારે ભગત કહેવાય..... આવોને.....

૫. ગુરૂના ગમ વિના ગાય - એ તો મુરખો કહેવાય,
નુગરા નરકમાં લઈ જાય - એની મોક્ષ ગતિ ન થાય... આવોને.....

૬. પ્રેમનો પાટ માંડાય - પ્રભુની જ્યોત ત્યારે પ્રગટાય,
મનની માંડવડી રચાય - દિલ સુદ દાન ત્યાં દેવાય.... આવોને.....

૭. ગંગા સમુદ્રમાં જાય - ત્યાંતો એક રૂપે થાય,
એમાં નર નારી નાય - એનો મોટો છે મહિમાય.. આવોને.....

૮. આસન પદમાસન થાય - ઓહમ સોહમ જાપ જપાય,
ત્રિકુટી મેલમાં દેખાય - ત્યારે કારજ તારું થાય..... આવોને.....

૯. તૃષ્ણા તરત મટી જાય - આત્મા રૂપે રે ઓળખાય,
જીવ મટી શીવ ત્યારે થાય - એના ગુણ ગણપત ગાય. આવોને....

ભજન

વૈષ્ણવજનતો તેને કહીએ - પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોય - મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન વેલ...

૧. સમદ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી - પર સ્ત્રી જેને માત રે.....
જીત્યા થકી અસત્ય ન બોલે - પરધન ન જાલે હાથ રે... વૈષ્ણવજન......

૨. મોહમાયા લોપે નહિ જેને - દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.....
રામ નામ સું તાળી લાગી - સકળ તીરથ તેના તનમાં રે. વૈષ્ણવજન......

૩. વણ બોલી ને કપટ રહીત છે - કામ ક્રોધ ને વાર્યા રે....
ભણે નરસૈયો તેનાં દર્શન કરતાં- કુળ એકોતેર તાર્યા રે. વૈષ્ણવજન....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n78/mode/1up

realpatidar.com

ભજન

રામ સભામાં અમે રમવાને ગ્યાંતાં
પસલી ભરીને રસ પીધો હરિનો રસ પુરણ પીધો વેલ.....

૧. પહેલો પીયાલો મારા - ગુરુજીએ પાયો,
બીજે પીયાલે રંગની - રેલી હરિનો રસ પૂરણ પીધો....હરિનો રસ...

૨. ત્રીજો પીયાલો મારા રોમે રોમે વ્યાપ્યો
ચોથે પીયાલે થઈ છું ઘેલી....... હરિનો રસ.....

૩. પાંચમે પીયાલે ગુરુજી થયો રે પ્રકાશ,
નીરખ્યા નિરંજન નાથ, હરિનો રસ......

૪. રસ બસ થઈ છું હું તો રસિયાની સાથે
વાલે રમાડ્યાં અમને રાસ. હરિનો રસ......

૫. મોટા જોગેશરોને સપને ન આવે,
તે મારા હૈયામાં મહાલે. હરિનો રસ.....

૬. અખંડ હેવાતણ મારા હૈયામાં કરજો,
અખંડ સૌ ભાગી અમને કીધા. હરિનો રસ.....

૭. ભલે રે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી. હરિનો રસ.....

ભજન

મનતું અળગું કાં અફળાય - બીજો નથી બોલતો... વેલ...

૧. તું તો ખોળીને જો તારા રૂપને - ખોળી જોતામાં તું તો ખોવાય.. બીજો....
૨. તારે ઓથે હરિને નથી દેખતો - કુંડળ ઓથે જેમ કનક ઢંકાય બીજો....
૩. તું તો દરિયાની લહેર સમાન છે - લહેર સમતાં જેમ સમુદ્ર દેખાય બીજો....
૪. તારે ઠેકાણે હરિને ઠેરાવને - એમ સમજે તો મહાસુખ થાય. બીજો....
૫. કહે પ્રીતમ એવા પુરુષને - હું તો લળી લળી લાગું પાય. બીજો...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n79/mode/1up

realpatidar.com

ભજન

પ્રભુ તારી કેમ કરું હવે માળા - ભજનમાં ભંગ કરે ભમરાળા. પ્રભુ તારી ..

૧. મન મસ્તાનું થર ન રહેવે - ચિત કરે ઉચાળા
મન તો કેમ કબજે ન રહેવે - ભટકે છે ભમરાળા પ્રભુ તારી.....

૨. ધજા પેરે મન ફરું કે - થર ન રહેવે લગારા,
ચૌ દીસે ચોધારાં ફરે - ફરે મન મકરાળા... પ્રભુ તારી.....

૩. પરવરતીને પરા કરું તો - ત્રસના કરે ઉતારા,
ને વરતીને આવવા ન દેતો - કજિયા લે ઉધારા. પ્રભુ તારી.....

૪. ધ્યાન સમાધિની કરું સામગ્રી તો - આળસ કરે ઉતારા,
સુરતીની સાને ચડવા ન દેતો - ધ્યાન ચુકાવે તમારાં. પ્રભુ તારી....

૫. કરમાં માળા લઈ કરું સ્મરણતો - નીંદ આવે અપારા
ગુરૂ ચરણે ખાકી ભણીએ - એટલાં દુઃખ દે અપારા. પ્રભુ તારી...

ભજન

હો જીવરામભાઈ શેઠીયા રે - વિરા સતનો વેપાર કરજો.. વેલ....

૧.સુરત નામની સડકે થઈને - સુખમણા શહેરમાં જ જો,
ઓહમ સોહમની શેરીએ થઈને - ધરમ બજારે જઈ ચડજો હો જીવરામ...

૨.હૈયાની હાટડીને કુબુદ્ધિનાં કમાડ છે - તેને સતસંગની સારડી નંખાવજો,
નવધાનો નકુચોને ત્રિવિધિનાં તાળાં જડ્યાં છે - તેને ગુરુગમની
ચાવીઓ લગાવજો. હો જીવરામ....

૩.તનનાં ત્રાજવાં ને મનની દાંડી, ને વરતીનાં નાથણાં નંખાવજો,
નેમની નવટાંકને પ્રેમનો પાસેરો - સતના સેરે તોળજો, હો જીવરામ....

૪.ઝવેરી બજારમાં જઈને - નાણાંવટિયાની પેઢીએ વણજો કરજો,
હીરા માણેક મોતી લાલ પદારથ - નેણે નીરખી લેજો... હો જીવરામ....

૫.ગુરૂ પ્રતાપે કહે જ્ઞાન નાથ - અમુલખ વસ્તુ વહોરજો,
શુરા પુરાનો સંગ કરીને - તમે મહા પદવી મેળવજો.. હો જીવરામ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n80/mode/1up

realpatidar.com

ભજન

શાંત ચિતે સંસારમાં મહાલજો
જો જો જરાયે ઉતાવળ ન થાય - ધીરજ નવ જાય - સંસારમાં મહાલજો વેલ...

૧. પહેલી શ્રદ્ધા પ્રભુ પર રાખજો
ગટગટમાં વ્યાપેલો છે નાથ - હૈયે રાખજો હાથ સંસારમાં.......

૨. મણકા એક દોરીમાં પરોવ્યા
તેમાં સરવે વ્યાપેલો નાથ - બનીને અનાથ. સંસારમાં......

૩. કડવું મીઠું ગળવાની ટેવ પાડજો
કોઈને કહેતાં ન કડવું બોલાય - ન કોઈને દુભવાય. સંસારમાં......

૪. કોઈનાં દુખડાં જોઈને દિલડાં બાળજો,
સુખીયાં જોઈને મન હરખાય - હૈયે શાંતિ થાય. સંસારમાં.....

૫. કોઇના દિલમાં સમાવવાનું શીખજો,
વિના સ્વારથમાં રાખીને પ્રેમ - સેવા કરો નેમ. સંસારમાં....

૬. જીવન ઓછી વસ્તુથી નીભાવજો
તેથી ઓછું કમાવાનો ભાવ - ઓછાં થાય પાપ.... સંસારમાં....

૭. કોઈનું જોઈને ન આપણું ભુલાયજો,
જે છે આપણું તેમાં સંતોષ - નવ જુવો કોઈનો દોષ. સંસારમાં....

૮. મનને જરીએ નવરૂ નવ રાખજો,
તેને સોંપજો મહેનત કામ - સાથે રામ નામ.... સંસારમાં.....

ભજન

માનને માનને માનને રે..... તું ગુરૂની શીખામણ માનને.... વેલ....

૧. મહામંત્ર કરૂણા કરી આપ્યો - વિચાર કર તેના સારને રે. તું ગુરૂની.....

૨. દસે ઇંદ્રીઓ દમન કરીને - વિષયથી મન વારને રે. તું ગુરૂની....

૩. સત્ય અસત્યનો વિચાર કરીને - દેહા ધ્યાસને ટાળને રે. તું ગુરૂની.....

૪. જનમ મરણનું કારણ તારું - વાસનાના બીજને બાળને રે. તું ગુરૂની.....

૫. ભાણ કહે શત ચીત આનંદમાં-સમજીને ઉતરો ભવપારને રે. તુ ગુરૂની......

realpatidar.com

https://archive.org/details/bk151/page/n81/mode/1up

realpatidar.com

ભજન

ધન ધન પુરણ પ્રગટ્યા ભાગ - શબ્દમેં સુરતા સનમુખ લાગી,
શુરતા સનમુખ લાગી જગતકી - ભય ભ્રમણા ભાગી....... વેલ.....
૧. ઉઠત બેસત જાગત સોવત - શ્વાસે શ્વાસે લવ લાગી,
ગગન મંડળમાં રમે યોગેશ્વર - મોહન મોરલી વાગી. ધન ધન......
૨. સપ્ત ધાતુકા બનાયા પુતળા - અમૃત જડિયા જાગી,
સુગરા હોય સો ભર ભર પીવે - નુગરા દેતા ત્યાગી. ધન ધન.....
૩. મનકી મુંદ્રા પેર જગતમે - કુટ કપટ દે ત્યાગી,
શીલકી શેલી પેર ગલેમેં - બ્રહ્મ અગની લઢ લાગી. ધન ધન....
૪. તીલકદાસ તું જાગ જગતમેં - લાય ઘેર ઘેર લાગી,
આ અવસર તારો ઉગરવાનો - ગેબી ગટ રહ્યા વાગી. ધન ધન...

ભજન

તું તો આપે છે આતમ રામ - ખબર વિના હાલે ખોળતો,
મૃગ ભૂલ્યો માયા મોહજાળ - હાલે જાંજવાનાં નીર જાુલતો.. વેલ.....
૧. તેમાં કોઈની ન છીપી ત્રષણા - એવી આપદા રૂપિ રાત છે,
તેમાં જાગસે કોઈ હરિજન - બીજી ભુલવણીની વાત છે.... તું તો...
૨. તારા મોહરૂપી મંદિર - પાખંડ રૂપી પલંગ પોઢવા,
અજ્ઞાન સ્ત્રીનો સંગ - ઉપર લોભ પછેડી ઓઢવા... તું તો.....
૩. જડ્યાં કુબુદ્ધિનાં કમાડ - ભુંગળ બ્રહ્મણાને નથી ભાળતો,
તારા વહાલાં વિષેની વાત - તારા દિલથી નથી ટાળતો...... તું તો.....
૪. તારા ખેડમાં આવી ખોટ - ખેતર વાવણી ટાણે વાવઠું,
આવો અવસર એળે જાય -બધો મેઘ ગળ્યો જેમ માવઠું... તું તો.....
૫. તારા આદી મધ્ય ને અંત - જોતાં જાત ન જડી જીવની,
મુળદાસ કહે કહ્યું માન - સમસ્યા સમજી લેને સીવની... તું તો....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n82/mode/1up

realpatidar.com

ભજન

આતમ તત્ત્વ તું વિચાર - એ વિણ નાવે તારો પાર..... વેલ.....

૧. શોહં શિવોમ મન ધાર - એ વિણ નાવે તારો પાર,
એ વિણ નાવે તારો પાર - એ વિણ થાય નહિ ઉધાર... આતમ....

૨. મોંઘો અવસર તુજને મળિયો - કરૂણા સીંધુ તુજ પર ઢળિયો,
મેલી દે એના પર ભાર - એ વિણ નાવે તારો પાર..... આતમ...

૩. ચારે વેદાજ્ઞા શીર ધારી - ચારે મહા વાક્યો વિચારી,
છોડી દે સગળા વિકાર - એ વિણ નાવે તારો પાર..... આતમ...

૪. સપના જેવું આ જગ જાણી - મોંઘો મહા રસ લેને માણી,
આ છે સાર તણો પણ સાર - એ વિણ નાવે તારોપાર.... આતમ...

૫. જન્માદિ ધર્મો નહિ તારા - શીદને માને મારા મારા,
શંકર રમે બાવન બારા - એ વિણ નાવે તારો પાર... આતમ...

ભજન

જેને સંત સમાગમ સાચો થયો - તેનો અંતરનો અંધકાર ગયો. વેલ...

૧. જેને જ્ઞાન રવિનો ઉદય થયો - તેને રજુનો સર્પ ભુસાઈ ગયો. જેને સંત.
૨. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો - તેનો ભવજળ સીંધુ સૂકાઈ ગયો. જેને સંત.
૩. જેનો ગટ મઠ ભાંગીને ભૂકો થયો - પછી આપમાં આપ સમાઇ ગયો. જેને સંત..
૪. જેને બકરા પણાંનો બોધ થયો - પછી કેવળ કેશરી સિંહ થયો. જેને સંત..
૫. સ્વપનામાં જે ઘાયલ થયો - સ્વરૂપે જાગે તો સંસય ગયો. જેને સંત.
૬. નથી દયાળુ નાનો કે મોટો - સૌમાં એક જ રૂપે રહ્યો. જેને સંત.

ભજન

સંતોની શાનમાં ને સોહમના ધ્યાનમાં - સહજ સમાધિ લાગી રે.... વેલ...

૧. સહજ સમાધિ લાગી મારા વહાલા - પુરણ બ્રહ્મ જ્યોત જાગી રે. સંતોની...
૨. કાયાનાં કાટડાને માયાનાં ખોરડાં - સદા માટે દીધાં ત્યાગી રે.. સંતોની...
૩. મન અને પ્રાણનો સાધ્યો સુમેળજો - ગગનમાં ઘંટડી વાગી રે. સંતોની...
૪. આપ ઓળંગી હું કુદી પડ્યો આભમાં-બની ગયો હું બડભાગી રે સંતોની..
૫. શંકર સચ્ચિદાનંદ સ્વરૂપ હું - ન રાગી ન વૈરાગી રે. સંતોની...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n83/mode/1up

realpatidar.com

ભજન

મૈ ને ઢુંઢા અપના શરીર - વા મેં દેખ્યા અલખ અમીર,
માઈ મેં તો બન ગયા ફકીર જી.. વેલ....

૧. જનમો જનમકા મેલ ચઢિયા - ધોબી મલીયા પીરજી,
ધરમ ઘાટ પર દીયા પછાડા - નાયા નિર્મળ નીર માઈ મેંતો.....

૨. અલાહુકા જાપ જપીયા - તબહી આયા ધીરજી,
નુરત શુરત એક કીની - મનવા હુવા સ્થિર... માઈ મેંતો....

૩. વિના વાદળ વીજળી ચમકે - ઝરમર વરસે નુરજી,
અનહદ નોબત વાગે નિસદિન - જ્ઞાન ઘર ગંભીર. માઈ મેંતો...

૪. સુરતા સુનમાં આવી ઠરી - અનઘટ ઘાટ કે તીરજી,
તન કુ તોડા મન કુ જોડા - મનવા હુવા સ્થિર..... માઈ મેંતો..

૫. ડુંગરે ચઢિયા દેખી મઢિયા - મેં ભયા શૂરવીરજી,
દાશ સત્તાર ગુરૂ પ્રતાપે - અમર હુઈ જાગીર.... માઈ મેંતો..

ભજન

માણને માણને માણને રે - તું અનુભવ સુખ માણને......વેલ.

૧. હરખ શોક ક્ષુધા પીપાસા - સોંપી દે મન પ્રાણને રે. તું અનુભવ...
૨. હાણને વરધ સુખને દુઃખ - જન્મ મરણ પળ જાણને રે. તુ અનુભવ...
૩. આતમ રૂપ અનુભવ ભૂલીને - ભટક્યો ચોર્યાસી ખાણને રે. તું અનુભવ...
૪. ભાણ કહે જો આતમ દર્શો - દુઃખ નહિ રહે એંધાણીએ રે. તું અનુભવ...

ભજન

કામનો કામનો કામનો રે.... તું અહીં આવ્યો શા કામનો..... વેલ....

૧. સત સ્વરૂપિ ગંગામાં ન નાહ્યો - ભજન કીયો ન સીયારામનો રે... તું અહીં.....
૨. પાપ કરતાં પાછું ન જોયું - ઠરી બેઠો નહિ ઠામનો રે... તું અહીં...
૩. આરે કાયામાં સુરે મોહયો છે -કોથળો છે હાડ ચામનો રે... તું અહીં....
૪. ભાણ કહે તું ચેતીલે પ્રાણી - પછી નહિ રહે ઘાટ ગામનો રે... તું અહીં....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n84/mode/1up

realpatidar.com

ભજન

અનુભવીને એટલું કહેજો - આનંદમાં રહેવું રે,
ભજવા પરિબ્રહ્મને - બીજું કાંઈ ન કહેવું રે... વેલ...
૧. આત્મા સર્વેનો એક જાંણી - કોઈને દુઃખનાં દેવું રે,
સુખ દુઃખ આવે અણછતાં - તે સહીને રહેવું રે, અનુભવીને....
૨. ઈચ્છાઓની ઉર્મીઓથી - અળગું રહેવું રે,
સમદૃષ્ટિને સમતા ગૃહી - આળસ ખોવું રે.... અનુભવીને...
૩. આદી મધ્યે અંત જોને - એક આદીત ભાસે રે,
આત્મા અનુભવ થકી - અજ્ઞાન જાસે રે... અનુભવીને...
૪. વેદ જોયા પુરાણ જોયાં - જોયાં પોથી રે
બ્રહ્મજ્ઞાન સિવાય સર્વે જૂઠું - એમ સંતોએ કહ્યું રે... અનુભવીને...
૫. સદગુરૂને સેવતાં મારું મનડું મોહ્યું રે
કહે મુળદાસ આ લોક છોડી - પરલોક જાવું રે.... અનુભવીને...

ભજન

સત સંગ વિનારે મન સમજે નહિ - સુરતી સ્મરતી પુરે એની સાંખ વેલ....
૧. રવિ રવિ કરતાં રે રજની નવ ટળે રે જી. ઉગ્યા પછી અંધારાં મટી જાય,
જેને ઘર ઉગ્યો રે - રવિ ગુરૂ જ્ઞાનનો રે જી
એને ઘર અજવાળાં એમ થાય. સતસંગ...
૨. જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રેજી -
ભોજન ભોજન કરતાં ભાંગે નહિ ભુખ,
રામ રસ પીધેરે તૃષ્ણા ત્રણે ટળેરેજી -
એને પીધે આનંદ સુખ થાય. સતસંગ...
૩. સો મહા અગ્નિ રે જઈ લખો કાગળેરે જી - તેરે લઈને રૂમાં ઓળખાય,
અગ્નિ અવસ્થા ચલી રે રૂતાં દાઝે નહિ રે જી -
રતી એક યા મેલે તો જલી જાય સતસંગ....
૪. સમજણ વિનારે શાધન શું રે કરે રેજી - જ્યાં લગી જીવ પણું નવ જાય,
મુળદાસ કહે છેં રે મનમાં સમજી લેજો રેજી -
જો સમજો તો પ્રાપ્તિ થાય. સતસંગ..

realpatidar.com

https://archive.org/details/bk151/page/n85/mode/1up

realpatidar.com

ભજન

સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા - નહિ આવું નહિ જાવું રે..... વેલ...

૧. નહિ આવું નહિ જાઉં મારા વહાલા-
માયાનાં ગીત નહિ ગાઉ રે.. સચ્ચિદાનંદ...

૨. આવે તે જાય અને જાતું તે આવતું -
હું તો કુટસ્થ કહેવાઉ રે. સચ્ચિદાનંદ...

૩. કાયાને માયાની પાર સદા ખેલતો -
નિજાનંદમાં ડૂબી જાઉ રે. સચ્ચિાદનંદ...

૪. એક અનાદી અનંત સ્વરૂપ હું - દેવોના દેવને મનાઉ રે. સચ્ચિદાનંદ..

૫. શંકર કહે ગુરૂ દેવની દયાથી - સેજે સાગર તરી જાઉં રે. સચ્ચિદાનંદ...

ભજન

નર હય પશુ સમાન - ભજન વિના નર હય પશુ સમાન.....વેલ.....

૧. જેસા ફીરત હય ઢોર હરાયો - ખાત ફીરત હય ગાસ પરાયો,
અપને ધણીકો નામ લજાયો - મુરખ મુઢ મસ્તાન...નર હય પશુ સમાન...

૨. કોલ વચન દઈ બાહારજ આવ્યો - આકે લોભમેં ચિત લગાયો,
ધીક ધીક હરિકો ગુણ ન ગાયો - બે વચની નાદાન... નરહય.....

૩. અજ્ઞાની મુરખો પાયો - મેરી તેરી નીંદામેં જન્મ ગુમાયો,
હિરલો હાથ કયાં સે પાવે - જબ નીકલ ગયો પ્રાણ. નરહય....

૪. પ્રેમ સે પ્રભુકા ગુન જો ગાવે - જ્ઞાની હોકર ધ્યાન લગાવે,
દાસ સત્તાર વોહી ફલ પાવે - જો ભજતે ભગવાન. નરહય....

ભજન

મારને મારને મારનેરે તું મનવા વેરીને મારને..... વેલ...

૧. કામ ક્રોધને પ્રથમ ઉપજાવે -હરી જસે તપ સારનેરે. .. તું મનવા...

૨. મીત્રની પેઠે સાથે રહીને - તને કરાવશે હારને રે... તું મનવા...

૩. તીરથ ગયેથી શાન્તી ન થાય - વૃથા ભરે શીદ ભારનેરે..તું મનવા...

૪. ભાણ કહે મન માર્યા વિના - કેમ ઉતરસો ભવ પારનેરે.. તું મનવા...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n86/mode/1up

realpatidar.com

ભજન

એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરૂને હાથ રે,
પીતાં મારી પ્રીત બંધાણી - પ્રીતમ વરની સાથે રે.. એવી... વેલ....

૧. પ્રેમ તણી તો લગની લાગી - પ્રગટી હાડો હાડ રે,
અણ સમજુ અજ્ઞાની લોકો - મને ગાંડી કરીને કાઢે રે... એવી.......

૨. પ્રેમે સદગુરૂ મુજને મલીયા - મારો સફળ થયો જનમારો રે,
હું ગાંડી કે દુનિયા ગાંડી - જ્ઞાની તમે વિચારો રે. એવી......

૩. સાસરીયાના સુખને બેની - પરણેલી સ્ત્રી જાણે રે,
શું જાણે કુંવારી કન્યા - એ તો પિયરિયું વખાણે રે. એવી......

૪. દાસ સત્તાર કહે ગુરૂ પ્રતાપે - તમે પરણીને મોજાું માંણે રે,
જો કોઈ ચાહો પીયુના સુખને - તો પરણો વેદવચન પરમાંણે રે.. એવી....

ભજન

એવા જ્ઞાની ગુરૂ મળીયા રે - ગોલી મારી જ્ઞાનતણી,
એવી કંચન કાયા કીધી રે - સદગુરૂ મારા પારસમણી..... એવા જ્ઞાની ગુરૂ...

૧. સાખી : હું જનમની આંધળી - મારા સદગુરૂએ આપી આંખ,
ગુરૂ ચરણનું અંજન આંજીયું - અને મટી ગઈ સર્વે જાંખ...
કે..એવી આંખ ઉગાડી જોયું રે ઘટ ઘટ બેઠા અલખ ધણી. જ્ઞાની

૨. સાખી : ગુરૂના ગુણને હું શું વખાણું - ગુરૂના ગુણ છે અપરંમપાર,
હું તો ગુરૂના આંખની કી કી - ગુરૂ મારા હૈયાના હાર.
કે..... ગુરૂ હમારા કૃપાળુ રે - કૃપા કીધી ગણી ગણીરે. એવા જ્ઞાની....

૩. ગુરૂના ચરણની હું સેવા કરૂ - હું ચરણની દાસ,
ગુરૂ હમારા ગરીબની વારે - પુરે ગરીબની આસ.
કે.... ગુરૂ હમારા સમરથ રે - ગુરૂ હમારા ધીંગા ધણી.. એવા જ્ઞાની....

૪. સદગુરૂના ચરણ સેવતાં - અણસઠ તીરથનાં ફળ થાય,
દાસ સત્તાર કહે ગુરૂનું પૂજન કરતાં - હૈયે હરખ ન માય
કે.... ગુરૂ હમારા પ્રેમી રે - પીયાલો પાયો પ્રેમ કરી.... એવા જ્ઞાની....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n87/mode/1up

realpatidar.com

ભજન

ગુરૂ મારા મોરાર સાહેબનો મહીમાય - ગાઈએરે ગુરૂના ગમથી રે,
ગુરૂજીના અપરમ ભેદ અપાર - કહેવાય નહિ ગુરૂ અમથી રે : વેલ...

૧. ગુરૂમારા સરવે સંતોને માથે મોત-મોરારને માથે આવી વરત્યાં રે,
એમ જાુગનું રે ઢાંકણ જાર - ધુણા ઘર એક ધરતી રે : ગુરૂ મારા....

૨. ગુરૂમારા ભીષ્મપિતાને માથે મોત - છ છ રે મહિના પાછુ ઠેલ્યું રે,
એમ મોરાર સાહેબે ઠેલ્યું મહિના બાર - મોતને રે પાછું મેલ્યું રે : ગુરૂ મારા..

૩. ગુરૂમારા મોરાર સરીખારે સંત - થાવાના જાુગમાં થોડા રે,
જેમ સિંહનાં ન હોય સેન - અજીયાનાં ફરે ટોળાં રે : ગુરૂ મારા...

૪. ગુરૂ મારા ચકવે હોય જ્ઞાન - તેનો રે પાર ન પાવે રે,
એમ કલ્યાણ સાહેબની કરૂણાય - જીવણદાસ ગુણ ગાવે રે : ગુરૂ મારા...

ભજન

કાયા નગરનારે કોટમાં - જે કોઈ ધ્યાન લગાવે રે,
અંતર ખોજે આપણું - સત્ય સ્વામીને પાવે રે :.... વેલ..

૧. પંથ ધરમને જાત્રા - પાઠ પૂજાને પોથી રે,
એ ઝઘડા છે સંસારના - તેમાં જનમ ગુમાવ્યો રે :.. કાયા રે નગરના..

૨. મરવા પહેલાં રે જે મરે - કોઈની ગણત્રી ન રાખે રે,
સર્વેનો નાશ નિશ્ચે કરે - તે નર જ્ઞાની કહાવે રે :..... કાયા રે નગરના...

૩. એક વિના બીજું જે જુવે - તેનો ફોગટ ફેરો રે,
દોઈહીતા એ અજ્ઞાનતા - તેનો પાર ન આવે રે :... કાયા રે નગરના..

૪. એક જ એક જે કોઈ જુવે - બીજું નામ ન જાણે રે,
આપ વિસારે આપને - આપો આપ હો જાવે રે :...કાયા રે નગરના..

૫. પાંચ પચીસ ચોર વસ કરો - પૂજા પુસ્તક મેળો રે,
સદગુરૂના પાયે નમો - તમને જ્ઞાન બતાવે રે : ..... કાયા રે નગરના..

૬. એટલો અરથ જે નિશ્ચે કરે - સોહી સદગુરૂ હમારા રે,
દાસ જ્ઞાની એમ કહે - આપણા મનને સમજાવે રે :... કાયા રે નગરના..

realpatidar.com

https://archive.org/details/bk151/page/n88/mode/1up

realpatidar.com

ભજન

ગુરૂજી મહામંત્રનો મહિમાય - વખાણું ભ્રમ ભેદથી રે,
તેના જાપ જપે ઋષિ મુનિ રાય - નોતારે ચારે વેદમાં રે : વેલ.....

૧. ગુરૂનું આખર જુગમાં નોતા આધાર - પચાસ કરોડમાં પાણીરે,
એક હતા નિરંજન નિરાકાર -
તેમાંથી શક્તિ દરસાંણી રે :... ગુરૂજી મહા.....

૨. ગુરૂજી શક્તિએ કીધો સમાગમ - નિરંજનને વચન આપ્યાં રે,
એવો ઉમિયાને વાધ્યો પ્રેમ -
ત્રણ ગુણ પેદા કીધા રે :... ગુરૂજી મહા....

૩. ગુરૂજી બ્રહ્મા વિષ્નુ મહેશ - નીજીયાનાં નામ લીધાં રે,
એવા ધરણીના બાંધ્યા ધરમ -
નીજીયા રે પંથ ચાલ્યા રે :... ગુરૂજી મહા...

૪. ગુરૂજી નાદ અને બુંદનો વિસ્તાર -તેમાંથી સૃષ્ટી રચાણીરે,
એમ બોલ્યા રે મારકુંડ મહારાજ -
શંકરે મહામંત્ર દીધો રે :... ગુરૂજી મહા...

ભજન

શું પૂછો મુજને કે હું શું કરું છું - મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. વેલ....

૧. કદાપી કદાપી કુ માર્ગે નહિ જાઉં -
વિચારી વિચારીને પગલાં ભરું છું શું પૂછો....

૨. કરે કોઈ મુજસે લાખ બુરાઈ -
પણ બુરાઈને બદલે ભલાઈ કરું છું શું પૂછો...

૩. બીક નથી મુજને કદાપી આ જગતની-
એક મારા પ્રભુજીથી હું તો ડરું છું શું પૂછો...

૪. ચડે છે શુર પીધી પ્રેમ પ્યાલી -
પ્રેમીઓની સાથે હરું છું ફરું છું. શું પૂછો...

૫. ભક્તિ કરીએ કેવળ સત્તારદાશની સદગુરૂ
કવિ અનવરને ચરણે ધરું છું. શું પૂછો....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n89/mode/1up

realpatidar.com

ભજન

મનુષ્ય જનમ મોંઘા મુલનો - વારંમવાર નહિ મળસેરે,
લક્ષ ચોર્યાસી નાં બંધનો -સદ્‌ગુરૂ શબદે ટળશે રે :.... વેલ...
૧. અવગાટ ઘાટ અતી ગણો- પપીયલ પાંય નહિ ટકશે રે,
પ્રેમ પંખી ઉપર સવાર થઈને -ઉલટા પવને ચડશે રે :... મનુષ્ય...
૨. શુન શિખર નારે શહેરમાં - ઝરમર મેહુલા વરસે રે,
ગગન ગુફા નારે ગારમાં - ગેબી ગરજનાઓ ગરજે રે... મનુષ્ય...
૩. ચંદ્ર સુરજની જયાં ગમ નહિ - ત્યાં મારો સાહેબો બીરાજે રે,
આઠોય પહોર આનંદના -વાજાં અનહદ વાગેરે... મનુષ્ય...
૪. જન્મ મરણનો જોખમ ટળે -મહાપદમાં સુખ માંણેરે,
કાળ સીચાંણો ગર્જના કરે -અંતે અળગો થાસે રે :... મનુષ્ય...
૫. રોમે રોમે રામ રમી રહ્યા -તાં તે તાંત ત્યાં તેવો રે,
સદ્‌ગુરૂ નામે રામદાસ ભણે -નૈયા મારી પાર ઉતારો રે :... મનુષ્ય...

ભજન

ચાલોરે હંસારે બ્રહ્મ ધામમાં -છોડી દો આ જુગડાંની માયારે,
આ જુગ માયા કેરો ફંદ હય -સરવે જમકા ગીરાસારે :... વેલ...
૧. ઓહંગ મારગ ગુરૂજીના ગમહય -શુરતા સાંધોને સુવાસારે,
આજ મનરે મેવાડકું હટાઇ લ્યોને- ઉલટા ચડોને આકાસારે.....ચાલોરે...
૨. ચૌદ ભુવન નારે ઉપરે - બ્રહ્મ ધામ અવિનાસારે,
આજ માંનરે સરોવર હંસલા જીલણાં-
ઉવાં હય મુગતા ફળની આશારે... ચાલોરે..
૩. શ્વેત સિંહાસન શામળો -વિના રવિ ચંદ્ર પકાશારે,
ઉવાંના દેશમાં રં હંસા જઇ વસો- જમડા જાય નીરા સારે... ચાલોરે..
૪. હંસ સાહેબ મેરા કહ્યા માન લો, - ભાણ સાહેબકા મેં બાલકારે,
આજ સેં સોરે મટી ગયો શરિરનો-હરદમ આનંદ ઉલ્લાસારે :... ચાલોરે...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n90/mode/1up

realpatidar.com

ભજન

સંતો ભાઇ ખોજુ કરીલ્યો દિલડાની માંય. એ...માંયલ્યાની વાતુંરે,
જેને લાગ્યાં શબદનાં બાણ-ઘાયલ થઇ ગુણ ગાતા રે:... વેલ...

૧. સંતો ભાઇ નાંભી કમળની માંય- એ... સોહંગ ઉલટે રે,
ત્યાં તો હંસો જપે એક જ જાપ - એ.. તાર નવ તૂટે રે :... સંતો ભાઇ...

૨. સંતો ભાઇ તીરથ ત્રીવેણી માંય-અખંડ એક જયોતીરે,
ત્યાં તો ઝરમર ઝરમર થાય-વરસે જીણાં જીણાં મોતી રે :... સંતો ભાઇ...

૩. સંતોભાઇ ગગનમંડળની માંય - અદ્ધર આશન ડોલે રે,
ત્યાં તો બીરાજે છે શ્રી ભગવાન - કેવળ ધામમાં રે : સંતો ભાઈ...

૪. સંતોભાઈ ગુરુજી મળ્યા છે રોહિદાસ - બ્રહ્મણા સરવે ભાંગી રે,
બાઈ મીરાં ચરણ કમળની રે..માંય - અદ્ધર લહેર લાગી રે : સંતો ભાઈ..

ભજન

કે ધનગુરૂ દાતાને ધનગુરૂ દેવા મારા - સદગુરૂએ શબ્દ સુનાવીયા,
તો ગુરૂજીનો મહિમા એક પલ પલ વખાણું રે -
પીંડ કેરાં પ્રયસ્ત્રીત જાયજી રે. વેલ....

૧. દેશ રે દેખાડ્યા ગુરૂએ - સુતી જગાડી મને - અલખ ધણી ઓળખાવીયા,
તો બૂડતી બેડલી મારા - ગુરૂજીએ તારીને -
મને જમડાના હાથથી છોડાવીયા રે. ધન......

૨. ખાલ રે પડાવું મારા શરીર તણી રે - ઉપર રંગ સોનેરી ચડાવું રે,
તો મોજડી સીવડાવી મારા સદગુરૂને પેરાવું -
તોય ગુણ ઓશીગણ નવ થાઉં રે. ધન.....

૩. ગૌદાન દીયા પણ ભોમીદાન દીયા રે- આ કાયા કેરા કંચન મોલ લુંટાવું રે,
તો કાશી ખેતરમાં રે કન્યા દાન દીધાં રે -
તોય નાવે મારા ગુરૂજીને તોલ રે ધન....

૪. સદગુરૂ મળ્યા મારા ફેરા ટળ્યા ને - અમને લક્ષ ચોરાશીથી છોડાવીયા,
ને વાગનાથ ચરણે બોલ્યા રૂખડીયાને -
અમને મુક્તિના મારગ બતાવીયા રે ધન....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n91/mode/1up

realpatidar.com

ભજન

એવી સ્મરણ વસ્તુ સાચી અરે સાચી રે - બાકીનું છે બકવાનું,
એવું અખંડ ઘર છે ન્યારૂં અરે ન્યારૂં રે -
સમજે તેને રહેવાનું એવી સ્મરણ... વેલ...

૧. સાખી : નીજેં સુરતાની સંગમાં - સનમુખ સામુ રહેવાય,
મેરૂ ડંડ સીધા કરો - તો ગગન મંડળમાં લઈ જાય.
કે એવાં અદ્ધર આસન દીધાં અરે દીધાં રે -
નવે ખંડમાં અજવાળું. એવી સ્મરણ.....

૨.સાખી : દોનું ભવરની વચ્ચે અણી - અગ્ર પર રૂપ શબ્દનું લેવાય,
નુગરા નરને ખબર નહિ - અને અજ્ઞાને અથડાય :......
કે.....એવા જ્ઞાન દીપક નહિ જડ સે. અરે જડસેરે -
જેને હૈયામાં અંધારું.... એવી સ્મરણ....

૩. સાખી : મુખ કમળ તો બંધ છે - દાટા દીધે શું થાય,
પ્રાણ વાયુને ઉંચે ચડાવીને - ત્રિવેણીમાં લઈ જાય :
કે.......અરે ત્યાં તો જમ નહિ પહોંચે. પહોંચે રે -
ચોર્યાસી થી છુટવાનું... એવી સ્મરણ.....

૪. સાખી : રામ રામ કરતાં પાર નહિ આવે - અને મણકા મુંકેશું થાય,
કહે લખીરામ જે રામને મળીયા - તે ઉનમુને ઓળખાય :....
કે.....અરે ચેતી લે જો ચીતમાં ચીતમાં રે -
બાકીનું નથી કહેવાનું : એવી સ્મરણ.....

ભજન

સતસંગનો રસ ચાખ - પ્રાણી તું તો સતસંગનો રસ ચાખ....વેલ.....

૧. પ્રથમ લાગે તીખોને કડવો - પછી લાગે આંબા કેરી સાંખ : પ્રાણી તું તો...
૨. આરે કાયાનો ગર્વનાં કીજે - અંતે થવાની છે ખાખ :... .પ્રાણી તું તો..
૩. હાથીને ઘોડા માલ ખજાના - નહિ આવે જીવની સંગાથ :પ્રાણી તું તો...
૪. સતસંગથી બે ઘડીમાં મુક્તિ - વેદ પુરે એની સાંખ : પ્રાણી તું તો...
૫. બાઈ મીરાં કહે પ્રભુની ગીરધરના ગુણ-ચરણ કમળમાં ચીતરાખ : પ્રાણી તું તો.

realpatidar.com

realpatidar.com

ભજન

ખોટ કાં ખણો રે તમે - ખોટ કાં ખણો,
પામી મનુષ્યનો અવતાર - ખાલી ખોટ કાં ખણો :..... વેલ.....
૧. મનની અંદર ફેરવો માળા - પારા શીદ ગણો,
ખેતર પાક્યું ખવાઈ જાસે - તરતમાં લણો :..... પામી મનુષ્યનો.....
૨. પુરવ પુણ્ય શી મનખો પામ્યો - હાથે કાં હણો,
સાર શીખામણ માનતો નથી - ઘમંડ છે ઘણો :... પામી મનુષ્યનો....
૩. હાથીના મુખમાં મીસરી નાવે - કીડી થઈ ચણો,
શાલ દુસાલા મુકી તમે - વેજાં સું વણો :...... પામી મનુષ્યનો....
૪. મારું મારું કરી મનખો ખોયો - હજીએ શું તાણો,
દાસ ગરીબ કહે કણ વિના ખાલી - ભુસો સું ચણો :... પામી મનુષ્યનો...

ભજન

કળિયુગ તો આવ્યો રે - દુનિયામાંથી ઘટી રે દયા,
એવા મોટા મોટા મહાજન રે - લક્ષપતી લોભી રે થયા :... વેલ...
૧ સાખી : ધરતીમાંથી ધરમગયું - અને પાપનું વહ્યું પુર .....
પરજન્યતો પાંગળા થઈ વરસે - અને મેદની થઈ ચકચુર
એવો ધરતીએ રસ ચોર્યો રે - વાવેલા કણ વણસી ગયા રેઃ એવોકળિયુગ...
૨ સાખી : શૂરાનું શૂરાપણ ગયું - અને ગયું સતીનું સત,
વેદી ભેદી પંડિત પુરાણી - સહુની મટી ગઈ મત :
અરે કળિયુગનું કારણ રે - લોભમાં સૌ લાગી રહ્યા રેજી.એવો કળિયુગ...
૩ સાખી : પૃથ્વીમાં પાખંડ પુજાએ - અને વિપ્ર કરે વેપાર,
સંન્યાસી ધન સંચરવા લાગ્યા - અને પતિવૃતા નહિ નાર :
અરે સત્ય ન જડે શોધ્યું રે - અસત્યના ઓધ વળ્યા રેજી : એવો કળિયુગ...
૪ સાખી : છત્રપતિતો વચન ચુકે - તે દુઃખ કોને કહેવાય,
કથાતો કુપાત્રની સુણસે - પ્રશ્નતો ગરોડાને પૂછાય :
એવું દાસ ધીરો કહે છે રે -
જ્ઞાની તે તો અંધ થયા રેજીઃ એવો કળિયુગ...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n93/mode/1up

realpatidar.com

ભજન

(રાગ : ભોજા ભગતના ચાબખાનો)

જેની બુદ્ધિ હોય જાડી - સત્યને તે ન માને મુરખા અનાડી.... વેલ....
૧. નફ્ફટ નિર્લજને લાજ ન મળે - એનું નાક નાખ્યું છે વાઢી... જેની....
૨. સત્ય ધરમ પર ચાલે નહિને - અસત્યે જાય રાત દાડી,
પ્રેમ શુરા રસ પીવું મૂકીને - એ તો પીએ છે દારૂ ને તાડી.. જેની....
૩. લાખોને લૂંટી કરીને લાવે છે - ઘોડાગાડીને લાડી,
કાળ જપાટો મારસે - પછી કોના ઘોડાને કોની ગાડી.... જેની....
૪. નામ તેવાં તો કામ કરે નહિ - લંપટ લુચ્ચા લબાડી,
દાશ સત્તાર કહે વાઘનું કામ - પેલી શું કરે બાપડી બિલાડી... જેની.

ભજન

અરે મન રે મોટાં સાથે વોરીએ - જેનો રંગ રાતો ચોળ,
નાયા ધોયા સાધુ નીર મળા - ઉડી જાશે પતંગ,
વારી વારી વસ્તુ રામ વોરીએ - જેસાં રે આનંદ ઉપજે : વેલ.....
૧. ચીંતામણી રે સોહામણી - શોભા વરણી ન જાય,
જેને દીઠે રે મારાં મન ઠરે - દિલડાની ભ્રાંતુ મટી જાય :.... વારી વારી......
૨. હિરો દીધો રે ગુરૂએ હાથમાં - કોડી બદલામાં જાય,
જો રે મળે રે હિરાના પારખુ - મુલે મોંઘો વેચાય :..... વારી વારી.....
૩. સદગુરૂએ મારી મુજને શારડી - સાર લાગ્યો રૂદિયાની માંય,
ટંકશાળેથી પાછા નહિ વળે - સાચું નાણું કહેવાય : વારી વારી.....
૪. ખરાં રે ખોટાનાં રે પારખાં - લઈને કાંટે તોળાય,
જુગમાં જીવણ જોષી જોખતાં - કુડિયા સાંધણમાં જાય :.... વારી વારી....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n94/mode/1up

realpatidar.com

ભજન

કરમ કાં કરો રે કુડાં કરમ કાં કરો - શું આપસો જવાબ -
કુડાં કરમ કાં કરો... . વેલ....

૧. સદગુરૂનાં શરણ ગૃહીને - અંતરમાં ઠરો,
ભવ સાગરમાં બૂડતાં તમે - ભજનથી તરો :..... શું આપસો જવાબ.....

૨. લક્ષ ચોર્યાસી ભટકી આવ્યા - પાછા કાં ફરો,
કુડ કપટને કરતાં તમે - જરા તો ડરો : ...... શું આપસો જવાબ....

૩. જનમ મરણનો જીવને માથે - જોખમ છે ખરો,
સંત સમાગમ કરી તમે તો - ધીરજ ને ઘરો : ... શું આપસો જવાબ....

૪. મોહ માયાને મુકી કરીને - ભજનમાં ભળો,
દાસ ગરીબ કહે જો માનો નહિ તો - જન્મોને ભરો : શું આપસો જવાબ....

ભજન

લગની લાગી રે શામળિયા તારા નામની રે
બીજી વહાલી ન લાગે એકે વાત - લગતી લાગી રે.... વેલ......

૧. મેંતો મીંડળ બાંધ્યા છે - મોહન વરનાં રે,
સુરતા લાગી શામળિયાની શાથ :.... લગની લાગી રે.....

૨. હું તો ચેતન થઈને બેઠી ચોરીયે રે,
મારો જાલ્યો વિઠલ વરે હાથ : લગની લાગી રે.....

૩. મેંતો ચૂંદડી ઓઢી છે ચત્રભુજની રે,
માળા પહેરી વિશ્વંભરનાથ : લગની લાગી રે.....

૪. ચારે મંગળ વરતાણા મોહન વરથી રે,
મેંતો હેતે જમાડ્યો કંસાર :.... લગની લાગી રે.....

૫. બાઈ મીરાંના સ્વામીને કરૂ વિનતિ રે,
અમને દે જો સંત ચરણોમાં વાસ : લગની લાગી રે.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n95/mode/1up

realpatidar.com

ભજન

ભજન લ્યો કરી રે ભાવે - ભજન લ્યો કરી
આતો સ્વપનું છે સંસાર - ભાવે ભજન લ્યો કરી : વેલ....

૧. જમડા લેખાં જરૂર લેસે - મારસે છડી,
ધર્મરાયને ઉત્તર દેતાં - રહેસો ત્યાં અડી :..... ભજન લ્યો કરી રે....

૨. પાપીને દિલમાં દયા ન આવે ખબર છે ખરી,
સાર શિખામણ માનખો ખરી - ભજનની જડી :.... ભજન લ્યો કરી રે....

૩. ઓચિંતાનો આવીને લેસે - લાલચ નહિ જરી,
પ્રાણીયો તો પરલોકમાં જાસે - દેહ રહેશે પડી :.... ભજન લ્યો કરી રે.....

૪. હજી છે વખત હાથમાં પ્રાણી - કારજ લ્યો કરી,
દાસ ગરીબ કહે દાવ ગયોતો - ફેર ન આવે ફરી :.... ભજન લ્યો કરી રે.....

ભજન

અમર પીયાલો મારા ગુરૂજીએ પાયો - મન મસ્તાના ફરૂ દિવાના....
શરગા પુરની આશ કરો તો - અમરાપુરની આશ કરો તો,
છોડી દીયોને અભિમાના : અમર પીયાલો .... વેલ......

૧. કીતના હય લંબા કીતના હય પહોળા - કિતના હય બ્રહ્મધામા,
ઓહી સાહેબકા ભેદ બતાવો - કરી દીયોને અનુમાના..... અમર.....

૨. આભથી ઊંચા પૃથ્વીથી પહોળા - અધર હય અપરંમપારા,
વધે ઘટે તેને કરે બરોબર - કાયમ હય કીલતારા :.... અમર...

૩. પતીત વીનાના પંડિત કહેવાણા - મુરખ લજવે ઉજાળા બાના,
આપ નાં સુજે ને પાખંડ પુજે - પંડિત નામે ઠેરાંણા :.... અમર....

૪. ભેદ વિનાના ભવોભવ ભટકે - પઢવાં છે પોથી પાનાં,
વૃત્તિ જેની વાળી વળે નહિ - ધરે સાહેબ સું ધ્યાના : ..... અમર....

૫. અબ નહિ આવું અબ નહિ જાઉં - નહિ ધરૂં કુડા ધ્યાના,
ખાન પ્રતાપે બાપુ પ્રેમહંસ બોલ્યા - લીખ દીયોને તમે પરવાના :.... અમર...

realpatidar.com

https://archive.org/details/bk151/page/n96/mode/1up

realpatidar.com

ભજન

નીંદા કાં કરો રે તમે નીંદા કાં કરો -

સાધુ બ્રાહ્મણ દેખી કરી - બેઠા શું બળો : વેલ...

૧. મુખ સ્વાદે વાતો કરી - હાથે કાં મરો,

કાળું મોઢું કરસો આગળ - ખેલ છે ખરો :...... નીંદા કાં કરો રે......

૨. જમડા આગળ જોર ન ચાલે - ફુલ્યા શું ફરો,

અમર કોઈને રેહેવું નથી - જરા તો ડરો :..... નીંદા કાં કરો રે......

૩. સદગુરૂના સંગ વિના - કદી નહિ ઠરો,

ત્રિવિધિ તાપ માંહે તમે - સદા રહ્યા જલો : નીંદા કાં કરો રે......

૪. આટલાં વચન કહ્યાં તમને - કાને જો ધરો,

દાસ ગરીબ નવ ગમે તો - ઊંડામાં પડો : ...... નીંદા કાં કરો રે......

ભજન

અમને અમારી કાયા તણો નહિ વિશ્વાસ -

અમને અમારી દેહ તણો નહિ વિશ્વાસ

પારકા અવગુણ રે...... દિલડામાં નવ આણી એરે હોજી.......વેલ....

૧. નેવાં તારાં નમીયાં - એ ભીતુ ગળવા લાગી ઉંરે હોજી....

અને ગળવા લાગી - મંદિરયાની પછીત :

અમને અમારી ...... પારકાં અવગુણ રે....

૨. નવ તેરી નગરી - એ કાયા તેરી ખૂબ બની રે હોજી ....

એવાં અવળાં સવળાં -

મણિયારે માંડ્યાં રે હાટ : .... પારકાં અવગુણ રે..

૩. હંસો રાજા ચાલ્યો - એ... પીંજર એનું પડીતો રહ્યું રે હોજી....

એવા છોડી ચાલ્યા - સરોવરીયાની રે. પાળ :....પારકાં અવગુણ રે....

૪. ગુરૂના પ્રતાપે - એ.... જેઠીરામ બોલીયા રે હોજી...

એવા જેઠીરામ - ગત રે ગંગાજીના દાસ :.... પારકાં અવગુણ રે....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n97/mode/1up

realpatidar.com

ભજન

હંસની સભામાં હંસ મળી બેઠાં - જેમ હરે પોતાની નીરધાર
સર્વે સંતો સૌને સીતારામ - હવે છેલી રે બાકીના રામોરામ,
સર્વે સંતો સૌને સીતારામ........વેલ......

૧. સતસંગ કરી એને સંતોને મળીએ
જેમ આદે અંતેની ઓળખાણ :..... સર્વે સંતો......

૨. આજના વછુટા વાલા ફરી કદી મળીએ
જેમ ખરીયાં પીપળીયાનાં પાન : સર્વે સંતો......

૩. બાઈ મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ,
જેમ ચરણ કમળ બલિહારી : સર્વે સંતો......

ભજન

જાગી જો ને જીવલડા તું એકલો આવ્યો એકલો જાવું,
શું લઈ આવ્યો શું લઈ જાવું - એકલો આવ્યો એકલો જાવું : વેલ......

૧. મારું મારું કરીને મરતો - ન્યાય નીતિમાં ન ડગલું ભરતો,
પાપતણું એ ભાતું ભરતો - એકલો આવ્યો એકલો જાવું :.....

૨. મનસુબાના ચડે રે મીનારા - મૃગજળ જેવા લાગે પ્યારા,
ચાર દિવસના છે ચમકારા... એકલો.....

૩. ઉગ્યો એ તો અસ્ત થવાનો - જનમ્યો એ તો જરૂર જવાનો,
અમર થયો ન તું થવાનો : એકલો....

૪. કુડ કપટની બાજી ખેલી - દેશ પરદેશમાં ચણી હવેલી,
અંત સમયે જાવું મેલી :... એકલો.....

૫. ક્ષણિક સુખમાં શું હરખાતો - આખર અળગું સૌથી થાવું,
પંખીપેઠે ઉડી રે જાવું : એકલો......

૬. શ્વાસ લખ્યા તે જગમાં લેવા - પુરા થાય પણ ન મળે મેવા,
દેવ દરબારમાં હિસાબ દેવા :... એકલો.....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n98/mode/1up

realpatidar.com

ભજન

અંતે સંતોને તેડાવો રે - હરિનાં ભજન કરવા,
કરમાં માળા જાલી રે - મુરખ સુતો જ્યારે મરવા : ... વેલ .....

૧. સાખી : નાનપણે ઘરધંધામાં ધાયો - વૃદ્ધપણે હરિ ગુણગાય,
ઘર લાગ્યું ત્યારે કૂવો ખોદાવે - એ અગ્નિ કેમ ઓલાય :
અરે જીતી બાજી હાર્યો રે -
પથ્થરની નાવે બેઠો તરવા : .... અંતે સંતોને .....

૨. સાખી : અંતર સમે છાયા તીલક બનાવી - ભૂલી ગયો જ્યારે ભાન,
એરણની ચોરી સોયનું દાન - એમ કેમ આવે વિમાનઃ
અરે .... ગુરૂ જ્ઞાન ન આવ્યું રે -
બુદ્ધી તારી ગઈ છે ચરવા : અંતે ......

૩. સાખી : યુવતીનારીને જેમ પુત્રની આસા-એમ હરી ભજે ફળ થાય,
વૃદ્ધ નારીને નહિ પુત્રની આસા-એનો જનમારો એળે જાય :
અરે હરિને બેઠો ઠગવારે -
એસી વરસે વર વરવા - અંતે .....

૪. સાખી : વીસ વર્ષે વિશ્વંભરમળે - ભક્તિ કરે ભય જાય,
હરીસું ધાયા તે બહુ કમાયા - તેને મલીયા નિરંજન રાય :
એમ દાસ ધીરો કહે છે રે -
મટ્યા ચોર્યાસીના ફેરા : અંતે ......

ભજન

જરા તુમ દેખો રે લોકો - નાવમેં નદિયાં ડુબી જાય ... વેલ......

૧ એક અચંબા ઐસા દેખ્યા - કુવામેં લગ રહી આગ,
કાદવ કચરો જલ ગયાને - મચ્છીયાં હો ગઈ સાફ : .... જરાતુમ....

૨ ઘડા ન ડૂબે ઘડી ન ડૂબે - હસ્તી મલ મલ નહાય,
કોટ કાંગરે ચડીયા પાણી - કીડીયા પ્યાસી જાય : ... જરાતુમ....

૩ સાસુ કુંવારી વહુ અમલમાં - નણંદ સુવાવડ ખાય,
દેખન વાલે પુત્ર જનમ્યો - પાડોસી હાલરડાં ગાય : .... જરાતુમ....

૪ કહે કબીર તમે સુનો મારા સંતો - ઉલટા ભેદ જણાયનું
યેહી ભેદ કા કરો નિવેડા - જન્મ મરણ મટી જાય : .... જરાતુમ ....

realpatidar.com

realpatidar.com

ભજન

મળો તો અમને હરિજન મળજો રે -

અને દુરિજન રહેજો તમે દૂર . મળો તો ... વેલ......

૧ સંત આવ્યા ઘર આંગણે - અને હરખી મારી દેહ,

રોમે રોમે આનંદ વ્યાપ્યો - એવા અંતરમાં વરસ્યા મેહ.... મળો તો..

૨ સંત અમારા શીરધણી - અને અમે સંતોના દાસ

ઝળહળ ઝળહળ જ્યોત જલત હય - એવા નયનોમાં ઉપજ્યા સ્નેહ મળો તો....

૩ સંત હીરાની ગાંઠડી - પારખ વિના મત ખોલ,

જો મળે હીરાના પારખુ - તો મોંઘા મૂલે વેચાય , મળો તો..

૪ સંત હમારા સૂઈ રહેને - ચોકી કરે ભગવાન,

કહત કબીર સૂનો ભાઈ સાધુ - એ પદ પામવા નિરવાણ - મળો તો..

ભજન

અરજ કરે છે મીરાં રાંકડી ઉભી ઉભી - અરજ કરે છે મીરાં રામની વેલ......

૧. મુનીવર સ્વામી મારે મંદિરે પધારો વાલા,

સેવા કરીસ દીન રાતડી .... ઉભી ઉભી......

૨. ફુલના તે હારવાલા - મીઠાઈને મેવા રે,

ફુલનાં તોરણ ફુલ પાંખડી : ઉભી ઉભી.....

૩. પેંડા પકવાનવાલા મીઠાઈને મેવા રે,

ઘેબર જલેબી તલ સાંકળી : ઉભી ઉભી.....

૪. સાવ રે સોનાનાં વાલા - સોગઠાં ઢળાવું રે,

રમવા આવો તો જાય દીન રાતડી : ઉભી ઉભી.....

૫. બાઈ મીરાં કહે પ્રભુ - ગીરધરના ગુણવાલા,

તમને જોઈ ઠરે છે આંખડી : ઉભી ઉભી.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n100/mode/1up

realpatidar.com

ભજન

૧ લાખ વાતોમાં એક વાત લેજો શીખામણ છેલી રે... વેલ..........
દયા લાવીને અન્ન દાન દે જો .. શીખામણ...
૨ પરધન પત્થર કરી જાણો, શીખામણ-
પરનારી જનેતા કરી જાણો : શીખામણ.....
૩ જુઠ સાથે જરૂર વેર બાંધો : શીખામણ,
શ્વાસ ઉશ્વાસે રામતાર સાંધો : શીખામણ....
૪ ગુણ ગોવિંદના આનંદ ભેર ગાઓ શીખામણ..
કામ-ક્રોધ-લોભ સાથે બાંધોદાવો : શીખામણ...
૫ પોત પોતાના ધર્મ સૌ સંભાળો : શીખામણ..
તેમાં અવળું દેખાય તેને ટાળો : શીખામણ...
૬ બ્રહ્મા વિષ્ણુનું એક નામ સાચું : શીખામણ... -
બીજુ બાતલ કાંમ કરોડ કાચું : શીખામણ....
૭ જ્ઞાન મેળવવા સાંભળો ગીતાજી શીખામણ ......
રવિરાજ રામ એમ થાય રાજી : શીખામણ...

ભજન

લાગ્યા શબ્દના બાણજીરે. એના પ્રેમે વિધાંણા પ્રાણ
ભજનમેં ખૂબ ખેલા રે હોજીઓ એ - જેને લાગ્યાં શબ્દનાં બાણ ..... વેલ.....
૧ માંખી બેઠી મધ પીએ ને - પાંખડી એ લપટાય,
ઉડન ઉડન એને સેસા ભયા - પછી સમજ સમજ પસ્તાય .... ભજન મેં.....
૨ સાહેબ કા ઘર દૂર હય ને - જૈસી લંબી ખજૂર,
ચડેસો પ્રેમ રસ ચાખલે - ભાઈ પડે સો ચકમે ચૂર : ભજનમેં ....
૩ આપણો સાહેબ વાણિયો ને - વણજે કરે રે વેપાર,
વિના તોલને વિના ત્રાજવે - જેને તોળ્યો સબ સંસાર : ભજન મેં....
૪ તેરા રે સાહેબ તુજમે ભાઈ - જેમ પત્થર મેં આગ,
જો ચાહે દીદાર કુ તો - ચક ચક હોકર ચાલ : ભજન મેં....
૫ હાડ જલે જેમ લાકડાં - તેમ જલ જલ જય શરિર,
રામા રે નંદની ફોજમાં ભાઈ સનમુખ લડે કબીર : ભજનમેં.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n101/mode/1up

ભજન

realpatidar.com

અમે ભલે બગડ્યા - તમે ભલે બગડો -
તમે નહિ બગડો-તો રામ દુવાઈ ... .વેલ....
૧ ચંદન સંગતે નીમ ભી બગડ્યા -
નીમ ભી બગડ્યા તો ચંદન નિવડ્યા : તમે....
૨ છાસની સંગતે દુધ ભી બગડ્યા -
દૂધ ભી બગડ્યા તો ગોરસ નિવડ્યા ... તમે ....
૩ પારસ સંગતે લોહા ભી બગડ્યા -
લોહા ભી બગડયા તો કંચન નિવડ્યા : .... તમે.....
૪ ગુરૂની સંગતે શિષ્ય ભી બગડ્યા -
શિષ્ય ભી બગડ્યા તો સંત જ નિવડ્યા : ... તમે.....
૫ કહત કબીરા સુનો મેરે મુનિયા -
આપ મુએ સબ ડૂબ ગઈ દુનિયા : ... તમે....

ભજન

દુ:ખડા હમારા કોઈ દેખ્યા ન જાયે - દર્દ હમારા કાંઇ દેખ્યા ન જાય,
ઐસા ગુરૂજ્ઞાની અમને મારગ બતાવે હોજી .... વેલ......
૧ સૂની સૂની સેજે હંસા ભરૂરે સૂવાસારે (૨)
રેન અંધારી પીયુ નહીં મારી પાસ હોજી : ... દુ:ખડા ...
૨ કાચો કાચો કુપો હંસા - ભર્યો જળ પાણી (૨)
ઊડી ગયો હંસો એની પડી રહી નીસાની હોજી : .... દુ:ખડા ....
૩ ડાળે ચડી જોયું મે'તો મૂળે ચડી જોયું (૨)
આરે સંસારીયામાં મારૂ સગું નહિ કોઇ હોજી : .... દુ:ખડા .....
૪ કહેત કબીરા સૂનો મેરે સાધુ ભાઈ (૨)
હરિને ભજ્યા વિના મુક્તિ ન હોય હોજી : ... દુ:ખડા ....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n102/mode/1up

realpatidar.com

ભજન

બીનારે મુળ એક તરૂવર ઠેર્યું - ડાળ નહિ ઉસકા પાના,
રૂપ નાંહી ઉસકી છાયા બી નાંહી - ફળ રહ્યાં ચોધારાં રે સંતો
દેખો સમદરિયા કી લહેરી. વેલ...

૧ ઉલટાં રે બાંણ ગગન પર લાગ્યાં - ત્યારે દેખી એક દેરી,
ઈસરે દેરીમાં અલખ હમારા -
ત્યાં લહેર લાગી હમેરી રે..... સંતો દેખો....

૨ ઈસ રે દેરીમાં વાજીંત્રો વાગે - વાગે છે આઠેય પોર
તાલ મડદંગ ડંકા નિશાન વાગે -
માંય મોરલી વાગે બહુ પ્યારી રે : સંતો દેખો....

૩ મોર બાપૈયા હંસા ચકોર જ બોલે - ત્યાં નવસો નવાંણું નદીયુ વહે છે,
ત્યાં સાત સમુદ્ર માંહે ઉલટાને સુલટા-
વચ્ચમાં અમૃત કેરી શેરી રે: સંતો દેખો....

૪ ઉચે ગઢપર તપસીરે બેઠા - નાગા છે નીરવાંણી,
કહેત કબીરા સૂનો મેરે સંતો -
માંય નીરગુણ દે છે ફેરી રે : સંતો..........

ભજન

અવસર તેરો પલ પલ જાવે - છતાં તને નીંદ ક્યું આવે,
તેરે શીર જમ હય વેરી - ભજન વિના કોન ગતી તેરી : ટેક.. વેલ...

૧ ઊડેગા પ્રાણ આ તન સે - પડેગા દૂર સબ ધનસે,
સમજતા ક્યું નહિ પાપી - ઝેર જબ જાયગા વ્યાપી : અવસર....

૨ પડેગા કામ હુતો સે - જડેગા માર જુતો સે,
સમજતા ક્યું નહિ અંધા - પકડ જમ લે ગયા બંદા : અવસર...

૩ મત ભૂલો એ તન ગોરા - જગતમાં જીવના થોડા,
અંતે હોગા જંગલ વાસા - જૂઠી સબ જગકી આશા : અવસર....

૪ હુવા તું ચોર ઉસ ઘરકા - પીયા નહિ પ્રેમ હરી રસ કા,
બીગડ ગઈ બાત સબ તેરી - હુઈ જબ રાખ કી ઢેરી : અવસર...

૫ કબીર ગુરૂ રેખતાં ગાવે - પરમ પદ ભક્તિ સે આવે,
ગુરૂકી મહેર જબ હોવે - જનમ ચરણ ફેર ન હોવે : અવસર....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n103/mode/1up

realpatidar.com

ભજન

ઐસો બુલ દુનિયા કે અંદર - શાબુદ કરણી કરતા તું,
ઐસો ખેલ રચ્યો મેરે દાતા - જહાં દેખું વહાં તું કોતું.... વેલ....

૧ કીડીમાં તું નાનો લાગે - હાથીમાં તું મોટો ક્યું,
બન મહાવતને માથે બેઠો - હાકન વાલોએ તું કો તું : ઐસો....

૨ દાતા મેં દાતા બન બેઠો - ભિખારી કે ભેળો તું,
લઈ ઝોળીને માંગણ લાગ્યો - દેવાવાળો એ તું કો તું : ઐસો...

૩ ચોરો મેં ચોર બન બેઠો - બદમાસો કે ભેળો તું,
કર ચોરીને ભાગન લાગ્યો - પકડવા વાળોએ તું કો તું : ઐસો...

૪ નર નારી માં એક બીરાજે - દુનિયા મેં દો દીખે ક્યું,
બન બાલકને રોવા લાગ્યો - રાખણ વાલો એ તું કો તું : ઐસો...

૫ જળ સ્થળમાં તુંહી બીરાજે - જન ભૂત કે ભેળો તું,
કહેત કબીરા સૂનો ભાઈ સાધુ - ગુરૂજી બનકે બેઠો તું : ઐસો...

ભજન

આનંદ ઘડી હેતે ભજવા હરી,
આજ મારો સાહેબો સુહાગી મળીયા આનંદ ગડી.... વેલ ....

૧ પ્રેમનો પીયાલો મારા - ગુરૂજી એ પાયો રે ,
જોતા રે જોતામાં અમને વસ્તુ જડી : આજમારો .....

૨ ભમર ગુફામાં રે - આસ ન વાળોરે ,
સુરતા દોરી અસમાન ચડી : આજમારો ....

૩ ગગન મંડળમાં - વાજાં .....રે વાગેરે ....
ખુલ ગઈ માંયલી કમળ કળી : આજમારો .....

૪ ભાણને પ્રતાપે સંત રવિરામ બોલ્યારે,
પ્યાલો પાયો ગુરૂજીએ પ્રેમે કરી : આજમારો .....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n104/mode/1up

realpatidar.com

ભજન

કહાં સે આયા કહાં તુમ જાયગા રઈ - અને કહાં તુમારા વાસા,
અરે કાયા કાલ પડી જાસે - ઔર બતાવો ઠામા - કોઈ ભેદ
અગમ કા બૂજે - કોઈ ભેદ અગમ કા પાવે : ...... વેલ ...
૧ અમે આયા નુરસે રઈ .....અને અમરા પુરમે જાના
ચડી સુરત અસમાન ઠેરાના - ૐ બ્રહ્મ હમારા ધામા : કોઈ ....
૨ કેમ કરી સદ્‌ગુરૂ સમરીએ રઈ .....અને કેમ કરી લીજે નામા,
કહાં તમોને દેખીએ - અને કયાં હય આતમ રામા : કોઈ ....
૩ શ્વાસે ઉશ્વાસે શમરીએ રઈ .... અને અહોનીસ લીજે નામા,
નુરતે સુરતે નીરખીએ તો - ગટો ગટ આતમ રામા : કોઈ .....
૪ મુળ શબ્દ કહાં સે ઉઠે રઈ .....અને કયાં રહીને બોલે ,
કોણ મંડળ શબ્દકા વાસા . તરત બતાવો તુલ્યે : કોઈ .....
૫ મુળ શબ્દ નાં ભીસે ઉઠે રઈ .... અને ત્રીવેણી રઈ બોલે ,
સુન મંડળ શબ્દકા વાસા - વીચારી વીચારીને જુઓ : કોઈ ....
૬ કોણ નામ સે ધુન લગાવું રઈ ... અને કોણ નામ નીર ધારા,
ખીમદાસ રવિદાસ કુ પુછે - માંય ભેલું કે બારા : કોઈ .....
૭ સત્ય શબ્દથી ધુન લગાવું રઈ ..... અને અર્ધ નામ નીરધારા,
કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે - ઓહંમ સોહંમ સે પારા : કોઈ ....

ભજન

૧ મન તું અળગું કાં અફળાય - બીજો નથી બોલતો.
૨ તું તો જાગીને જો તારા રૂપને - ખોળી જોતામાં તુંરે ખોવાય : બીજો...
૩ તારે ઓથે હરિને નથી દેખતો - કુંડળ ઓથે જેમ કનક ઢંકાય : બીજો ..
૪ તું તો દરિયાની લહેર સમાન છે - લહેર સમતાં સમુદ્ર દેખાય : બીજો...
૫ તારે ઠેકાણે હરિને ઠેરાવને - એમ સમજે તો મહાસુખ થાય : બીજો...
૬ કહે પ્રીતમ એવા પુરૂષને - હું તો લળી લળી લાગું પાય : બીજો ..

realpatidar.com

realpatidar.com

ભજન

૧ સદ્દગુરુના તે શબ્દ વિચારતાં - મટે માયા મોહ વિકાર હરિરસ પીજીએ ....
૨ બાળી ભસ્મ કરે બીજી વાસના - ઉપર પ્રગટે પ્રેમ અપાર : હરિરસ.....
૩ એવો અજર અમીરસ જે પીએ - તેનાં નેણ વેણ પલટાય - હરિરસ.....
૪ લાગી બ્રહ્મ ખુમારી ન ઉતરે - સુખ મુખે કહ્યું નવ જાય : હરિરસ.....
૫ તેને સંભવ નહી રે શરિરનો - થયો આતમ દ્રષ્ટે ઉઘાડ : હરિરસ.....
૬ મરજીવા થઈ હરિને મળે - ગાળે જ્ઞાન હિમાળે હાડ : હરિરસ....
૭ બ્રહ્મ ધ્યાને ગગનવત થઈ રહે - જેમ કુંભ મહાજળ માંય : હરિરસ ....
૮ હરિ પોતામાં પોતે શ્રીહરિમાં - હરિ વિના ન દીસે કાંય : હરિરસ ....
૯ જે સરિતા સાગરમાં જઈ ભળે - તેનું નામ નદી ટળી જાય : હરિરસ.....
૧૦ કહે પ્રીતમ સદ્દગુરુ સેવતાં - ટળે અંતર એક રસ થાય : હરિરસ......

ભજન

મનવા જાગી ને જોજે - આછે અકળ પુરૂષની માયા,
અકળ પુરુષની માયા - એમાં સારા જગત સમાયા : વેલ ....
૧ ચંદ્ર સુરજને નવલખ તારા - જળ હળ જ્યોત જલાયા,
ગગન મંડળ પર જ્યોત જલત હય સુનમે શહેર બસાયા : .. મનવા ...
૨ આ ફુલ તરૂવર ને પાન પસારા - રંગ બેરંગ લગાયા,
ભાત ભાત કે પક્ષી બસત હય, નીરગુણ નામ સુનાયારે : ... મનવા ....
૩ સ્વર્ગ નર્ક તુમને સરજ્યા - પાપ ધરમ દીખલાયા,
વેદ પુરાણકી ખોજ કરી લ્યો તો સતકી જાજમ ચલાયારે : .... મનવા ...
૪ અગમ નીગમ કા ભેદ ન જાણું મારા સદ્દગુરુ ભેદ બતાયા
ભાણ પ્રતાપે ગાય રવિરામ ખોજન વાલોને પાયા રે .... મનવા ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n106/mode/1up

realpatidar.com

ભજન

સંગતુ કીજીએ મોટા સંતની - હારે ભાઈ જે છે દેશ રહિત,
કરે ઉપાસના દ્રઢ સદ્દગુરૂ તણી - હાંરે ચોખા જેનાં ચીત : .. વેલ....
૧ કામ, ક્રોધ, લોભને વાર્યા રે - સંતને જાણીએશ્રી જગદીશ,
અંતર માંથી રે હું તું ટાળીએ - સંતને સોપીએ નીજ મન શીશ : સંગતુ
૨ હરિ રસ માંહી રસ રૂપ થઈ રહ્યો - હારે સદ્દગુરૂ સાચા રામ,
પાંચ પચીસને પ્રપંચથી પાર છે - હાંરે એતો અખંડા નંદનું ધામ : સંગતુ
૩ લહેર લાગી રે આ તન વિષે - હાંરે ત્યારે હારદ આવે હાથ,
આવરણ સમાવી આદર કીજીએ - હાંરે ત્યારે નેહ જણાવે નાથ : સંગતુ
૪ ભક્તિનો ધરમ છે નેહ કરમનો - હાંરે કરસે તે વિરલા કોઈ,
શીશ ઉતારી સનમુખ થઈ લડે - એમ કહે પુરાણ પોકારી સોઈ : સંગતુ
૫ દુગ્ધા રહિત મહાજન માલમી - સંત જાણી કરીએ તેનો સંગ,
અભય તે કહેવાય અનુભવે ઉતર્યારે - સત સત રવિદાસ પુરૂષ પ્રસંગ : સંગતુ

ભજન

૧ સાહેબ સમર્યા વિના - પાર નવ પહોંચો રે,
આતો ધુતારાનું શહેર છે,
આવ્યો તેદી બંદા શું બોલી બોલતો રે,
હવે બોલે તેમાં ઘણો ફેર છે : .... સાહેબ .....
૨ રૂડી રે કમાણી તારી ચોપડે ચડસે રે લેખા લેવા સાહેબ તુજને તેડસે
મોટપાઈમાં બંદા મોહી રહ્યા છો,
મોટપ તારી તને ઘેર સે : .... સાહેબ ....
૩ મીથ્યા માયામાં તારો જીવ લલચાંણો રે,
પ્રભુ ભજન સાથે ઘણો વેર,
સમુદ્રમાં ઘણી છીપુ નીપજેરે
છીપે છીપે ઘણો ફેર : ...... સાહેબ ......
૪ સાધુ થયા તેથી સુરે થયું રે
પ્યારે પ્યાલે ઘણો ફેર
કહે રવિદાસ ગરૂભાણ પ્રતાપે
જેને માથે સાહેબની મહેર : ...... સાહેબ ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n107/mode/1up

realpatidar.com

ભજન

સદ્‌ગુરૂ સાથે બાઈ મારે પ્રીતડીરે
સમજાવી જ્ઞાન પુરણ બ્રહ્મ ભેદ
કારજને કારણે રે બાઇ મારે સમજાયું રે
કરમ ભરમના કર્યા ઉચ્છેદ : સદ્‌ગુરૂ...... વેલ....

૧ તન મન સોપ્યું રે સદ્‌ગુરૂ ચરણમાં રે પ્રેમે પીયુજી ને કીધા હાથ,
બાહેર ભીતરરે રસીક વર રમી રહ્યા રે,
નજર આગળથી નવ જાય નાથ : ... સદ્‌ગુરૂની ....

૨ અજાણ હતી તે અનંત આવરણમાં રે, સદ્‌ગુરૂએ પડળ કીધાં દૂર,
અહોનીસ જીલુરે પ્રેમ આનંદમેં રે
જ્યાં જોઉ ત્યાં હરિ ભરપુર : સદ્‌ગુરૂની ....

૩ આવી ભૂલી રે વસ્તુ વિદેહીમાં રે પ્રગટી રે પુરણ બ્રહ્મ દિશાય,
શુદ્ધ વિચારતાં રે જેનું તે રહ્યું રે ,
અણ છતાં રવીદાસ નિરંતર ગાય : .સદ્‌ગુરૂની ....

ભજન

ગુરુજી નમેરા ન થાઓ દીનાનાથ - ત્રીકમ વસમે ટાંણે રે,
મોટા તમે છો મહારાજ - વેદ તમને વખાંણે રે : ..... વેલ ....

૧ ગુરૂજી કર્તા યુગ ત્રેતા યુગમાં - દ્વાપરમાં કૈયેક તાર્યા રે,
એવા કળિયુગમાં કીરતાર - અનેકને ઓધાર્યા રે : ... ગુરૂજી ...

૨ ગુરૂજી સજનો જાતનો કસાઈ - દયા નહિ એના દિલમાંરે,
એવા અધમ અજામીલ - પાપીને તાર્યા પલમાં રે : ...... ગુરૂજી ...

૩ ગુરૂજી નામ દેવના પીધાં દૂધ - ડબરીયા ભરી ભરી નેરે,
એવાં જેલમાં કીધાં યુદ્ધ - સામે ચડીને રે : ..... ગુરુજી....

૪ ગુરુજી મારે નથી જોઈતા - લાખ બે લાખ - કરોડને શું કરીએરે
એવી દુનિયાને રોજી પુરણહાર - આપો તો ઉદર ભરીયેરે : .. ગુરુજી.....

૫ ગુરૂજી ખજાને પડી જો હોય ખોટ - કુબેર ને જઈ કહેજો રે ,
એવા ખાતે મંડાવીને ખાસ - ગુરૂજી અમને દેજોરે : ગુરુજી ...

૬ ગુરૂજી બોલ્યા રવિગુરૂ ભાંણ - ત્રીકમ અમને તારો રે,
તમે મોટા છો મહારાજ - વેદ તમને વખાંણે રે : ગુરુજી ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n108/mode/1up

realpatidar.com

ભજન

૧ સદ્‌ગુરૂ બોલ્યા રે મસ્તક કર ધરી રે સેવક સાચી માનજે શીખ,
પ્રગટ રહ્યું છે રે તારા પેટમાં રે
દીલડાની દુગ્ધા કાઢી નાખ : .....સદ્‌ગુરૂ....

૨ આનંદ આણી રે અનુભવી ઓચર્યા રે ...પામો તમે પ્રેમી જન સું પ્રીત
જ્ઞાન વૈરાગ્યે રે ભક્તિ રસ ભેટીયા
રે અંતર રાખો નીરમળ રીત : સદ્‌ગુરૂ .....

૩ સીલને સંતોષરે ક્ષમા બહુ રાખવી રે સાધુ જન સુ આધિનતા બહુ હેત
બાળક સ્વભાવેરે રેવું તારે રહેણીયે રે,
વસ રાખો જીભ્યા ઇન્દ્રી સમેત : સદ્‌ગુરૂ......

૪ જ્ઞાન ગંભીર રે રહીએ નિયમથી રે, જો મન ગંભીર છે દરિયાવ,
ઉલટી લહેરી રે-ગટડામાં સમાવી એરે,
માન ગાળી ટાળવો દેહ સ્વભાવ સદ્‌ગુરૂ......

૫ દીઠી ને અણદીઠી રે કહે કોઈ અનુભવિ રે સમજીને સમાસ કરે કોઈ સંત,
ત્રિવેણીમાં જઇને આશન કરે રે
અનહદ સાંભળે નાદ અખંડ : સદ્‌ગુરૂ ....

૬ કઠણ વચન રે કથતાં હરકત ધરીયેરે મોના મીઠા દીલના જુઠા જાંણ,
હરિજન હંસારે તેથી અળગા રહે રે,
અવગુણ કોના ન ધરે કાન: સદ્‌ગુરૂ.....

૭ તત્ત્વના દર્શન રે આગે બહુ થયારે તેનો કોઇ માણે હૈયામાં દોષ,
મન કર્મ વચને રે કોઇને દુભવે નહિરે,
તેતો નર જીવતા પામ્યા મોક્ષ : સદ્‌ગુરૂ......

૮ હરિરૂપ થયોરે હરિરસ નીહાળતાં રે , જો હોય પુરણ હરિપદ આસ,
સંસય ન મટે રે વણ સતસંગે રે,
ભાણ ચરણે ભણે રવિદાસ : સદ્‌ગુણ ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n109/mode/1up

realpatidar.com

ભજન

૧ લાગા શબ્દ સદ્‌ગુરૂ કા કલેજે વેદ શું જાણે એનીયું વાતું
વિવેક વિચાર વિના હાલે હેડકતી
શું જાણે પીયુજીની એકાંતું : વેલ....

૨ પલ પલ મારા પીયજીને સમરૂં ખંડિત ન હોય દિવસ રાતું,
પાપ પુન મારાં મટી ગયાં સજનરા
મટા ગઈ સર્વે મનની ભ્રાંતુ : લાગા શબ્દ.....

૩ પ્રેમ ગલીમાં મારા પીયુજીને પામી, જાણે અનેક સુરજ તણી કાંતુ,
ચૌદ ભુવનમાં તેના અજવાળાં,
પીયુજી મળ્યા જાણે વરસી રહી સ્વાતી : લાગા શબ્દ......

૪ ટૂટ જાય ભલે ધરણી આકાસા, સુખ જાય ભલે સમુદર સાતું
પણ પલ એક મારા પીયુજીનાં વિસારૂં
મારો નામ તણો નીરભે નાતો : લાગા શબ્દ.....

૫ લાગી લગની ભાંગી ભ્રાતુ રોમે રોમે બોલે તાંતે તાંતુ
કહે રવિરામ સખી સદ્‌ગુરૂ કો
ભાંગી મારી સરવે ભ્રાંતું : લાગા શબ્દ.....

જ્ઞાન કવિતા

પરોઢિયે નીત ઊઠીને - લેવું ઇશ્વરનું નામ,
દાતણ કરી નાહ્યા પછી - કરવા પાઠ તમામ.
કહ્યું કરો મા બાપનું - દો મોટાંને માન,
ગુરૂને બાપ સમો ગણો - તો મળશે સારું જ્ઞાન.
જુઠું કદી ન બોલવું - તજવું આળસ અંગ,
હળી મળીને ચાલવું - એવો રાખો સારો સંગ.
નીત્ય જવું નિશાળમાં - ભણવું રાખી ચિત,
ગુરૂની શિક્ષા માનવી - એવી રાખો રૂડી રીત.
રાખો નહિ મન રમતમાં - સમજો સારી પેર,
નિશાળમાંથી નીકળી - જવું પાંસરૂ ઘેર.

realpatidar.com

https://archive.org/details/bk151/page/n110/mode/1up

realpatidar.com

પ્રાર્થના

ઓ કરૂણા ના કરનારા - તારી કરૂણાનો કોઈ પાર નથી,
ઓ સંકટ ના હરનારા - તારી કરૂણાનો કોઈ પાર નથી : વેલ...

૧ મેં પાપ કર્યાં છે એવાં - હું ભુલી તારી સેવા,
કે...મારી ભુલોના ભુલનારા : તારી કરૂણાનો કોઈ પાર નથી. ઓ કરૂણા

૨ હે પરમ કૃપાળુ વાલા - મેં પીધા વિષના પ્યાલા,
કે... મારા જીવન રક્ષણહારા : તારી કરૂણા નો કોઇ પાર નથી. ઓ કરૂણા.

૩ હું અંતરમાં થઈ રાજી - ખેલ્યો છું અવળી બાજી,
કે..અવળી સવળીના કરનારાઃ તારી કરૂણાનો કોઈ પાર નથી :ઓ કરૂણા

૪ ભલે છોરૂં કછોરૂં થાય - તું માવિત્ર કહેવાય,
કે...બાળકના દોષ ભુલનારા : તારી કરૂણાનો કોઈ પાર નથી. ઓ કરૂણા

૫ મને જડતો નથી કિનારો - મારો ક્યાંથી આવે આરો,
કે..મારા સાચા ખેવણહારા - તારી કરૂણાનો કોઈ પાર નથી : ઓ કરૂણા.

૬ છે જેનું જીવન ઉદાસી - શરણે આવ્યો અવિનાશી,
કે... ભક્તોના દિલમાં રમનારા. તારી કરૂણાનો કોઈ પાર નથી : ઓ કરૂણા.

ચૌદ વાતું

૧	ખાવા જેવી ચીજ હોય તો -	ગમ છે.
૨	ગળી જવા જેવું	અપમાન છે.
૩	પચાવવા જેવી વસ્તુ -	ક્રોધ છે.
૪	આપવા જેવી વસ્તુ -	દાન છે.
૫	લેવા જેવી વસ્તુ -	જ્ઞાન છે.
૬	જીતવા જેવી વસ્તુ -	પ્રેમ છે.
૭	હારવા જેવી વસ્તુ -	અભિમાન છે.
૮	દેખાડવા જેવી વસ્તુ -	દયા છે.
૯	સાંભળવા જેવી વસ્તુ -	ગુણ છે.
૧૦	બોલવા જેવી વસ્તુ -	સત્ય છે.
૧૧	કરવા જેવી વસ્તુ -	સેવા છે.
૧૨	ફેંકવા જેવી વસ્તુ -	ઈર્ષા છે.
૧૩	છોડવા જેવી વસ્તુ -	અનીતિ છે.
૧૪	સાચવવા જેવી વસ્તુ -	ઈજ્જત છે.

realpatidar.com

https://archive.org/details/bk151/page/n111/mode/1up

realpatidar.com

શ્રી અથર્વવેદી સતપંથ સેવા આશ્રમના પરમ પૂજ્ય સંત શિરોમણી પરમસંત આચાર્ય શ્રી માવજીદાસ મહારાજશ્રીની જીવનની આછી ઝલક

(પ્રથમ રાગ કાઠીયાવાડી સોરઠીયા)

એ... વિશાળ આ વિશ્વમાં.... ભલો આવેલ ભારત દેશ....
તેમાં ગુજરદેશ રળિયામણો.... તેની શોભા વર્ણવી ના જાય....
એ... કચ્છ ભૂજ જિલ્લો નામ છે.... જે જિલ્લામાં વિખ્યાત....
તાલુકા નખત્રાણા મહિં જ્યાં છે શુદ્ધ સમીર....
એ... સંતો ભક્તો અનેક વસ્યા... વસેલા સતી સંતોને પીર ફકીર...
તપસ્વીઓને શૂરવીર વસ્યા... અહીં વસેલા દાતાઓને દાનવીર...
એ... ધન ધન ધરા કચ્છ ભોમની....ધન ધન રસલીયા ગામ....
ધનાધન પિતા માનણભાઈ આપના ધન ધન માતા રામુબેન જાણ....
એ... કડવા કુળમાં જન્મયો... માવજી ધરાવેલું નામ...
દૂધ દિપાવ્યું માતા તણું.... ઉજ્જવળ કર્યું પિતાનું નામ....
એ... કુળ દિપતું સાંખલા તણું... પોથી પુરે એવી સાંખ....
ભગવું લખાયું જેના ભાગ્યમાં.... એ મિથ્યા કરી શકે નહીં કોય...
એ.. જન્મો જન્મનો યોગી એતો.... ધર્યો ઉદ ઉદરેથી અવતાર...
એમના દર્શને સૌ આવતા... આવતા અનેક નરને નાર...
એ... સવંત ઓગણીસો બાસઠની સાલમાં અષાઢ સુધી સાતમને સોમવાર.
કુળ તારણ એ અવતર્યો... માવજી થયો રે મોરાર....
એ... દિપક બાજાયો સંતપંથ તણો... થઈ અંધારી રાત....
લાખલાખ જગાડો દિવડા.... પહોંચે નહીં શષ્ટી પ્રકાશ...
એ... આશાતો અમર રહે.... કાયા અમર રહે નહીં કોઈ
નામ અમર એમનું રહે... અરે એની કિર્તી સદા અમર હોય...
એ... સવંત બે હજાર એકત્રીસની સાલમાં.માગસર વદી નોમને સોમવાર.
એ નરતો અવનિ વષે ગયો.....એ એની વાણી રહી ગઈ વિખ્યાત....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n112/mode/1up

realpatidar.com

(રાગ સવીયો)

એ રસલીયાનો રસી ગયો (૨) કચ્છતણો કણબી ગયો (૨)
વિવેકનો વડો ગયો. સતપંથનો સિરતાજ ગયો (૨)
એ જ્ઞાનીની અને મુની ગયો.. (૨) યોગી અને જતી ગયો (૨)
ધર્મતણો ધીરવીર ગયો સતપંથનો સિરતાજ (૨)
એ સંતોનો શણગાર ગયો (૨) માયાનો મુકાવનાર ગયો (૨)
મુક્તિનો મેળાવનાર ગયો (૨) એ સંતપંથનો સિરતાજ ગયો(૨)
એ સમાજનો સુકાની ગયો (૨) શિષ્યતણો ગુરુજી ગયો (૨)
નિરાશ સૌને કરી ગયો. એ સંતપંથનો સિરતાજ ગયો (૨)
એ તરણી તણોતો તે જ ગયો (૨) શશી સમાન શિતળતા ગઈ (૨)
સાગર સમો ધિરવિર ગયો...... એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ પુષ્પોતણી ખુશ્બો ગઈ (૨) વેદ તણી વાણી ગઈ (૨)
ગુણતણો ભંડાર ગયો....એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ વાડી તથા વૃક્ષો ગયાં (૨) ગુલાબતણાં પુષ્પો ગયાં (૨)
એ શોભા સઘડી હરી ગયો.... એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ આશ્રમનો આશ્રિત ગયો (૨) સંતોનો સમો વડો ગયો (૨)
કચ્છ દેશનો કેશરી ગયો..... એ સતપંથનો સિરતાજ ગયો (૨)
સંતોનો સિરતાજ ગયો(૨) ભાવટીનો ત્યાગનાર ગયો (૨)
મોક્ષનો મેળવનાર ગયો.....એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ પિતાતણો પનોતો ગયો (૨) માતાતણો માનીતો ગયો (૨)
કુટુંબનો કુળતારણ ગયો....એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ ગરીબોનો ગોઠી ગયો (૨) દાનવીર અને દાત્તાર ગયો (૨)
નોધારાનો આધાર ગયો..... એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ શિવગણદાસનો સિરતાજ ગયો(૨) આશ્રમતો તેમને સોંપી ગયો(૨)
કૃપા સદા વરસાવી ગયો.... એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ ગામોગામ ગોઠો થઈ (૨) પૂજાઓ પાર વિનાની થઈ (૨)
કિર્તીઓ એમની અમર થઈ...એ સતપંથનો સિરતાજ ગયો (૨)
એ આશ્રમ તો અટૂલો થયો (૨) શિવગણદાસને સૌ સોંપી ગયો(૨)
આશિષ ઉરની આપી ગયો..... એ સતપંથનો સિરતાજ ગયો (૨)

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n113/mode/1up

ગુરૂ માવજીદાસ પ્રતાપે દાસ જીવરામ બોલ્યા સાંભળો મુનિવરભાઈ

realpatidar.com

ગાય સુણેને સાંભળે તેના વૈકુંઠમાં હોશેવાસ.

અસ્તુ

આ કેસેટ માનવીના હિત કાર્ય માટે પ્રસ્તુત કરે છે પરમપૂજ્ય બ્રહ્મચારી શ્રી શીવગણદાસ મહારાજ, શ્રી અથર્વવેદી સતપંથ સેવા આશ્રમ ટ્રસ્ટ, કાદિયા.

ગુરૂ માવજીદાસની સ્તુતિ

૧ શ્રી ગુરૂદેવ માવજીદાસ - તમને વારંવાર પ્રણામ
તમને વારંવાર પ્રણામ - પ્રભુ છો અંતરના આરામ.

૨ શ્રી ગુરૂ
સેવા આશ્રમ કાદિયા છે તમારૂં ધામ,
ત્યાં દર્શને આવતાં - નર નારીનાં તમને પ્રણામ.

૩ શ્રી ગુરૂ
પાવન નામ પવિત્ર તમારૂં - ઉર અજ્ઞાન તિમિ હરનારૂં,
એક જ કરવાનું છે કામ - તમને વારંવાર પ્રણામ.

૪ શ્રી ગુરૂ
સદ્‌ગુરૂ અદ્‌ભુત શક્તિ તમારી - નિજ મહિમા કેરી બલિહારી,
કીધાં પરોપકારી કામ - તમને વારંવાર પ્રણામ.

૫ શ્રી ગુરૂ
ઘટ ઘટ જ્યોતિ તમારી ઝલકે - તેજ તમારૂં સઘળે છલકે,
ગુરૂ છો સ્વયં જ્યોતિ સુખધામ - તમને વારંવાર પ્રણામ.

૬ શ્રી ગુરૂ
છે એક અચલની અરજી - શ્રી ગુરૂ પછી તમારી મરજી,
આપો દર્શન પૂરણ કામ થાય તમને વારંવાર પ્રણામ,
શ્રી ગુરૂ માવજીદાસ તમને વારંવાર પ્રણામ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n114/mode/1up

realpatidar.com

પ્રભાતિયું-૧

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે : .... વેલ .....
૧ દેહમાં દેવ તું તેજમાં તત્ત્વ તું - શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસેઃ ... અખિલ...
૨ પવન તું પાણી તું ભૂમી તું ભુધરા - વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાસે. અખિલ...
૩ વિવિધ રચના કરી અનેક રસલેવા શિવ થકી જીવ થયો એજ આસે : અખિલ....
૪ વેદતો એમ વદે શ્રુતી સ્મૃતી સાંખદે કનક કુંડળ વિષે ભેદ ન હોય : .. અખિલ....
૫ ઘાટ ઘડયા પછી નામ રૂપ જુજવાં, અંતેતો હેમનું હેમ હોય : .... અખિલ...
૬ ગ્રંથ ગડબડ કરી વાત ન કહી ખરી, જેહને જે ગમે તેને પુજે : ..... અખિલ...
૭ મન વચન કર્મથી આપ માની લહો સત્ય છે એજ મને એમ સુજે : અખિલ...
૮ વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોઉં પઢંતરો એજ ભાસે : ...... અખિલ...
૯ ભણે નરસૈયો મન તણી એ સાધના, પ્રીત કરૂં પ્રેમથી પ્રગટ થાશે :.....અખિલ....

પ્રભાતિયું-૨

વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં (૨)
કઠણ બંધ કામના કોઈક છૂટે : ..... વેલ ....

૧ કનક અને કામીની ચોકી આડી શ્યામની,
રામની રમતને કોઈક બુઝે : ....વૈરાગ્યના ....

૨ પારવતીને વસ થઈ ભક્તિને ભૂલી ગયો,
નીરીએ નેણનાં બાણ માર્યાં : વૈરાગ્યના ....

૩ જોગ ધરી ભોગની પાછી ઈચ્છા કરી,
હાથ આવી બાજી શીદ હાર્યો : વૈરાગ્યના .....

૪ કામનું મૂળ તે જાણવી કલ્પના
ક્રોધ ને કર્મની ગાંઠ બાંધે : વૈરાગ્યના.....

૫ શીલને સંતોષના ચોબા દીધા વિના,
જનમને મરણનું દુઃખ વાધે . વૈરાગ્યના ....

૬ મૂળ વૈરાગ્યમાં મન જેનું ગળ્યું,
વિષયના સ્વાદ તેને નવ નડે : વૈરાગ્યના .....

૭ ભણે મેંતો નરસૈયો સંતતો ચેત્યા ખરા,
વેદ વાંણી એમ ઓચરે : .... વૈરાગ્યના ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n115/mode/1up

realpatidar.com

પ્રભાતિયું-૩

એજીવાલા અમેરે હંસા ઓલ્યા દેશના - ચારો મોતીનો કરીએ
ખટ રસથી રહીએ વેગળા - અહાર અમૃતનો કરીએ : ....વેલ .....
૧ માન સરોવર મોજુ માંણીએ - હીરો રૂદિયામાં ધરીએ,
નાંભી કમળ ગટ વાટમાં - સંતો શોધીને લઈએ : ...... અમેરે ...
૨ અગમ દેશની વાતડી - કોના આગળ કરીએ
દેશી મળે રે આપણા દેશના - માન મૂકીને મલીએ : ..... અમેરે ...
૩ મોતી ચણીએ માંયલાં - અવર અહાર ન કરીએ,
શીર સાટે ફળલીજીએ - ખોટી ખાટે ન પડીએ : ..... અમેરે....
૪ નેહ રાખો હરિ નામનો - મન આતમ બ્રહ્મમાં ભળીએ,
ભણે નરસૈયો દાસ તુમ તણો - જઈ ઈશ્વર ને મળીએ : . અમેરે.. .

પ્રભાતિયું-૪

જાગો જાગો પ્રેમ સ્નેહી - ભોર થઈ ઉઠી જાગો રે,
આ વેળા છે સ્વામી ભજયાની - ઉંઘ આળસ તમે ત્યાગો રે : .... વેલ....
૧ શું સુતા છો મોહ માયામાં - અજ્ઞાન અંધકાર ઓઢીરે.
ગઈ જુવાની હવે પાછી ન આવે - હજીનાં જાગ્યા બડ ભાગો રે : એ જાગો જાગો...
૨ અજ્ઞાન અંધારૂ તમે ઘટમાંથી કાઢો ... જ્ઞાનનો દિવડો બાળો રે ,
ગફલત મૂકી હવે ચેતો ને ચિતમાં - સદ્‌ગુરૂને પાય લાગો રે ... એ જાગો...
૩ હવે તમે નીત્ય નીંરજન સમરો - માન અભિમાન મૂકો રે ,
ધ્યાન ધરી લ્યો તમે સાચા ધણીનું - હવે તો મુક્તિ માગો રે :. એ જાગો જાગો..
૪ દયાને ભાવ તમે દીલમાં આણો - કોમળ રાખો મન રે ,
પુણ્યને દાન તમે કરોને હરખે - પાપથી દૂર ભાગો રે ... જાગો જાગો...
૫ ભાવ ભાલો લઈ પ્રેમ તુરી ચડો - સુરતીનું બાંણ ચલાવો રે,
પાંચ પચીસ ચોર ઘટમાંથી કાઢો - કરો કેશરીયા વાગા છે : .. જાગો જાગો..
૬ અટાંણે જો ભૂલસોતો - બગડસે મનખો તમારો રે,
જ્ઞાની કહે તમે સાહેબ સમરો - નહિ તો હંસ થસે કાગો રે :
એજાગો.. જાગો પ્રેમ સ્નેહી .....

realpatidar.com

realpatidar.com

પ્રભાતિયું-૫

રામ ભજ તું રામ ભજીલે - પ્રભુને ભજીલે પ્રાણીયા,
પ્રભુ ભજયા તે પાર પોતા - ચૌદ લોકે જાણીયા : વેલ .....
૧ મોહ માયાએ તને બંધન કીધો - હરિને ન ભજાવિયા,
ભૂંડી વેળાના ભુત સરજ્યા - અવગતે આણીયા : ..... રામ ....
૨ માયા મધની કોટડીમાં - કોઈક સંત વિરલા રહ જાંણીયા,
ખાધી પીધી ખુબ ખરચી - દિલમાં દાગન આણીયા : ...... રામ.....
૩ મારા ગુરૂએ ગોવાળી કીધી - મૂળ ધરમમાં આંણીયા,
દાસી જીવણ સંતો ભીમના ચરણે સંતો અમરાપુર માંણીયા : ...... રામ....

પ્રભાતિયું-૬

જાજા નીંદરા હું તને વારૂં - તું છો નાર ધુતારીરે .. (૨) .... વેલ....
૧ નીંદરા કહે હું નહિ ધુતારી - હું છું ચંચળ નારી રે,
પશુ પંખીને સુખડાં આપું - દુઃખડાં દઉ વિસારી રે : જા....જા....
૨ એક સમે રામ વનમાં પધાર્યા - લક્ષ્મણને નિંદરા આવી રે ,
સતી સીતાને કલંક ચડાવ્યું - ભાઈઓમાં ભ્રાંતિ પડાવી રે : જા.... જા
૩ જોગી રે લૂંટયા ભોગીરે લૂંટયા - લૂંટયા નેજા ધારી રે,
એકલસંગી ને વનમાં લૂંટ્યા - ક્યા કરે સંસારી રે : જા .... જા...
૪ બાર બાર વરસ લક્ષ્મણે ત્યાગી - કુંભ કરણે લાડ લડાવ્યા રે,
ભલે મલ્યા મહેતા નરસૈના સ્વામી - ભમરે ભ્રાંત ભાંગી રે.... જા... જા...
સાખી : પેલે પોરે સૌ કોઈ જાગે - બીજા પહોરે ભોગી
ત્રીજા પહોરે તસકર જાગે - ચોથા પહોરે જોગી ....

લોપહર : ૬ થી ૯ રાત્રે
જોપહોર : ૯ થી ૧૨
૧૨ થી ૩
૪ થી ૬ સવાર

realpatidar.com

પ્રભાતિયું-૭

realpatidar.com

જીભલડી તને હરી ગુણ ગાતાં - આવડું આળસ ક્યાંથી રે,
લવરી કરતાં નવરી નાં પડે - બોલી ઉઠે મુખ માંથી રે.... વેલ .....
૧ પર નીંદા કરવાને પુરી - શૂરી ખટરસ ખાવા રે,
ઝગડો કરવા જાુજે પહેલી - કાંયર હરી ગુણ ગાવારે...... જીભલડી .....
૨ અંત કાળે કોઈ કામ ન આવે - વહાલા વેરીની ટોળીરે,
સ્વજન ધારીને સર્વસ્વ લેસે - રહેસો આંખો ચોળીરે.... જીભલડી.....
૩ તલ મંગાવો ને તુલસી મંગાવો - રામ નામ સંભળાવો રે,
પ્રથમ તો મસ્તક નહિ નમતું - પછી શું નામ સુણાવો રે -જીભલડી......
૪ ઘર લાગ્યા પછી કુપ ખોદાવો - એ આગ કેમ ઓલવાસે રે,
ચોરો તો ધન હરી ગયા - પછી દીપકથી શું થાશે રે : .... જીભલડી ......
૫ માયાના ઘેનમાં ઊઘી રહી છો - જાગી જો તું તપાસી રે,
અંત સમે રોવાને બેઠી - પડી કાળની ફાંસી રે, ... જીભલડી......
૬ હરીનામ લેતાં દામ ન બેસે - એક વાલ ન ખર્ચ રે,
સેજે પંથનો પાર ન આવે - ભજન થકી ભય ટળશે રે : .... જીભલડી....

પ્રભાતીયું-૮

ભુતળ ભક્તિ પદારથ મોટું - બ્રહ્મ લોકમાં નાંહિરે,
પુણ્ય કરી સ્વર્ગા પુરી પામ્યા - અંતે ચોર્યાસી માહિરે : ... વેલ...
૧ હરીના જનતો મુક્તિ માગે - માગે જનમો જનમ અવતાર રે
નીત્ય સેવા નીત્ય કીર્તન ઓછવ-નીરખવા નંદ કુંવર રે : ...ભુતળ...
૨ ભરત ખંડ ભુતળમાં જનમી - જેણે ગોવિંદનાં ગુણ ગાયા રે ,
ધનધન એના માત પિતાને - સફળ કરી એને કાયા રે : ...ભુતળ....
૩ ધન વૃંદાવન ધનએ લીલા - ધન એ વૃજના વાસીરે,
અષ્ટ મહા સિધ્ધી આંગણે ઊભી-મુક્તિ છે એની દાસી રે :.. ભુતળ...
૪ એ રસનો સ્વાદ શંકર જાણે --કે જાણે સુક્ક જોગી રે,
કાંઇક જાણે વૃજની ગોપી - ભણે નરસૈયો ભોગીરે :..... ભુતળ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n118/mode/1up

realpatidar.com

પ્રભાતિયું-૯

એ નુરના ઘરની ખબર ના જાણી - માયામાં જીવ ભૂલ્યો રે,
સંસાર સાગર મહાજળ ભરીયો - તેમાં પ્રાણી ડૂબ્યોરે : ... વેલ.....

૧ વેદ પુરાણમાં જુવો વિચારી - કળજુગની એવી એંધાણી રે,
લોભ સ્વારથમાં સબ કોઈ રાચ્યા - અવસર થાય ધુળ ધાણીરે... એ નુરના.....

૨ પાંચ તત્ત્વનો મહેલ બનાવ્યો - ત્રીવેણી કીયા પ્રકાશારે,
શૂરા હોય સો રહેણી જગાવે - ગાફલ જાસે દુરારે : .... એ નુરના...

૩ નાંભી કમળ સે દમ ઉઠતહય - સમરણ સ્વાસ ઉશ્વાસારે,
શીવ શક્તિ કા મેળા કરના - બંક નાળ રસ પીના રે ... એ નુરના.

૪ બંક નાળનો મારગ વાંકો - ચડે વીરલા કોઈક રે,
જેને સદ્‌ગુરુ પુરા મળીયા - સોહી ઘરમાં આવે રે : ..... એ નુરના....

૫ ગંગા જમના દો દીસ વહેતી - વચ્ચમાં સરસ્વતી કાવેરીરે,
ત્રિવેણીમાં સ્નાન કરનાં - સુનમાં ધ્યાન લગાનાં રે :... એ નુરના....

૬ ધ્યાન લગાવે સબ કુછ પાવે - દરશન પાયા સદ્‌ગુરૂકારે,
પ્રેમ ગુરૂકે દર્શન કરનાં - મહાપદમાં જો આયારે ... એ નુરના...

પ્રભાતિયું-૧૦

બ્રહ્મ રસ તે પીએ - જે આપ ત્યાગી હોય રામ
બ્રહ્મણામાં ભૂલે નહિ - એવા વિરલા કોકજી... વેલ..

૧ કેશરી વનમાં સંચરે - હુકારે મહાવીરજી......
એની ગર્જનાએ ગજરાજ ત્રાસે - સિંહણ છોડે ધીરજી : ... બ્રહ્મરસ....

૨ સૂરો તે રણમાં સંચરે - જેના ધડપર ન હોય શીષજી,
ધાર અણીથી ધડકે નહિ - એને પ્રગટ હોય જગદીશજી : ... બ્રહ્મરસ....

૩ સાત સાંપર સેજે તરે - એકજ અંજલી નીરજી,
બુડે નહિએ બિરદધારી - ત્રિવેણીનાં તીરજી : .... બ્રહ્મરસ.....

૪ સિંહણનું દૂધ જીરવે - હોય સિંહણનું બાળજી,
શુદ્ધ કનકના પાત્રવિના - ફોડી નીસરે બારજી : ..... બ્રહ્મરસ......

૫ પુરા સદ્‌ગુરૂ તે કહીએ પરમારથી મહા સંતજી,
કહે અખો મહાતેજમાં હે - મલી રહ્યા મહંતજી : .... બ્રહ્મરસ.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n119/mode/1up

પ્રભાતિયું-૧૧

realpatidar.com

ચેતન ચેતી લેજો - મળ્યો મનુષ્ય અવતાર રે ,
હરિને ભજો તો - ઉતરો પાર રે : ...... વેલ .....

૧ કાયા કાગળ જૈસી કોટડીમાં - ભર્યા છે અનગળ ભાર રે,
કાયા બેડી તારી બૂડવાને લાગી - સંતો ઉતારે ભવપાર રે ...એ ચેતન ....

૨ હરીના નામનાં હાટ મંડાવો - ભક્તિનો કરો વેપાર રે
વિઠલ નામની વસ્તુને વોરો - તોલાં કરો ટંકસાળરે : એ ચેતન...

૩ ધીરજની તમે ઢાલ બાંધો - સત્યની બાંધો તલવાર રે,
રામ નામના બખતર પહેરો - માંયલા કાળીંગાને મારો રે :..એ ચેતન...

૪ સેજ તળાઇયું અવલ ઓસીકાં - ધન દોલતનો નહિ પાર રે,
અહીયાંનુ ધન તારૂ અહીં જ રહેસે - સાથે નહિ આવે તલ ભાર રે. એ ચેતના....

૫ દેવાય તો તમે અન્નદાન દેજો - ભર્યા છે ગ્રંથ ભંડાર રે,
ભુતનાથ ચરણે ભણે અખૈયો - સત્યવચન છડીદાર રે : ....એ ચેતન....

પ્રભાતિયું-૧૨

એ... વારજે તું વારજે - વેગ મનનો વારજે,
મૂળથી અભિમાન ત્યાગી - મોહ મમતાને મારજે ... વેલ....

૧ નીત્ય સવારે વહેલો ઊઠીને - શ્રી હરિને સંભારજે,
દેહ તારો શુદ્ધ કરીને - વેદ મંત્ર ઉચાર જે : એ વારજે ....

૨ સંગત કરજે જ્ઞાની જનની - હઠીલાથી તું હાર જે,
દુબળા દેખી દાન દેજે - હામ જોઇ ઝંક ધારજે : એ વારજે ....

૩ જરા તને દોષ ન લાગે એવા કારજ તું કર જે,
કુડ કપટ દૂર કરીને - સત્ય વચન સંભાળજે : એ વારજે

૪ આશા કરી આવે શરણે - એને તું ઉગારજે,
કહે પીંગળ તું રામરટજે - આપ કુળને તાર જે : એ વારજે.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n120/mode/1up

realpatidar.com

પ્રભાતિયું-૧૩

હરિનો મારગ છે શૂરાનો - નહિ કાયરનું કામજો
પ્રથમ પહેલું મસ્તક મૂકી - વળતી લેવું નામજો ... વેલ.....
૧ સુતવિત દારા શીશ સમરપે - તે પામે રસ પીવાજો
સિંધુ મધ્યે મોતી લેવા - માંહી પડ્યા મરજિવા જો હરિનો ....
૨ મરણ આગમે તે ભરે મુઠી , દિલની દુગ્ધા વામે જો
તીરે ઉભા જુએ તમાસો - તે કોડી નવ પામે જો ... હરિનો.....
૩ પ્રેમ પંથ પાવકની જ્વાળા - ભાળી પાછા ભાગે જો
માંહી પડ્યા તે મહા સુખ માંણે - દેખન હારા દાઝે જો.. હરિનો....
૪ માથા સાટે મોંઘી વસ્તુ - સાંપડવી નહિ સહેલજો
મહાપદ પામ્યા તે મરજિવા - મૂકી મનનો મેલજો હરિનો ....
૫ રામ અમલમાં રાત માતા - પુરા પ્રેમી જનજો
પ્રીતમના સ્વામીની લીલા - નીરખો રજની દીનજો હરિનો .....

પ્રભાતિયું-૧૪

સંત સમાગમ જે જન કરસે - પ્રગટે પુરણ પ્રેમજો
જે ધાતુને પારસ પરસે - તે તો હોયે હેમજો :
૧ કથીર કાંસુ હેમ ન હોય - કોટી પારસ પરસેજો
સૂન છીપ તે ઉપર ન આવે - સો મણ સ્વાતિ વરસેજો : સંત.....
૨ અચેતને ઉપદેશ ન લાગે - શિવ બ્રહ્મા સમજાવે જો
જેનાં તે અવળાં અંત કરણો - તેને સમજણ નાવેજો ... સંત ....
૩ કુબુદ્ધિ કાળપ જેને રૂદે - તેને ન લાગે રંગ જો.
અડદ ઉજળા કેમ ન થાએ - જઈ જબોળો ગંગજો : ... સંત....
૪ કુસકા કુટેથી શું થાએ - કણ ન જડે તેમાંથી જો
મંદ અભાગી મુરખજનને - સમજણ આવે ક્યાંથી જો : ...... સંત .....
૫ પાપીને પરબોધન કરીએ - મૌન ગ્રહીને રહીએ જો
કહે પ્રીતમ તુલસીદળ તોડી - પ્રેત ન પૂજવા જઈએ જો ... સંત .....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n121/mode/1up

realpatidar.com

પ્રભાતિયું-૧૫

સંત કૃપાથી છૂટે માયા - કાયા નિર્મળ થાય જો.
શ્વાસો શ્વાસે સમરણ કરતાં - પાંચે પાતક જાયજો .... વેલ .....
૧ કેશરી કેરે નાદે નાસે - કોટી કુંજર જૂથ જો
હિંમત હોય તો પોતે પામે - સળગી વાતે સુખજો : સંત કૃપા ...
૨ અગ્નિને ઉધઈ ન લાગે - મહામણીને મેલજો
અપાર સીંધુ મહા જળ ભરીયો - મરમીને મન સહેલજો ... સંત કૃપા....
૩ બાજીગરની બાજી તેતો - જંબુરો સૌ જાણે જો
હરિની માયા બહુબળવંતી - સંત નજરમાં ન આણેજો : .... સંત કૃપા...
૪ સંત સેવતાં સુકૃત વાધે - સહેજે સીધે કાજજો
પ્રીતમના સ્વામીને ભજતાં - આવે અખંડ રાજજો : .... સંત કૃપા..

આરતી

ૐ જય સદ્‌ગુરૂ સ્વામી - વાલા જય સદ્‌ગુરૂ સ્વામી
આરતી કરીએ સદ્‌ગુરૂ દેવની, આરતી કરીએ વાલા ગુરૂદેવની
અંતર ઉર નાચી ૐ જય જય સદ્‌ગુરૂ સ્વામી.... વેલ...

૧. વિધ વિધ પેરની વસ્તુ લાવી -પૂજાનો મહિમાય-વાલાપૂજાનો મહિમાય
દાસી સનમુખદીન બની છે - અબળાના આધાર. ૐ જય જય સદ્‌ગુરૂ સ્વામી..
૨. અંતર મહેલમાં આપ બિરાજો - વહેલી કરજો વહાર - વાલા વહેલી કરજો વહાર
લાલ મનોહર મોહન મારા-આતમના આધાર- ૐ જય જય.. સદ્‌ગુરૂ સ્વામી.
૩. ચંદ્ર સુરજને પવન પાણી -અમૃત વસ્તુ કહેવાય -વાલા અમૃત વસ્તુ કહેવાય,
લાલ મનોહર મુરતીમાં મારૂં -મનડું ત્યાં લોભાય. ૐ જય જય..સદ્‌ગુરૂ સ્વામી.
૪. માગું નહિ હું રિદ્ધિ-સિદ્ધિ - ન માગું વૈકુંટવાસ- વાલા ન માગું વૈકુંટવાસ.
અબળાને ઉગારી લેજો - રગું મુરતીની આસ - ૐ જય જય સદ્‌ગુરૂ સ્વામી.
૫. સાચા સદ્‌ગુરૂ મુજને મલીયા-ટાળ્યા ત્રિવિધિના તાપ-વાલા ટાળ્યા ત્રિવિધિનાતાપ
ખેવટીયા મારા ખંતના -મારી નૈયા ઉતારો પાર- ૐ જય જય સદ્‌ગુરૂ સ્વામી.
૬. લાલ મનોહર મોહન મારા - આતમના આધાર-વાલા આતમના આધાર..
ભવસાગરની ભૂલવણીમાં - મને લવના લાગી લાય ૐ જય જય સદગુરૂ સ્વામી..

realpatidar.com

realpatidar.com

આરતી

ૐ જય જગદીશ હરે - પ્રભુ જય જગદીશ હરે,
ભક્તજનો કે સંકટ -ક્ષણમેં દૂર કરે-ૐ જય જગદીશ હરે.... વેલ...
૧. જો ધ્યાવે ફળ પાવે -દુઃખ વિનશે મનકા - પ્રભુ દુઃખ વિનશે મનકા
સુખ સંપતી ઘર આવે -કષ્ટ મીટે તનકા. ૐ જય જગદીશ હરે...
૨. માત પિતા તુમ મેરે -શરણ ગ્રહું મૈં કીસકી, પ્રભુ શરણ ગ્રહુંમેં કીસકી.
તુમ વિના ઔર ન દુજા- આશ કરૂં મેં કીસકી -ૐ જય જગદીશ હરે....
૩. તુમ પુરણ પરમાત્મા- તુમ અંતરયામી-પ્રભુ તુમ અંતરયામી.
પરીબ્રહમ પરમેશ્વર - તુમ સબકે સ્વામી - ૐ જય જગદીશ હરે....
૪ તુમ કરૂણા કે સાગર - તુમ પાલન કર્તા -પ્રભુ તુમ પાલન કર્તા.
મૈં મુરખ ખલકામી -કૃપા કરો ભર્તા.- ૐ જય જગદીશ હરે....
૫. તુમ હો એક અગોચર- સબકે પ્રાણ પતિ-પ્રભુ સબકે પ્રાણપતિ
કીશ વિધ મીલું દયામય - તુમકો મૈં કુમતિ - ૐ જય જગદીશ હરે...
૬. દીન બંધુ દુખ હર્તા -તુમ રક્ષક મેરે -પ્રભુ તુમ રક્ષક મેરે.
અપને હસ્ત બઢાઓ- ધ્વાર ખડા તેરે - ૐ જય જગદીશ હરે..
૭. વિષય વિકાર મીટાઓ-પાપ હરો દેવા-પ્રભુ પાપ હરો દેવા.
શ્રદ્ધા ભક્તિ બઢાઓ- સંતન કી સેવા- ૐ જય જગદીશ હરે....

થાળ

હરિ આવોને મારે ઘેર - સુખડાં દેવાને
આવી બેસો મંદિરીયામાંય - છોગલા છોડીને..... વેલ...
૧. હું લળી લળી લાગું પાય - લાજું મેલીને,
દયા કરોને દહીના નાથ - દાસો માથે રે. હરિ....
૨. મે'તો કોડે ઓસાવી સેવ - કપુરે વાસી રે,
આવી શીરાવો સાકર સેવ - હરિની છઉં દાસી રે. હરિ....
૩. મે'તો ભાવે બનાવી ભાત - દૂધી દાળ રે,
ઘણાં શાક કર્યા તૈયાર - તમુ કાજે રે. હરિ....
૪. મારે ઘેર ગાયુંનાં ઘી - પીરસું મારે હાથે રે,
શું કરશે દુરીજન લોક - શા માટે લાજું રે, હરિ....
૫. જળ જમુનાજીનાં નીર - વાલા જળ ટાઢાં રે,
આપું મુખવાસ બેડલાં પાન - એલચી જાજી રે.... હરિ....
૬. બાઈ મીરાંના ઠાકોર ઠીક - મારું મન મોહ્યું રે,
મેં તો ફરી જોયો જગ સંસાર - સર્વે ખારો રે.... હરિ....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n123/mode/1up

થાળ

realpatidar.com

કે વાલાને નોતરું દેવા ગઈ રે, હું તો ઘેલી ઘેલી થઈ,
ઘેલી ઘેલી થઈ રે, હું તો ભાન ભૂલી ગઈ. વાલાને વેલ...
૧. વાલો મારો જમવા આવ્યા ...ને નીંદર આવે નહિ,
વેલી ઊઠીને નાવા બેઠી - દાતણ ભૂલી ગઈ. .... વાલાને...
૨. ચણીયો પહેર્યો ને ચુડલી પેહરી- સાડી ભૂલી ગઈ,
કંકાવટી તો હાથમાં લીધી - વધાવવાને ગઈ........... વાલાને...
૩. ચંદન બેડાં હાથમાં લીધાં- જળ ભરવાને ગઈ,
ભર્યું બેડું ભૂલી ગઈને - ઠાલે બેડે ગઈ............ વાલાને....
૪. શીરો રાંધ્યો પુળીયું કરીયું - દાળ દાઝી ગઈ,
કઢીમાં તો દૂધ રેડ્યું ને - વઘાર ભૂલી ગઈ........ વાલાને....
૫. ખીરમાં તો મીઠું નાખ્યુ ને- ખીર ખારી થઈ,
ખીચડીમાં તો ખાંડ વેરીને - ખીચડી મીઠી થઈ..... વાલાને....
૬. પાટલે બેસીને પીરસવા બેઠી - થાળીયું ભૂલી ગઈ,
ત્રાંબા કુંડી જળે ભરી - મુખવાસ ભૂલી ગઈ......... વાલાને....
૭. તુલસી પાંદ આંગણે રોપ્યાં - રાજી રાજી થઈ,
પાસે બેસીને પૂછવા માંડી - રસોઈ કેવી થઈ....... વાલાને....
૮. વાલો મારો હસવા લાગ્યા - હાથમાં તાળી લઈ,
માતા જશોદા રોજ જમાડે - તારા જેવું નહિ....... વાલાને...
૯. વાલો મારો ઢોલીએ બેઠા - પાસે ઊભી રઈ,
વાલો મારો હસવા લાગ્યા - કેવી ખૂબી થઈ....... વાલાને...

થાળ

આવોને શામળા-મેલીને આમળા પ્રેમથી પીરસ્યો મેં થાળ એકવાર આવો આંગણીએ વેલ
૧. રામનામ રોટલીને - પુરણ છે પ્રેમનું પાંચ તત્ત્વોનાં પકવાન એકવાર .....
૨. આશા અથાણુંને - પાપડ તૃષણાનો બુદ્ધિ છે બાફેલું શાક -એક વાર...
૩. હૈયાને હીંચકે આપને હીંચાવસુ - બાંધીશું પ્રેમની દોર. એકવાર....
૪. અશ્રુ છે નીરનાથ - આંખો છે જારી - - મનડાંનો માનો મુખવાસ એકવાર....
૫. પ્રાણોને પાથરી બનાવશું મગન હો ચરણની પાસ. એકવાર....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n124/mode/1up

realpatidar.com

ચાબખો-૧લો

પ્રાણીયા ભજી લે ને કીરતાર - આતો સ્વપ્નું છે સંસાર વેલ...

૧. ધન દોલતને માલ ખજાના - પુત્ર અને પરિવાર,

તે તો તજી તમે જાસો રે એકલા - ખાસો જમનો માર. પ્રાણીયા....

૨. ઉંચી મેડીને અજબ જરૂખા - ગોખ તણો નહિ પાર,

છત્રપતી જેવા ચાલ્યા ગયા - એનાં રહ્યાં છે ઘરને બાર. પ્રાણીયા...

૩. ઉપર ફુલડાં ફર ફરે ને - હેકે શ્રી ફળ ચાર,

ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો - પછી પૂઠે પડે પોકાર..... પ્રણીયા....

૪. સેજ તળાઈ વિના સુતો નહિને - કરતો હુન્નર હજાર,

ખોળી ખોળીને બાળ સે - જેમ લોઢું ઘડે લુહાર. પ્રણીયા....

૫. શમસાને જઈને સેજ ખડકી - ઉપર કાષ્ટનો ભાર,

અગ્નિ મૂકીને અળગા રહેવે - પછી અંગે ઝરે અંગાર. પ્રાણીયા...

૬. સ્નાન કરવા સૌ ચાલ્યાં - મળી સઘળા નરને નાર,

ભોજો ભગત કહે દસદાડા રડી - વળતી મૂક્યો વિસ્સાર. પ્રણીયા...

ચાબખો-૨જો

જીવને શ્વાસ તણી સગાઈ - ઘરમાં ઘડી ન રાખે ભાઈ વેલ......

૧. બાપ કહે છે બેટો અમારો - માતા મંગળ ગાઈ,

બેની કહે છે બંધવ અમારો - ભીડ પડે ત્યાં ભાઈ જીવને......

૨. લીપ્યું ને ગુપ્યું આંગણુંને - કાઢવા વેળા થઈ,

અડસો માં તમે અભડાસો - એમ લોક કરે ચતુરાઈ. જીવને.....

૩. ઘરની નારી ઘડીએ ન મૂકે - અંતે અળગી રઈ,

ભોજો ભગત કહે કંથ વળાવી તરત બીજાને ગઈ. જીવને.....

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n125/mode/1up

realpatidar.com

ચાબખો-૩જો

મુરખો રળી રળી કમાંણો - માંથે મેલ સે મોટો પાંણો વેલ....

૧. ધાઈ ધુતીને ધન ભેળું કીધું - કોટી ધ્વજ કહેવાંણો,
પુણ્યને નામે પાઈ ન વાપરી - અધવચમાં લુટાંણો રે મુરખો....

૨. ભર્યા કોઠાર તારા ધર્યા રહેસે - નહિ આવે સાથે દાણો,
મશાણની રાખમાં રોળાઈ ગયા - કૈક રંક ને કૈક રાણા રે. મુરખો....

૩. મંદિર માળીયા મેલી કરીને - નીચે જઈ ઠેરાંણો,
ભોજો ભગત કહે મુવા પછી - જીવ ઘણો પસ્તાંણો રે. મુરખો...

ચાબખો-૪થો

ભક્તિ શિશ તણું સાટું રે - આગળ વશમી છે વાટું.. વેલ....

૧. એક દિવસ તો આવી બન્યું - રાજા મોર ધ્વજ ના માંથે,
કાશીએ જઈને કરવત મુકાવ્યું - પુત્ર ને પત્ની બેઉ તાંણે. ભક્તિ....

૨. સત્યને કારણે ત્રણે વેચાંણાં - રોહીદાસ ને રાણી,
ઋષિને વાસ્તે રાજા વેચાંણા - ભરવાને પાણી. ભક્તિ....

૩. શેઠ શગાળશા ને ચંગાવતી - જેણે એવું વ્રત લીધું,
ચેલૈયાનું શીશ કાપીને - સાધુને ધરી દીધું. ભક્તિ...

૪. પહેરો પટોળાં પ્રેમનાં ને - તમે શૂરવિર થઈને ચાલો,
ભોજો ભગત કહે ગુરૂ પ્રતાપે - તમે અમરાપુર મહાલો. ભક્તિ...

ચાબખો-પમો

જોઈ લ્યો જગતમાં બાવા રે - ધર્યા ભેખ ધુતીને ખાવા વેલ...

૧. જ્યાં પ્રેમદા ગણી પાણી ભરે ત્યાં - જાય નીત નીત નાહવા,
રાંડી છાંડી નારનો નર વેરન હોય - ત્યારે બાવોજી બેસે ગાવા. જોઈ લ્યો...

૨. લોકનાં છોકરાંને તેડી રમાડે - વળી પરાણે પ્રીત થાવા,
ગૃહસ્થની અસ્ત્રી રીસાઈ જાય - ત્યારે બાવોજી મનાવે જોઈ લ્યો...

૩. ધુપ કરે ને બાવો ધ્યાન ધરે - ભોળા લોકને ભરમાવા,
ભોજો ભગત કહે ભાવે સું સેવે - એને જમ પુરીએ જાવા. જોઈ લ્યો...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n126/mode/1up

realpatidar.com

ચાબખો ૬ઠ્ઠો

ભરમાવી દુનિયા ભોળી રે - બાવો ચાલ્યો ભભૂત ચોળી. વેલ...

૧. દોરા ધાગને વળી અઠી કરીને - આપે ગુણ કારૂ ગોળી,
જીવતાં હણતાં દયા ન આવે - જેમ ભીલ કાફર કોળી. ભરમાવી...

૨. નીત નીત દરશન નીમ ધરાવે - ઘેર આવે ત્રીયા ટોળી,
માઈ માઈ કરીને બાવો બોલાવે - હૈયે કામનાની હોળી. ભરમાવી....

૩. સગળા શિષ્યને ભેળા કરીને - ખાય ખીર ખાંડને પુળી,
ભોજો ભગત કહે ભવ સાગરમાં - બાવે માર્યા બોળી. ભરમાવી....

ચાબખો ૭મો

મુરખાની દાઢડી થઈ છે ધોળી - હ્રદયમાં નવ જોયું કાંઈ ખોળી વેલ....

૧. ખડ વાઢીને ભેગું કર્યું પણ - હાથ ન રહી કોડી,
વેચ્યા ટાંણે વેચ્યું નહિ - પછી પીઠ પડી મોળી રે... મુરખાની...

૨. બગલો થઈને આરે બેસતો - ચાંચ રાખતો પહોળી,
આરેથી કાંઈ આર મળ્યો નહિ - દરિયો નાખ્યો ડોળી..રે મુરખાની...

૩. મનખા દેહી જેવો મોલ પાક્યોને - તેમાં પડિયા કોળી,
વાવ્યા વિના તે કયાંથી પામસે - કોસું ખાસે ચોળી રે... મુરખાની...

૪. વારતાં વારતાં વારે ચડતો - માલ લાવતો ચોરી,
ભોજો ભગત કહે ત્રણ ચાર લાગ સે - તીર, તલવાર ને ગોળી રે. મુરખાની..

ચાબખો ૮મો

મન ચડ્યું મોટપ ને માળે રે - પ્રભુ એની વેળા કેમ વાળે વેલ....

૧. મહાજન કહે અમે ધર્મી કહેવાઈએ - દૂધ પાઈ મીંદડાંને પાળે,
મોટું થાય ત્યારે મોકળું મુકે - પછી ઉંદરનો દાટ વાળે. મન ચડ્યું....

૨. ચાર પાંચ ભેંસો આંગણે દુજે - છોરાંનાં પેટડાં બાળે,
આડોશી પાડોશી છાસ લેવા આવે ત્યારે - વાલાં સગાંનો સોગ પાળે. મન ચડ્યું...

૩. ખોટી દાનત તેથી ખાવા મળે નહિ - દીકરીનું ઘરેણું ગાળે,
સાસરે જાયને સાસુ પૂછે ત્યારે - માવતરનું મો વાળે. મન ચડ્યું....

૪. સોનું સોધે ને રૂપુ શોધે - કથીર ને શું ગાળે,
ભોજો ભગત કહે કાંસા કુટીને - પીતળ ને શું ગાળે.. મન ચડ્યું....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n127/mode/1up

realpatidar.com

ચાબખો ૯મો

મનવા રેને ભજનમાં ભળી - આતો વેળા જાય છે વળી. વેલ....

૧. જોબનના દહાડા જતા રહેસે - જેમ કરમાય કળી

જમ આવે કાંઈ જોર નહિ ચાલે - પછી પીંખાસે પળી. મનવા.....

૨. સંગર્યું હસે તે સાથે નહિ આવે, સરવે જાસે સળી,

હેત કરીને વાવરજે હાથે - બાકીનું જાસે બળી. મનવા....

૩. માનવી ઝાડ છે મુળ વિનાનું - ધર્મ વિણ જાસે ઢળી,

આગળ ખાવાને અભાગીયા - કાંઈક મૂડી લેને મલી. મનવા...

૪. કાળનું દળ તો કારમું આવ સે - દેહ નાખે દળી,

ભોજો ભગત કહે ધર્મ રહેસે - બીજું સરવે જાસે બળી.. મનવા...

ચાબખો ૧૦મો

જીવતું જોને અભાગીયા જાગી - તારા બાર માંથે બે ગયા વાગી.. વેલ....

૧. નાનો હતો ત્યારે કાંઈ ન સમજ્યો - મમતા ગણેરી લાગી,

ધોળાં આવ્યાં ને ધ્રુજવા લાગ્યો - પછી ઢીલા તે ઢોલ ગયા વાગી જીવતું...

૨. જોબનીયું તારું જસે જખમારતું - અને જરા જંજેરવા લાગી,

ઘરનો છોકરો વઢ વડે કરસે - કહે સે ઘરડાને મેલો કાઢી. જીવતું....

૩. માલ ખજાના દરિયામાં હોમ સે - વહાણ જાસે તારું ભાંગી

દરિયામાં ડૂબકાં દેશો પછી તો - લોભના લોર ગયા વાગી : જીવતું....

૪. પાંચ સાત ઘોડલે સામટો ચડતો - નોબત નગારાં ગયાં વાગી,

પાલખીમાં બેસી પાણી મંગાવતો - તારી કાયા લઈ જસે નાગી : જીવતું.....

૫. આજ કાલ કરતાં આવ્યો તારો વાયદો - નેણે ન જોયું જાગી,

ભોજો ભગત કહે કાંઈ ન સમજ્યો - શીખામણ નવ લાગી : જીવતું.....

realpatidar.com

https://archive.org/details/bk151/page/n128/mode/1up

realpatidar.com

ચાબખો ૧૧મો

મુરખા જનમ ગયો તારો રે - બાંધ્યો પાપ તણો તેં ભારો. વેલ....

૧. નામ સાંભળતાં નીંદ્રા આવે - હરી રસ લાગે ખારો,
અમૃત રસને અળગો કરીને - કર્યો વિષયરસ ખારો મુરખા.....

૨. મોહંધ થઈને માયા ખરચે - ત્યારે સગાં કહે સારો,
સાધુ દેખીને મોઢું સંતાડે - તે ધોયો ગરે ગાળો.... મુરખા....

૩. હમણાં તારો હુકમ ચાલે છે - દે છે સૌને ડારો,
ધર્મના દુત જ્યારે ધકા દેશે - ત્યારે કોઈ નથી તારો આરો.... મુરખા...

૪. હરી તલ તલનો હિસાબ લેસે - ને મોકમ દેસે મારો,
ભોજો ભગત કહે સદગુરૂ વિના - કોઈ નથી રાખણ હારો... મુરખા...

સાખીઓ

૧ તુલસી ધીરજ મન ધરો, હાથી મણ ભર ખાય,
ટૂકડા અન્ન કે કારણે - શ્વાન ઘરો ઘર જાય :

૨ શ્વાસ વિના સુમરન નહિ - ભય વિના ભક્તિ ન હોય,
પારસ મે પડદા રહા-લોહા કંચન કૈસે હોય :

૩ પ્રીત કરો તો ઐસી કરો - જૈસો મજીઠ કો રંગ,
તુટ તુટ કપડા ફટે - તોય રંગ ન છોડે રંગજી :

૪. પ્રીત કરો તો ઐસી કરો- જૈસો કરે કપાસ,
જીવતે તન ઢાંકત હય-મુવે ન છોડત સાથ :

૫ દોસ્ત વખાણીએ દાતણે - સગો વખાણીએ સાંઈ,
અસ્ત્રી વખાણીએ ત્યારે - ઘરમાં ન હોય કાંઈ :

૬ લાખ ગુમાવી સાંખ રાખવી - સાંખે મળશે લાખ,
લાખ રાખીને સાંખ ગુમાવે - સાંખ ગયે સબ ખાખ :

૭ સાધુ ભૂખ્યા ભાવકા-ધનકા ભૂખ્યા નાંહી,
ધનકા ભૂખ્યા જો ફિરે - સો તો સાધુ નાંહી :

૮ જલસે પતલા કૌન હે - કૌન ભુમી સે ભારી ,
કૌન અગ્નિ સે તેજ હય - કૌન કાજલ સે કાળી :

૯ જલસે પતલા જ્ઞાન હય - પાપ ભૂમી સે ભારી,
ક્રોધ અગ્નિ સે તેજ હય - દોષ કાદલ સે કાળી :

૧૦ સાચી સંગત સંતની - જીવ પણું ટળી જાય ,
સતસંગ વસ્તુ સત્ય છે, પાપી પાવન થાય :

૧૧ પ્રીત ત્યાં પડદો નહિ - પડદો ત્યાં નહિ પ્રીત,
પ્રીત પડદો દોનું રખે - ઓહી દુશ્મન કી રીત :

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n129/mode/1up

realpatidar.com

૧૨ સાધુને ઝોલો શબ્દનો - અને નરને ઝોલો નાર,
દીવાને ઝોલો પવનનો - ત્રણે ઉતરે નહિ ભવપાર :
૧૩ સાધુને જો સદ્દગુરૂ મળે - નરને મળે સુલક્ષણી નાર,
દીવાને પડદો મળે - તો ત્રણે ઉતરે ભવ પાર :
૧૪ બળ કરીને બાવો બન્યો - અને વૈરાગ્યનો વાળ્યો દાટ,
બોલાવે ત્યાં બેસી જતો - પછી વિવાહ હોય કે કાંણ :
૧૫ આનંદ કહે પરમાનંદ ને, માણસે માણસે ફેર,
વિદેશ ગયા નવિસરે - એક પાસે ન પોસાય :
૧૬ આનંદ કહે પરમાનંદને - માણસે માણસે ફેર,
એક લાખો દેતાં ન મળે - એક ત્રાંબીયાના તેર :
૧૭ સમજાવ્યા સમજે નહિ - જનાવરની જાત,
અખો ભગત કહે કેમ કરીએ નહિ અમારી નાત :
૧૮ ઘરના ધણીને રોજ ધમકાવે - બની બેસે રાણી,
મુવા પહેલા પુછી ન જોયું - હવે પીપળે રેડે પાણી :
૧૯ ઘટ ભેદી જો ગુરુ મીલે - સો પરખાવે જોય,
સો ગુરુ બ્રહ્મ સમ જાનીયે - અનુભવ કીયે હય સોય :
૨૦ મનકુ મારે તન દમે - ધનકુ ધર્મ લગાય,
કહે પ્રીતમ સોઈ સુરહય - રામ ધામ કુ જાય :
૨૧ સમજે જીતે સ્વભાવકુ - સ્વભાવ જીતે સોઈ સુર,
કહે પ્રીતમ સોઈ શૂરવીર - રહે પગ રોપી હજુર :
૨૨ ઈશ્વર નહિ આકારમાં - નહિ નીરાકાર રૂપ ,
આપમાં શોધી આપને - ઘરમાં રહેવું ચૂપ :
૨૩ ઈશ્વર નહિ પીંડ દેહમાં - નહિ પીંડથી બાર,
નુરત મીલાવો સુરતમાં - સો ઈશ્વર આપો આપ :
૨૪ કાચા ધાગા પ્રીતકા - મત તાંણો તુટ જાય,
તુટ્યા પછી સાંધીએ - તોય બીચમેં ગાંઠ રહી જાય :
૨૫ પાંચ તત્ત્વ કે ભીતરે - ગુપ્ત વસ્તુ કા સ્થાન,
વીરલે મરમ કો પાઈ હય - ગુરૂ કે શબ્દ પ્રમાન :
૨૬ જાના હય મરના નહિ - મરનાં વિસવા વીસ,
દો દીન દુનિયા કે લિયે - મત ભુલો જગદીશ :
૨૭ નામ જપતા કોટી ભલા - ચૂઈ ચૂઈ ગીરે જો ચામ,
કંચન દેહ કિસ કામ કો - જા મુખ નીકસે ન નામ:
૨૮. માલા શ્વાસ ઉશ્વાસકી - ફેરેંગે કોઈ દાસ,
ચોર્યાસી ભમે નહિ - કરે કાળકો ફાંસ :
૨૯ દયા ગરીબી બંદગી - શમતા સીલ સ્વભાવ,
ઈતને લક્ષણ સાધુ કે - કહે કબીર વિચાર :
૩૦ કબીર થોડા જીવના - માંડ્યા બહુત મંડાણ,
સભી છોડ કે ચલ ગયે - રાવ રંક સુલતાન :
૩૧ એક બુંદ કે કારણે - રોતા સબ સંસાર,
અનેક બુંદ ખાલી ગઈ - તીનકા કૌન બિચાર :
૩૨ અંતર હરી હરી હોત હય - મુખકી હાજત નહીં,
સહેજ ધુન લાગી રહે - સંતન કે ગટ માંહી :
૩૩ ભક્તિ દ્વાર હય સાંકડા - રાઈકા દસમાં ભાગ,
મન જબ મહાવત હો રહા - કયા કર શકે સમાય :

realpatidar.com

https://archive.org/details/bk151/page/n130/mode/1up

realpatidar.com

૩૪ સદ્દગુરૂ એસા કીજીએ - તુરત દીખાવે સાર,
પાર ઉતારે પલક મેં - દર્પણ દે દાતાર :
૩૫ રામ હય વહાં કામ નહિ - કામ નહિ વહાં રામ ,
દોનું એકઠે કયોં રહે - કામ રામ એક ઠામ :
૩૬ રામ નામ જાન્યો નહિ - કીયા ન હરિ સે હેત,
તાસે જનૂની ભારે મુંઈ - પત્થર પડીયા પેટ :
૩૭ આજ કાલ દીન પાંચમાં - જંગલ હોગા વાસ,
ઉપર લોક ફીર જાયગા - ઢોર ચરેગા ઘાસ :
૩૮ માયા સુખ ચાર દિન - ચાહે કહે ગમાર,
સ્વપ્ને પાયો રાજ ધન - જાતાં ન લાગે વાર :
૩૯ પીપળ પાન ખરતાં- હસતી કુંપળીયાં,
અમ વીતી તમ વીતસે - ધીરો બાપલીયાં :
૪૦ જ્યું નયન મેં પુતલી - ત્યું માલીક ઘટ માંય,
ભોલે લોક ન જાનતે - બાહેર ઢૂઢન જાય :
૪૧ સાંઇ તેરા તુઝમે રહે - જ્યું પથ્થરમેં આગ,
જ્યોતિ સરૂપિ રામ હય - ચીત ચકમક હો લાગ :
૪૨ ભટક મુંવા ભેદ વિના - કોન બતાવે ધામ,
ચલતે ચલતે જુગ ગયા - પાવ હોશ પર ગામ :
૪૩ ભક્તિ બીગડી કામીયા - ઈન્દ્રિ કેરે સ્વાદ,
જનમ ગવાયા ખાધમેં - હીરા ખોયા હાથ :
૪૪ પશુકી પનૈયાં ભઈ - નર કો કછુ ન હોય,
નર જો ઉત્તમ કરણી કરે - તો નરકો નારાયણ હોય :
૪૫ કહતે સો કરતે નહિ - મુખડા બડા લબાડ,
કાળા મુખ લે જાયગે - સાહેબ કે દરબાર :
૪૬ પાવ પલક કી ખબર નહિ - કરે કાલકી બાત,
જીવકે પર જમ ફીરત હય - જ્યું તેતર પર બાજ :
૪૭ ભક્તિ ઐસી કીજીએ - જયસો ટંકણ ખાર,
આપ જલે પર રીઝવે - તૂટ્યા સાંધણ હાર :
૪૮ નામ રહંતા ઠાકરા - નાણાં નહિ રહંત,
કિર્તી કેરા કોટડા - પાડ્યા નાહે પંડત :
૪૯ બ્રાહ્મણ ભયાતો કયા ભયા - ગલે મેં ડાલા સૂત ,
આતમજ્ઞાન કી ખબર નહિ - ભયા શમ સાનકા ભુત :
૫૦ ચંદન પડ્યા ચમાર ગર - નીત ઉઠે કૂટે ચામ,
ચંદન બીચારા કયા કરે - પડા નીચ સે કામ :
૫૧ ઊંચા કૂળ કીસ કામના - જ્યા નહિ હરિકો નામ,
તુલસી કુળનીચ ભલો - જીસ મુખ હરિકો નામ :
૫૨ ખેતર બગાડ્યું તાણખલે - સભા બગાડી કૂડ,
ભક્તિ બગાડી લાલચે - જેમ કેશરમાં પડી ધુળ :
૫૩ છીપ રહે નીત્ય સમુદ્રમાં - રતી જળ પરસે નહિ,
કહે પ્રીતમ એક સ્વાતકી - આશા ધરે મન માંહિ :
૫૪ પતિ વૃતા પતિ કો ભજે - નહિ અવરની આશ,
કહે પ્રીતમ રંગે રમે - પ્રેમ પીયા કે પાસ :
૫૫ પ્રેમ વિના પ્રપંચ છે - સેવા સમરણ ધ્યાન,
કહે પ્રીતમ શુદ્ધ પ્રેમ વિના - ફીકુ લાગે જ્ઞાન :

realpatidar.com

https://archive.org/details/bk151/page/n131/mode/1up

realpatidar.com

૫૬ બાળપણે ધ્રુવજીએ ભજ્યા - આદ્ય પુરૂષ અવિનાશ,
કહે પ્રીતમ અવિચળ થયા - ફરી નહિ ગર્ભવાસ :
૫૭ સંત બ્રહ્મકો હંસ હય - બ્રહ્મ સરોવર વાસ,
કહે પ્રીતમ મુગતા ચુગે- નિર્મળ નામ સુવાસ :
૫૮ નામ નિરંતર લીજીએ - મુકી માન ગુમાન,
કહે પ્રીતમ દુગ્ધા મટે - પ્રગટે પુરણ જ્ઞાન :
૫૯ સંત વદે તે શીતળ વેણ - કરૂણ ને અતી નિર્મળ નેણ,
ટાળે તાપ પ્રજાળે પાપ-આપે અખંડ બ્રહ્મનો જાપ :
૬૦ દડી પડી મેદાનમે - સૌ કોઈ રમવા જાય,
ઉંચ નીચ જાણે નહિ - જીતે સો લઈ જાય :
૬૧ મીથ્યા મુખ બોલે નહિ - બોલે તો હરિનામ,
કહે પ્રીતમ રૂદે વસે - જયું લોભીં કુ દામ :
૬૨ સહેજે સમરણ હોત હય - અખંડ અજંપા જાપ,
કહે પ્રીતમ સમજી સકે - ટળે શોક સંતાપ :
૬૩ કામી સુણે નહિ હરિ કથા - નહિ હરિજન શું હેત,
કહે પ્રીતમ કામી તણી - નીસ દીન ખાલી કાયા ખેત :
૬૪ કામ કપટ જીસકે ઘટમેં વસે - સો નર નીચ ગમાર,
કહે પ્રીતમ સુખ અલ્પ હે - અવગુણ કરે અપાર
૬૫ અજ્ઞાને મોહ ઉપજે - મોહે કરી બુદ્ધિ નાશ,
કહે પ્રીતમ બુદ્ધિ નાસતે - પ્રાણી નરક નિવાસ :
૬૬ કામ નેત્ર મુખ ક્રોધ કો - રૂદે લોભ કરે વાસ,
કહે પ્રીતમ તીનો મળી - કરે જીવકો વાસ:
૬૭ સજ્જન સદ્ગુણ દેત હય - કરે દુષ્ટતા દૂર,
કહે પ્રીતમ માને નહિ - માયા તણા મજૂર :
૬૮ સજ્જન થી સુખ ઉપજે - દુઃખ કો આણે અંત,
કહે પ્રીતમ પુરણ કળા - જાણે નહિ જડ જંત :
૬૯ સુખ નહિ સંસારમાં - રાજા પ્રજાને રંક,
કહે પ્રીતમ વૈરાગ્ય વિના - નર નહિ હોય નીશંક :
૭૦ તૃષ્ણા તું બહુ થાકી નહિ - ખાયો સબ સંસાર,
કહે પ્રીતમ કરૂં દૂરથી - કર જોડી નમસ્કાર :
૭૧ તૃષ્ણા તું બહુ પાપીણી - કીયા સબ લોક બેહાલ.
કહે પ્રીતમ કહું કેટલું - મુક અમારો છાલ :
૭૨ જબ રૂદામે હરી બસે - તૃષ્ણા ટળે વિરાટ,
પ્રીતમ કુંચી જ્ઞાનકી - ઉઘડે અગમ કપાટ :
૭૩ મન સબ પર અસવાર હય - મન પર કોઈક અસવાર,
કહે પ્રીતમ મન હાથ કરે - સોહી પુરૂષ નીરધર :
૭૪ તપ તીરથ આચાર વૃત્ત - ભણે બહુ શાસ્ત્ર પુરાણ ,
કહે પ્રીતમ મન વસ નહિ - તબ લગ મુરખ જાણ :
૭૫ શુદ્ધ ચિત્તે સ્મરણ કરે - તજે દેહ અભિમાન,
કહે પ્રીતમ આપા મટે - તબ ભેટે ભગવાન :
૭૬ અપને મુખે માગે નહિ - ધન, સંપત, સુખ, રાજ ,
કહે પ્રીતમ આનંદમેં - કરે પરમારથ કાજ :
૭૭ ભક્તિ ભાવ વિના માનવી - મુરખ મુઢ અજાણ ,
કહે પ્રીતમ કેસે રહે - પ્રેમ પીડ વીણ પ્રાણ :

realpatidar.com

https://archive.org/details/bk151/page/n132/mode/1up

realpatidar.com

૭૮ સનમુખ રહેના સિદ્ધ કુ - પ્રગટ પીના ઝહેર,
પ્રીતમ પડના અગ્નિમે - અગમ પ્રેમકી લહેર :
૭૯ પ્રેમ નિરંતર કીજીએ - સંત હરિ ગુરૂ સાથ ,
કહે પ્રીતમ ન્યારા નહિ - તારે ત્રિભુવન નાથ :
૮૦ એક નામ આધાર હય - નામ વિના નહિ કોય,
પ્રીતમ નામ ઉચારતાં - જીવ ટળી બ્રહ્મ હોય :
૮૧ નામ રતન અમૂલ હય - દીલ દરિયા કે માંહી,
કહે પ્રીતમ મરજીવા લહે - દુજા પાવે નાહિ :
૮૨ સંત સમો સંસારમાં - નહિ કોઈ પરમ દયાળ,
કહે પ્રીતમ એક પલકમાં - નજરે કરે ન્યાલ :
૮૩ કામ-ક્રોધ મધ મોહમાં - પામે નહિ પરિતાપ,
કહે પ્રીતમ શીતળ રહે - જપે અજંપા જાપ :
૮૪ ભક્તિ વિચારથી ઉપજે - ભક્તિ થી ઉપજે જ્ઞાન ,
જ્ઞાન થકી હું તું ટળે - પ્રીતમ પ્રેમ નીધાન :
૮૫ શત્રુ મિત્ર સમાન ચીત - સરખુ કંચન લોહ,
કહે પ્રીતમ જ્ઞાની વિશે - નહિ મમતા મધ મોહ :
૮૬ જેવા તેવા મનુષ્યને - કદી ન કરવો બોધ,
માળો વિખ્યો સુગરીનો - વાંદરે કરી ક્રોધ :
૮૭ કુસંપ કરવો નહિ કદા - કદી ન કરવો કલેશ,
મધુર વચન ઉચારવાં - આનંદ રહી હંમેશ :
૮૮ લજ્જા ધરવી લોકની - પરમેશ્વરની બીક,
સત્ય સદા ઉચારવું - કામ જ કરવા ઠીક :
૮૯ સગપણ સાચું શ્યામનું - બીજું જાુઠું જાણ,
માત-પિતા સુત બેનડી - બંધવ પત્ની પરમાણ :
૯૦ વાત કરે વેદાંતની- મુકે ન મનનો મેલ,
શંકર એવા સંતનો - સુધરે કયાંથી ખેલ :
૯૧ દુરીજન મુખમાં કુવચન - સજ્જન મુખમાં મીઠાસ ,
હોય સુગંધી બાગમાં - ગંધાતો સંડાસ :
૯૨ દુષ્ટ તજે નહિ દુષ્ટતા - ભલે કરો સતકાર ,
નિત્ય દુધ પાઓ નાગને - પણ કરડે કો વાર :
૯૩ અમે તમે સૌ સગા છીએ - એકજ હરિના બાળ,
શંકર કહે સંપીને સૌ - સમરો દીન દયાળ :
૯૪ સૌ જીવને સરખા ગણે - રાખે ન રાગ દ્વેશ,
શંકર એવા સંતને - કદી ન પીડે કલેશ :
૯૫ માળા લીધી હાથમાં - હૈયા માંહી હાય,
શંકર કહે એવા ભગતડાં - કયાંથી વૈકુંઠ જાય :
૯૬ સત સંગ સમ સરિતા નહિ - કુસંગ સમ નહિ કુપ,
શંકર કહે સદ્ગુરૂ સમા - કોઈ ન જોયા ભૂપ :
૯૭ આ દુનિયા છે સ્વાર્થની - સ્વાર્થ વિના નહિ વાત,
ગરજ પડે કાકા કહે - પાછળ મારે લાત :
૯૮ શંકર આ સંસારમાં - દમડીનાં સૌ દાસ,
ખાલી ખીસા હોય તો - કોઈ ન આવે પાસ :
૯૯ ગુરૂજ્ઞાની ઐસા કસે - જૈસે લોહ લુહાર,
સબી મીટાવે કલ્પના - દીખાવે આપ દીદાર :

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n133/mode/1up

realpatidar.com

૧૦૦ પીડ પરાઈ જોઈને - દિલ જેનુ દુભાય,
શંકર પીડે ન કોઈને - જ્ઞાની તે લેખાય :
૧૦૧ સંગત બિચારી કયા કરે - જાકા હૃદય કઠોર,
નવ નેજા પાણી ચડે - પત્થર ન ભીંજે કોર :
૧૦૨ માખી ચંદન પર હરે - દુર્ગંધ હોય ત્યાં જાય,
મુરખ જનને ભક્તિ ભાવે નહિ - ઉંગે કાં ઉઠી જાય :
૧૦૩ જીતને તારે ગગનમેં - ઈતના શત્રુ હોય,
કૃપા ભઈ રઘુનાથકી - તો વાળ ન ઉખડે કોય :
૧૦૪ હંસા પ્રીત કાયકી - વિપત પડે ઉડ જાય,
સાચી પ્રીત સેવાળકી - જળ ભેળી સૂકાય :
૧૦૫ માયા ઐસી ડાકીની - ખાયો સબ સંસાર,
એક ન ખાયો કબીરો - રહ્યો નામ કે આધાર :
૧૦૬ મુડદે કો ભી દેત હય - કપડા લતા આગ,
જીવત નર ચિંતા કરે - તાકા બડા અભાગ :
૧૦૭ કાજલ તજે ન શ્યામતા - મોતી તજે ન શ્વેત,
દુરીજન તજે ન કુટીલતા - સજ્જન તજે ન હેત :
૧૦૮ કર્મ કર્મ સબ કોઈ કહે - કર્મ ન ચિન્હે કોય,
જો મનકા બંધન બને - કર્મ કહાવે સોય :
૧૦૯ હરિજન તો હારા ભલા - જીતન દે સંસાર,
હારા સો હરી મીલે - જીતે જમકે દ્વાર :
૧૧૦ બુરા દેખન મેં ચલા - બુરા ન મિલીયા કોય,
અપના દીલ જો ખોજીએ - તો મુજસે બુરા ન કોય :
૧૧૧ કંચન તજવો સહેલ હય - તજવો ત્રીયા કો નેહ,
માન બડાઈ ને ઈર્ષા - દુર્લભ તજવાં તેહ :
૧૧૨ બડા બડેકો દેખ કર - છોટા ન દીજીએ ડાર,
કામ પડે જબ સોય કા - તો કયા કરે તલવાર :
૧૧૩ હદ મેં રહે સો માનવી - બે હદ ચલે સો સાધ,
હદ બેહદ દોનું તજે - તાકા મતા અગાધ :
૧૧૪ ગુરૂ સેવાજન બંદગી - હરી સમરણ વૈરાગ,
એ ચારો તબ મીલે - જો પુરણ હોય ભાગ :
૧૧૫ હરી કૃપા તબ જાણીએ - દે માનવ અવતાર,
ગુરુ કૃપા તબ જાણીએ - છોડાવે સંસાર :
૧૧૬ ચાર ચિહ્ન હરી ભક્ત કે - પ્રગટ દીખાઈ દેત,
દયા, ધર્મ, આ દીનતા - પર દુઃખ કો હર લેતઃ
૧૧૭ સુખમેં સમરણ ન કીયા - દુખમેં કીયા જો જાદ,
કહે કબીર તા દાસ કી - કોન સુને ફરિયાદ :
૧૧૮ મુખસે જપે સો માનવી - મન સે જપે સો દેવ,
સુરત જપે સો સંત હે - ઈસ વિધ જાણે ભેદ :
૧૧૯ ગવૈયા કે મુખ બસું - શ્રોતા કો મેં કાન,
જ્ઞાની કે હૃદય બસુ - ભેદી કા નીજ પ્રાણ :
૧૨૦ કીરતનીયા સે કોસ બીસ - સંન્યાસી સે ત્રીસ,
બીરહી કે હૃદય બસુ - વૈરાગી કે શીષ :
૧૨૧ લીખના પઢના ચાતુરી. એ બાતાં સબ સહેલ,
કામ, દહન, મન વસ કરના - ગગને ચડના મુશ્કેલ :

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n134/mode/1up

realpatidar.com

૧૨૨ દરસન કો તો સાધુ હય - સમરણ કો હરિ નામ,
તરને કો આ દીનતા - ડૂબને કો અભિમાન :
૧૨૩ મૈં અપરાધી જનમકા - નખ શીષ ભરા વિકાર,
તુમ દાતા દુઃખ ભંજના - મેરી કરો સંભાળ :
૧૨૪ ગજ સરિતા લેત હય - અવળી ચલે મીન,
જા જીસમેં બસે - ઈસમેં હોય પ્રવિણ :
૧૨૫ ત્યાગ તો એસા કીજીએ - સબ કુછ એક હી વાર,
સબ પ્રભુકા મેરા નહિ - નિશ્ચય કીયા બિચાર :
૧૨૬ તન કી ભૂખ તો તનીક હય - તીન પા ઔર સેર,
મન કી ભૂખ તો અનંત હય - નીકલત મેરુ સમેર :
૧૨૭ પરજનને ઉપદેશ દે - નિજમાં કોટી કુટેવ,
ધોબી ધુવે પટ પારકા - નીજ પટમાં મણ મેલ :
૧૨૮ કરણી કરે કાગદી - ચલે હંસ કી ચાલ,
પુંછ પકડે શીયાળ કા - કીસ વીધ ઉતરે પાર :
૧૨૯ મનકે બહુત રંગ હય - છીન છીન બદલે સોય,
એક રંગમેં જે રહે - ઐસા વિરલા હોય :
૧૩૦ સતી સ્વાંગ ન ઉતરે - આનંદ આઠે પહોર,
કહે પ્રીતમ નીજ પતિ વિના - ભાવ ધરે નહિ ઓર :
૧૩૧ સરોવર સરિતા સમુદ્ર જળ -જ્યાં ત્યાં ભરે અપાર,
પ્રીતમ ચાતક ચાંચદે - પીએ ના એક લગાર :
૧૩૨ ઐસે સુખ સંસાર કો - અન્ય ના ઈચ્છે મન,
કહે પ્રીતમ પુરણ રહે - આનંદમેં નીસ દીન :
૧૩૩ ચકોર નીહાળે ચંદ્રકુ - શસીબીંબ રૂદીયા મોઝાર,
કહે પ્રીતમ પાવક ભખે - દાઝે નહિ લગાર,
૧૩૪ વૈરાગ્ય વિના વળગી રહ્યો - માયાની મધ લાળ,
કહે પ્રીતમ સુખ અલ્પહય - દુઃખ ભોગવે કંઈ કાળ :
૧૩૫ જીવતે કહે મેરા પતિ - જબ લગ પહોંચે આશ,
કહે પ્રીતમ શ્વાસા મટે - પલક ન આવે પાસ :
૧૩૬ જબ લગ અંતર આત્મા - તબ લગ દેહ અમૂલ,
કહે પ્રીતમ ચેતન ચલા - કરમાયા તન ફૂલ :
૧૩૭ મુસા મન હરખત ફીરે - માલ પરાયા ખાય,
કહે પ્રીતમ મળે મીનકા - જીવ પલકમાં જાય :
૧૩૮ કામ ક્રોધ મધ લોભ મોહ - ધન લુંટે ચૌ ઓર,
કહે પ્રીતમ ભેળા રહે - અપને ઘરમેં ચોર :
૧૩૯ પ્રેમ પંથ અતી કઠીન હય - જૈસા ખંડા ધાર,
કહે પ્રીતમ લક્ષ કરોડમાં - કોઈક પહોંચે પાર :
૧૪૦ પ્રેમ નિરંતર કિજીએ - સંત હરિ ગુરુ સાથ,
કહે પ્રીતમ ન્યારા નહિ - તારે ત્રીભુવન નાથ :
૧૪૧ પ્રેમ રતન અમૂલ હય - સદ્‌ગુરૂ સંત કે હાટ,
કહે પ્રીતમ કૈસે મીલે - મોંઘો માથા સાટ :
૧૪૨ પ્રેમ સુધા રસ પીજીએ - સોંપી તન મન શીષ,
કહે પ્રીતમ પ્રેમી મળે - તો પ્રાણ કરૂં બક્ષિસ :
૧૪૩ સોળ વરસની સુંદરી - નખ શીખ સજે શણગાર,
કહે પ્રીતમ ભેળાં રહે - ન મળે વિષય વિકાર :

realpatidar.com

realpatidar.com

૧૪૪ જ્ઞાન જ્ઞાન સબ કોઈ કહે - આતમ જ્ઞાન સો જ્ઞાન,
કહે પ્રીતમ પારસમણી - ઓર સબે પાસાણ :
૧૪૫ હું કારે આવી અડ્યું - દાનવ માનવ દેવ,
કહે પ્રીતમ સમજાવતા - ટળે નહિ અહમેવ :
૧૪૬ હું કારે હરી વેગળા - હું નું કામ કઠોર,
કહે પ્રીતમ ભાગેં નહિ - હુંકા જબરા જોર :
૧૪૭ વિચાર વિના જે જે કરે - તે સૌ સાધન ફોક,
કહે પ્રીતમ સુખ નહિ મળે - યહ લોક પરલોક
૧૪૮ વચન વિચારી બોલીએ - વચને ટળે વિરોધ,
વિના વિચાંરે પ્રિતમ કહે - બોલે ઊપજે ક્રોધ :
૧૪૯ અધમ અજામીલ ખાતકી - અતી મતી મંદ ગમાર,
કહે પ્રીતમ હરી નામ તે - સહેજે પાયે પાર :
૧૫૦ રામ નામ જોગી જપે - તપે નહિ ભવ તાપ,
કહે પ્રીતમ મન જીત કે - જપે અંજપા જાપ :
૧૫૧ રામ નામ પારસ મમી - ન લોહા હોય હેમ,
કહે પ્રીતમ એક નામ સે કરહું નિરંતર પ્રેમ :
૧૫૨ મન હરિજન ઘરમાં રહે - કરે દગો દીન રાત,
કહે પ્રીતમ કયાં કિજીયે - મન ચંચળ બદ જાત :
૧૫૩ કથા શ્રવણ કરે મીનકા - સીર દીપક ધરી દેવ,
કહે પ્રીતમ મુસા મીલે - જાઈ પકડે તત ખેવ :
૧૫૪ બાહેર શત્રુ બહુ હણે - જે કોઈ સુરા હોય,
કહે પ્રીતમ મન ભીતર રહે - માર શકે નહિ કોય :
૧૫૫ મનકી હારે હારીએ - હોય મનકી જીતે જીત,
મન મીલાવે રામકુ - મન કર દેવે ફજિત :
૧૫૬ ગુરૂ મુખ વાણી ઓચરે - શીષ્ય સાચ કરી જાણ,
ઈવ વિધ બંધન છૂટ સે - ઓર જાુગતી ન આણ :
૧૫૭ તૃષ્ણા મારી ભરથરી - છોડી માયા મોહ,
કહે પ્રીતમ બ્રહ્મ રસ પીયો - મીટા હું તું દોય :
૧૫૮ તૃષ્ણા બેટી લોભકી - હય પ્રૌઢા પરિવાર,
કહે પ્રીતમ પ્રપંચ કરી - ખાયા સબ સંસાર :
૧૫૯ તૃષ્ણા ટાળે સદ્‌ગુરુ - જાકે હાથ ઈલાજ,
કહે પ્રીતમ સમજણ વિના - સબ તન તૃષ્ણા રાજ :
૧૬૦ તૃષ્ણા પીડે તબ લગ - જબ લગ નહિ ગુરૂ જ્ઞાન,
કહે પ્રીતમ પીછયા વિના - મીથ્યા દેહ અભિમાન:
૧૬૧ અસંતને અડીયે નહિ - અડકે ઉપજે સ્નાન,
કહે પ્રીતમ તજ તેહને - સુકર સ્વાન સમાન :
૧૬૨ અસંત ઉરગથી નીચ છે - વાણી વિસે વિકાર,
કહે પ્રીતમ સંગ દુષ્ટ ને - જન્મે મરે બહુ વાર :
૧૬૩ અસંત અમંગળ આત્મા - કદી ન કરીએ સંગ,
કહે પ્રીતમ સાધન ખડે - પડે ભજનામાં ભંગ :
૧૬૪ અસંત અવિદ્યા રૂપ છે - ઉપજાવે અજ્ઞાન,
કહે પ્રીતમ સર્વે ભૂલે - ભજન સ્મરણ તપ ધ્યાન :
૧૬૫ દુષ્ટ તણો નહિ દેશ - દુષ્ટનાં નગર ન હોય,
પ્રીતમ દુષ્ટ સ્વભાવ છે - સંત કહે સબ કોય :

realpatidar.com

https://archive.org/details/bk151/page/n136/mode/1up

realpatidar.com

૧૬૬ લક્ષણ લખીને રાખીયે - સમજી કરીએ પ્રીત,
કહે પ્રીતમ કહું કેટલું - રાખો રૂદે પ્રીત :
૧૬૭ હરી રૂઠે ગત એક હય - ગુરૂ શરણાગત જાય,
ગુરૂ રૂઠે ગત એકે નહિ - તાકુ હરિ ભલે હોય સહાય :
૧૬૮ ગુરૂ ગુંગા ગુરૂ બાવરા - ગુરૂ દેવન કો દેવ,
તું શિષ્ય હય સિંહનકા - તો કર ગુરુ કી સેવા :
૧૬૯ ગુરૂ હય નારદ જૈસા - ગુરુ હય મચ્છી માર,
વા ગુરૂકી નીંદા કરે - તો પડે ચોર્યાસી માંય :
૧૭૦ ગુરૂ સંગત એસી મીલે - જૈસી ટંકણખાર,
આપ જલે પર રીઝવે - તૂટ્યા સાંધણ હાર :
૧૭૧ ધામ ધરા ધન નારી સુત - પાપી કે ઘર હોય,
સંત સમાગમ હરી ભજન- તુલસી દુર્લભ સોય :
૧૭૨ કહાં કાશી કહાં કાશમીર - કહાં વૃજ કહાં ગુજરાત,
તુલસી પ્રારબ્ધ જીવકો - એસે ત્યાં લે જાત :
૧૭૩ પરમેશ્વર સે પ્રીત - અરૂ પર નારી સે હસના,
તુલસી દોનુ ન બને - લોટ ખાય અરૂ ભસના :
૧૭૪ માયા સે માયા મીલે - કર કર લંબે હાથ,
તુલસી રંક ગરીબકી - કોઈ ન પુછે વાત :
૧૭૫ નીચ નીચાઈ ન તજે - જો પાવે સતસંગ,
તુલસી ચંદન લપટકે - વીશ ન તજે ભુજંગ :
૧૭૬ પ્રારબ્ધ તો પહેલે બના - પીછે બના શરીર,
તુલસી યહ આશ્ચર્ય હય-મન નહિ બાંધે ધીર,
૧૭૭ અરબ, ખરબ લો ધન મીલે - ઉદય અસ્ત લો રાજ,
તુલસી હરી કે ભજનબીન - સબે નરક કો સાજ :
૧૭૮ તુલસી તલબ ન છોડીયે - નિશ્ચે લીજે નામ,
મનુષ્ય મજુરી દેત હય - કયું રખેગો રામ :
૧૭૯ તુલસી ઉત્તમ પુરૂષ કુ - કયા કર સકે કુસંગ ,
ચંદન વિષ વ્યાપે નહિ - લપટ રહત ભુજંગ :
૧૮૦ તુલસી આ સંસારમાં - પંચ રત્ન હય સાર,
સાધ મીલન અરૂ હરિ ભજન - દયા દાન ઉપકાર :
૧૮૧ તુલસી યુગમાં યું રહો - જયું જીભ્યા મુખ માંય,
ગીવ તણા ભક્ષણ કરે - તો બી ચીકણી નાંય :
૧૮૨ તુલસી કહે ઈસ જગતમે - સબસે મીલીયે ધાય ,
કયા જાને કીસ બેસમેં - નારાયણ મીલ જાય :
૧૮૩ તુલસી હરી દરબારમેં - કમી વસ્તુ કુછ નાંહી ,
કર્મ હીણ કલપત ફીરે - ચૂક ચાકરી માંહી :
૧૮૪ તુલસી ગરીબ ન સંતાપીએ - બુરી ગરીબ કી હાય,
મુઆ ઢોર કે ચામસે - લોહા ભસ્મ હો જાય :
૧૮૫ ખેલ છે ખેમ્યા તણો - ને કીમત છે ભેદ માંહી,
પગલે પંથે બૌત ચડ્યા - નથી દોડ્યા નું કામ :
૧૮૬ હિન્દુ જપે રામ રામ - મુસલમાન ચે અલ્લા,
મુંએ નાથ મેકણચે - બય ઘર ભલા :
૧૮૭ મું ભાયો તડ હેકડી - પણ તડ હય લખ હજાર,
જે જેકો જલી - સે તરી થેયા પાર :

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk151/page/n137/mode/1up

realpatidar.com

૧૮૮ પીપર મેં પણ પ્રાણ - નાંય બાવર મે બ્યો,
નીમ મેં ઉ નારાયણ - પોય કંઢેમેં કયો :
૧૮૯ નીજ મન તો નીચા કીયા - ચરણ કમળ કી ઠોર -
કહે કબીર ગુરૂદેવ વિના - મારી નજરે ન આવે ઓર.
૧૯૦ ભારી કહું તો મે ડરું - હલકા કહું તો જાુઠ -
મેં કયા જાણુ રામકુ - આ નૈણે કબુ ન દીઠ.
૧૯૧ દેખા હય સે કીસે કહું - કોણ પૂરે પતી પાય
મેં કયા જાણું રામકુ - મેરા હરખ હરખ ગુણગાય.
૧૯૨ પ્રથમ નમુ ગુરૂ દેવને - જેણે આપ્યું નીજ જ્ઞાન
જ્ઞાને ગોવિંદ ઓળખ્યા - ટળ્યું દેહ અભિમાન
૧૯૩ ગુરૂ ગોવિંદ દોનું ખડે - કીસકુ લાગું પાય,
બલિહારી ગુરૂ દેવકી - ગોવિંદ દિયા બતાય.
૧૯૪ પ્રથમ કોને સમરીએ - અને કીસકા લીજે નામ,
માત પીતા ગુરૂ આપણા - અલખ પુરુષનાં લીજે નામ.
૧૯૫ ધરતી કા કાગદ કરું - કલમ કરું વનરાય-
સાત સમુદ્ર કી સાઈ કરું - તોય હરીના ગુણ લખ્યા ન જાય
૧૯૬ તન મન તાકુ સોપીએ જા કુ વિષયા નહિ,
આપા સબ ડાલ કે - આવે સાહેબ માંહિ
૧૯૭ સારા શુરા બહુ મીલે - ઘાયલ મીલે ન કોઈ,
પણ ઘાયલ કુ ઘાયલ મીલે - તબ રામ ભક્તિ દૃઢ હોય
૧૯૮ મન રાજા મન રંક હય - મન કાયર મન સુર,
સુન શીખર પર મન રહે - તબ મસ્તક આવે નુ

તોટક છંદ

સતનું ચીત ચીંતન રે કરવું - સત્ય વાચકની સાથે ઉચરવું,
નહિ કામ અસત્ય કદી કરવું - જશથી જળકીત જગે ફરવું.
સત બીજથી વૃક્ષ વિશાળ થશે - ગુણ કારી મીઠાં ફળ ઉતરશે,
જન આશ્રય છાંય તળે કર સે - પરિતાપ જતાં સૌ સુખ મળશે.
સતમાં જગતનાં સૌ કાજ વસે અસતે જન આફતમાં પડશે,
સતે સૂરજ તેજ ગણું પ્રગટે - છળ દુષ્ટમતી ભય પામી હટે.
કોઈ કારણ સત્ય છુપાઈ જશે - પણ છેવટે સત્યનો ઉજાસ થશે,
કદી સૂરજ વાદળથી છીપસે - છૂટી નિશ્ચિત ફરીથી દીપસે.
સતને નથી આંચ ન નાસ કદી - જગ જીતવું સત્ય સદાય વદી,
બળ સત્ય સમુ નથી અન્ય ખરે - સત્ય નિશ્ચિત કલેશ અનેક હરે.
સતમાં સુખ સાચું સદાય વસે - સત્યથી અતિ વિશ્વ પતી રિઝશે,
નથી સત્ય વિના કાંઈ ધર્મ બીજો - જીતી સત્યથી સ્વર્ગ સદાય રીઝે.

realpatidar.com

https://archive.org/details/bk151/page/n138/mode/1up

realpatidar.com

નોંધનું પાનું

realpatidar.com

realpatidar.com

નોંધનું પાનું

realpatidar.com

realpatidar.com



શ્રી ગાયત્રી માતાજી

realpatidar.com

realpatidar.com

realpatidar.com